

ઉદ્યોગ અને ખાણ વિભાગ
કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૩૯૪(૨) અન્વયે
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડનો તૃતીય વહીવટી અહેવાલ
(નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧)

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (BRCL) કંપની ધારા, ૨૦૧૩ હેઠળ નોંધાયેલ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને માણતી સુઝુકી ઈન્ડીયા લિમિટેડ સાથેની જોઇન્ટ વેન્યર સરકારી કંપની છે. જેની સ્થાપના તા.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ થયેલ છે.

આ કંપનીની રચના ગુજરાત રાજ્યના કટોસણ રોડ-બેચરાજી-ચાણસ્મા-રણજ (૬૫ કીમી) લાઇનના ગેજ કન્વર્ઝન માટે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો, ધીરાણીકરણ, આયોજન અને અમલીકરણ અર્થે થયેલ છે.

ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબની પ્રોજેક્ટની ગતિવિધિઓ હાથ ધરેલ છે :

એ) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓ માટે ટેન્ડરની પ્રક્રિયા કરવી અને ટેન્ડર ફાળવણીની કામગીરી એટલે કે ટ્રાન્ઝેક્શન એડવાઇઝરની કામગીરી જી-રાઇડને સોંપવામાં આવેલ છે. પ્રોજેક્ટના તબક્કા -૧ અને તબક્કા - ૨ માટેના ઈપીસી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે.

બી) ફિલ્ડ સુપરવિઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.

સી) અન્ય રોજીંદા કામકાજો પ્રોજેક્ટના સરળ પ્રગતિ માટે હાથ ધરેલ છે.

ડી) પ્રોજેક્ટને લગતી જમીન સંપાદનની પ્રક્રિયા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટ કચેરી સાથે સંકલન પ્રગતિમાં છે.

ઇ) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓની પ્રગતિનું દેખરેખ રાખવામાં આવેલ છે.

એફ) પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ માટે રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન પ્રગતિમાં છે.

કંપની મેનેજમેન્ટ આશાવાદી છે કે, કંપનીની દરેક ગતિવિધિઓને વેગ આપશે અને આવનારા વર્ષોમાં પ્રોજેક્ટનું અમલીકરણ ઝડપી કરશે.

કંપનીના રીપોર્ટીંગ સમયગાળા દરમિયાન રૂ.૧૪,૯૮,૭૯૨/- નો નફો થયેલ છે.


અધિક મુખ્ય સચિવ

ઉદ્યોગ અને ખાણ વિભાગ,
ગુજરાત સરકાર



બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન: યુઝપ૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

શ્રીજો વાર્ષિક અહેવાલ

(નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧)

તારીખ : ૨૮/૦૮/૨૦૨૧
સમય : ૦૪:૪૫ કલાકે
સ્થળ : બ્લોક નં. ૬, ૭મો માળ,
ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧,
ગાંધીનગર-૩૮૨૦૧૧, ગુજરાત.

: રજીસ્ટર્ડ ઓફિસ :

બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ

બ્લોક નં. ૬, ૭મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧.

ફોન : ૦૭૯-૨૩૨-૩૨૭૨૮/૨૯, ઈ-મેલ : info@brcl.org.in

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નં.
૧.	બોર્ડના નિયામકો	૪
૨.	ત્રીજા વાર્ષિક સામાન્ય સભાની નોટીસ	૫
૩.	સંચાલક મંડળનો અહેવાલ	૬
૪.	ઓડીટરનો સ્વતંત્ર અહેવાલ	૨૧
૫.	સરવૈયું	૩૫
૬.	નફા-નુકસાનનો હિસાબ	૩૭
૭.	રોકડ પ્રવાહ પત્રક	૪૦
૮.	નાણાકીય પત્રકોની નોંધો	૪૨

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

સંચાલક મંડળ

ક્રમ	નિયામક અને મુખ્ય વહીવટી અધિકારીનું નામ	ડીઆઈએન/ પાન	હોદ્દો
૧	શ્રી અશ્વિનીકુમાર રાજેન્દ્રપ્રસાદ યાદવ	૦૬૫૮૧૭૫૩	ચેરમેન
૨	શ્રી બજરંગ વર્લી ઇગનભાઈ	૦૭૧૩૩૯૪૨	નિયામક
૩	શ્રી સંતોષ કુમાર	૦૭૮૫૪૧૭૯	નિયામક
૪	શ્રીમતી કવિતા રાકેશકુમાર શાહ	૦૮૨૬૮૫૫૮	નિયામક
૫	શ્રી બચ્ચુ વેનુગોપાલ	૦૮૩૦૩૬૮૭	નિયામક
૬	શ્રી રાજ સ્વરૂપ કપુર	૦૮૩૦૩૬૮૮	નિયામક
૭	શ્રી સંતોષ કુમાર	એએફપીપીકે૫૭૭૬ડી	સીઈઓ (કેએમપી)
૮	શ્રી શંભુપ્રસાદ નાગેશ્વર જોશી	એબીઈપીજે૬૫૬૮કે	સીએફઓ (કેએમપી)

વૈદ્યાનિક ઓડિટર:

મેસર્સ શાહ એન્ડ દલાલ,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
અમદાવાદ.

બેન્કર્સ:

યસ બેન્ક, ગાંધીનગર.
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર.

રજીસ્ટર્ડ ઓફિસ :

બ્લોક નં. ૬, ૭મો માળ,
ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧.

ત્રીજા વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપની બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડની ત્રીજા વાર્ષિક સામાન્ય સભાની બેઠક મંગલવારે, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૪:૪૫ કલાકે (શોર્ટ નોટીસમાં) વીડીયો કોન્ફરન્સીંગ/ ઓએવીએમ મોડ દ્વારા બ્લોક નંબર ૬, ૭મા માળે, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧ ખાતે રાખવામાં આવેલ છે અને તેમાં નીચે મુજબની કાર્યવાહીઓ હાથ ધરવા માટે રાખવામાં આવેલ છે.

સામાન્ય કાર્યવાહી :

૧. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂર્ણ થતી આ કંપનીની ઓડીટેડ નાણાંકીય પત્રકોને પ્રાપ્ત કરવા, ચકાસવા અને મંજૂર કરવા અને તેની સાથો સાથ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ઓડીટરોના રીપોર્ટ અને કોમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ બાબતે ઘટતું કરવા સારું.
૨. શ્રીમતી કવિતા શાહ (ડીન : ૦૮૨૬૮૫૫૮) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે. તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તિ માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારું.
૩. શ્રી બચ્ચુ વેનુગોપાલ (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૭) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે અને તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી ફરીથી નિયુક્તિ માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારું.
૪. કંપનીના નિયામકોના બોર્ડને કંપનીના વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષના હિસાબોના ઓડીટ માટે સીએજ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટેચ્યુટરી ઓડીટરોના પગાર/ભથ્થા નક્કી કરવા માટે પરવાનગી આપવા સારું.

નોંધાયેલ ઓફિસ :

બ્લોક નં. ૬, ૭મો માળ,
ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨ ૦૧૧

બોર્ડના નિયામકોના હુકમ મુજબ

સહી/-
ચેરમેન/નિયામક

તારીખ : ૨૮-૦૯-૨૦૨૧

નોંધ :

૧. આ અહેવાલના કોઈ પણ ભાગને લગતી માહિતી મેળવવા ઈચ્છુક કોઈ પણ શેર ધારકે આ બાબતે કંપનીને અગાઉથી જ લેખિતમાં જાણ કરવી જેથી કે મેનેજમેન્ટ દ્વારા જરૂરી માહિતી સમયસર તૈયાર કરી શકાય.

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

રજીસ્ટર્ડ ઓફિસ: બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૧

સંચાલક મંડળનો અહેવાલ

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

ગાંધીનગર, ગુજરાત.

તમારા નિયામકોને બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ (“કંપની”)ની કામગીરી અને ધંધા બાબતે અને ૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિતના હિસાબોનો ત્રીજો વાર્ષિક અહેવાલ આપની સમક્ષ પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદ થાય છે.

૧. નાણાંકીય વિગતો અથવા કંપનીની કામગીરીને લગતી અગત્યની બાબતો :

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિતના સમયગાળા માટે કંપનીની નાણાંકીય સ્થિતિ નીચે મુજબ છે.

(રકમ રૂપિયામાં)

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
ઓપરેશન-સમાંથી આવક	૦	૦
અન્ય આવક	૧,૯૭,૭૯,૨૩૨	૧૭,૫૯,૪૭૦
કુલ આવક	૧,૯૭,૭૯,૨૩૨	૧૭,૫૯,૪૭૦
ઓછા : કુલ ખર્ચ	(૧,૨૭,૭૭,૮૫૮)	(૨,૨૮,૪૨,૯૪૧)
નફો / (નુકસાન) ટેક્ષ પહેલા	૭૦,૦૧,૩૭૪	(૨,૧૦,૮૩,૪૭૧)
ઓછા : ટેક્ષ ખર્ચ	૫૫,૦૨,૫૮૨	૦
નફો / (નુકસાન) ટેક્ષ બાદ	૧૪,૯૮,૭૯૨	(૨,૧૦,૮૩,૪૭૧)

૨. આ સમયગાળા દરમિયાન કંપનીની કામગીરીની ટૂંકમાં વિગતો :

કંપની હાલમાં પ્રોજેક્ટના અમલીકરણની પ્રક્રિયામાં છે. વ્યાપારી કામગીરી હજુ શરૂ કરવાની બાકી છે.

એ) ટ્રાન્ઝેક્શન સલાહકારની કામગીરી જી-રાઈડને સોંપવામાં આવેલ છે કે જેમનું કામ પ્રોજેક્ટના ટેન્ડરોને ફાળવવા અને પ્રોસેસ કરવાનું છે. તબક્કા-I અને તબક્કા-II માટેના ઈપીસી કોન્ટ્રાક્ટરની નિમણૂંક થઈ ગયેલ છે.

- બી) ફીલ્ડ સુપરવીઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સી એજન્સીને નક્કી કરવામાં આવેલ છે.
 - સી) કંપની દ્વારા રોજબરોજના ઈનહાઉસ કામગીરીના સુચારુ અમલીકરણ માટે આયોજન કરવામાં આવેલ છે.
 - ડી) પ્રોજેક્ટ માટેના જમીન સંપાદનની કામગીરી માટે રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલિત કરેલ છે.
 - ઈ) જુદી જુદી કામગીરીઓ માટે પ્રોજેક્ટના પ્રોગ્રેસને ચકાસવામાં આવી રહેલ છે.
- એફ) પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ માટે રાજ્ય સરકાર તથા રેલ્વેનો સંપર્ક સાધવામાં આવી રહેલ છે. મેનેજમેન્ટની એવી આશા છે કે તેઓ કામગીરીમાં વેગ લાવી શકશે અને આવનાર વર્ષોમાં પ્રોજેક્ટના અમલીકરણમાં ગતિ લાવી શકશે.

૩. કોવીડ - ૧૯ ની અસરો :

નોવલ કોરોના વાયરસ (કોવીડ - ૧૯) સમગ્ર દુનિયામાં ખૂબ જ તીવ્ર ગતિએ ફેલાઈ રહેલ છે. આ વાયરસનો માનવ જીવન પર તો અસર થયેલ છે અને તેના ઉપરાંત ધંધાઓ ઉપર અને નાણાકીય બજારો પર પણ અસર કરેલ છે અને તેનો વ્યાપ હાલ સમજી શકાય તેમ નથી. બધા પાસાઓને ધ્યાને લઈ અને પરિસ્થિતિની અસરો અને તેના પરિણામોને સમજી નાણાકીય પત્રકોનો અંદાજ લેવો જરૂરી છે. કંપની દ્વારા ખૂબ જ બારીક રીતે કોઈ પણ પરિવર્તનો કે જેઓ ભવિષ્યની નાણાકીય પરિસ્થિતિ અને તેની કામગીરી પર થઈ રહેલ અસરોની ચકાસણી કરશે.

૪. ધંધામાં ફેરફારો જે કોઈ હોય તો :

હાલના નાણાકીય વર્ષના સમયગાળામાં કંપનીના ધંધામાં કોઈ પણ જાતના ફેરફારો થયેલ નથી.

૫. ડીવીડન્ડ્સ :

હાલના નાણાકીય વર્ષના સમયગાળા દરમિયાન બોર્ડના નિયામકોએ કંપનીના ઈક્વિટી શેરોમાં કોઈ પણ પ્રકારનો ડીવીડન્ડ્સ સૂચવેલ નથી.

૬. રીઝર્વમાં તબદિલ :

હાલના નાણાકીય વર્ષના સમયગાળા માટે કંપનીએ કોઈ પણ રકમને સામાન્ય અનામતમાં ટ્રાન્સફર કરેલ નથી.

૭. કંપનીની શેર કેપીટલ અને શેર કેપીટલમાં જો કોઈ ફેરફાર હોય તો :

કંપનીનું તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત ઓથોરાઈઝ્ડ, બહાર પાડેલ, સબસ્ક્રાઈબ્ડ અને પેઈડ-અપ શેર ભંડોળ નીચે મુજબ છે :

શેર ભંડોળની રૂપરેખા	
ઓથરાઈઝ્ડ શેર કેપીટલ ★	રૂ. ૭,૮૬,૨૨,૦૦,૦૦૦ (રૂપિયા સાતસો ઇચ્ચાસી કરોડ બાવીસ લાખ પુરા) ને રૂ. ૧૦ના ૭૮,૬૨,૨૦,૦૦૦ ઈક્વીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.
ઈશ્યુ, સબસ્ક્રાઈબ અને પેઈડ અપ શેર કેપીટલ ★★	રૂ. ૧,૯૨,૩૭,૫૦,૦૦૦/- (એકસો બાણુ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા) ને રૂ. ૧૦ના રૂ. ૧૯,૨૩,૭૫,૦૦૦ ઈક્વીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.

★ હાલના નાણાકીય વર્ષ કે જે ચકાસણીમાં છે તેમાં હાલની ઓથોરાઈઝ્ડ શેર કેપીટલમાં રૂ. ૨,૨૫,૦૦,૦૦,૦૦૦/- (રૂ. બસો પચીસ કરોડ) રૂ. ૧૦/- ના ઈક્વીટી શેર ૨૨,૫૦,૦૦,૦૦૦ (બાવીસ કરોડ પચાસ લાખ)માંથી વધારીને રૂ. ૭,૮૬,૨૨,૦૦,૦૦૦ (રૂપિયા સાતસો ઇચ્ચાસી કરોડ બાવીસ લાખ) રૂ. ૧૦/- ના ઈક્વીટી શેર ૭૮,૬૨,૨૦,૦૦૦ (ઈઠ્યોત્તર કરોડ બાસઠ લાખ વીર હજાર)માં વિભાજીત કરવામાં આવેલ છે.

★★ કંપનીના દરેક શેરધારકને રૂ. ૧૦/- ના ૧૯,૧૩,૭૫,૦૦૦ (ઓગણીસ કરોડ તેર લાખ પંચોતેર હજાર) શેર રાઈટ બેઝીસ પર સમાન ધોરણે ફાળવવામાં આવેલ છે કે જે ૨૪ મી જુલાઈ, ૨૦૨૦ અને ૫ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ ફાળવેલ છે.

૮. સબસીડરીઓ, સંયુક્ત સાહસો અને એશોસીએટ્સ કંપનીઓ :

કંપની ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને માડ્રૂતી સુઝુકી ઈન્ડિયા લિમીટેડનું એક સંયુક્ત સાહસ છે. તેથી શેર હોલ્ડીંગ કરાર અનુસાર કંપની સંયુક્ત સાહસના ભાગીદારની એક સંયુક્ત સાહસ કંપની ઠરે છે.

૯. ફેરબદલીના હક્કો સાથે ઈક્વીટી શેરો બાબતોના ખુલાસાઓ :

આ સમયગાળા દરમિયાન કંપનીએ ડીફરન્શિયલ વોટીંગ હક્કો સાથે કોઈ પણ ઈક્વીટી શેરો ઈશ્યુ કરેલ નથી અને તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નિયમો, ૨૦૧૪ના નિયમ ૪(૪) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૦. સ્વેટ ઇક્વીટી શેરો બાબતોના ખુલાસાઓ :

આ સમયગાળા દરમિયાન કંપનીએ કોઈ સ્વેટ ઇક્વીટી શેરો બહાર પાડેલ નથી અને તેથી કંપનીએ કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નિયમો, ૨૦૧૪ના નિયમ ૮ (૧૩) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૧. કર્મચારી સ્ટોક વિકલ્પ બાબતોના ખુલાસાઓ :

આ સમયગાળા દરમિયાન કંપનીએ કર્મચારી સ્ટોક વિકલ્પ સ્કીમ અંતર્ગત કોઈ શેરો બહાર પાડેલ નથી તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૨ (૯) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૨. કર્મચારીઓની વિગતો :

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ એક લીસ્ટેડ કંપની ન હોવાથી કલમ ૧૯૭ (૧૨) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રેમ્યુનેશન ઓફ મેનેજેરીયલ પર્સોનેલ) નિયમો, ૨૦૧૪ મુજબ કર્મચારીઓના વિગતની બાબત કંપનીને લાગુ પડતી નથી.

૧૩. નિયામકો અને મુખ્ય વહીવટી અધિકારીઓ :

હાલના નાણાકીય વર્ષમાં કંપની અધિનિયમ-૨૦૧૩ ની જોગવાઈઓ પ્રમાણે સંચાલક મંડળે નિયામક શ્રી સંતોષકુમાર (ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯) ને મુખ્ય કારોબારી અધિકારી તરીકે તથા શ્રી શંભુપ્રસાદ જોશીને મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિમણૂક તા. ૨૨, સપ્ટેમ્બર ૨૦૨૦ થી કરેલ છે.

૧૪. મેનેજરીયલ રીમ્યુનેશન :

આ કંપનીએ મેનેજરીયલ રીમ્યુનેશન બાબતે કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનેશન ઓફ મેનેજરીયલ પર્સનલ) નિયમ, ૨૦૧૪ ના નિયમ ૫ મુજબ ખુલાસો કરવાનો રહેતો નથી; કારણ કે કંપની એક અનલીસ્ટેડ કંપની છે.

૧૫. ડીપોઝીટ

હાલના નાણાકીય સમયગાળા દરમિયાન કંપનીએ પબ્લીક પાસેથી કોઈ પણ ડીપોઝીટ મેળવેલ નથી અને તેથી કંપનીને કંપની (એકાઉન્ટ) નિયમો, ૨૦૧૪ લાગુ પડતું નથી.

૧૬. રોટેશન મુજબ નિવૃત્ત થનાર નિયામકો :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૫૨(દ) મુજબ શ્રીમતી કવિતા શાહ (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) અને શ્રી બચ્ચુ વેનુ ગોપાલ (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૭) કંપનીના એજીએમ ખાતે રોટેશનથી નિવૃત્ત થવાના છે અને લાયકાત હોવાથી તેઓએ પોતાને ફરી - નિયુક્તિ માટે પ્રસ્તુત કરેલ છે.

કંપનીને ફોર્મ ડીઆઈઆર - ૮ મુજબના ખુલાસા મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે તેઓ કંપનીની વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન ફરી નિયુક્તિ માટે લાયકાત ધરાવે છે.

૧૭. બોર્ડની બેઠક :

બેઠકની નોટીસ સેક્રેટરીયલ ધોરણો મુજબ તૈયાર કરવામાં આવેલ છે અને તે અગાઉથી નિયામકોને પાઠવવામાં આવેલ છે. હાલના વર્ષ દરમિયાન ત્રણ બોર્ડની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે અને તે ૨૬મી જૂન, ૨૦૨૦, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૦ અને ૧૯મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજવામાં આવેલ છે. કોર્પોરેટ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૦માં કોવીડ-૧૯ મહામારીને કારણે તેમના તા. ૨૪મી માર્ચ, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર નં. : ૧૧/૨૦૨૦ પ્રમાણે બોર્ડ બેઠકમાં છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં બે બેઠકો વચ્ચેનો સમયગાળો ૧૮૦ દિવસનો મળેલ હતો.

૧૮. બોર્ડનું મૂલ્યાંકન :

બોર્ડ એ સતત પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરતું રહે છે. જેથી તેની આવડત અને તેની અમુક વિભાગો કે જેમાં તેઓ કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા સુધારી શકે જેનાથી એકાંકી નિયામક, બોર્ડના ચેરમેન અને બોર્ડ પોતે મૂલ્યાંકન પદ્ધતિથી કામગીરીમાં કાર્યદક્ષતા દેખાય. નિયામકોની વરણી / ફરીથી વરણી / નિયામકો ચાલુ રાખવા એ વાર્ષિક મૂલ્યાંકન પદ્ધતિના આધારિત છે.

૧૯. ઓડીટરો :

કોમ્પ્રોલર ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેઓના પત્ર ક્રમાંક નં. સીએ.વી/સીઓવાય/ગુજરાત, બીઆરસીએલ(૧)/૧૧૯૫ તા. ૨૬/૦૮/૨૦૨૧ થી નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે કંપનીના સ્ટેટ્યુટરી ઓડીટર તરીકે મેસર્સ શાહ એન્ડ દલાલ (એફઆરએન : ૧૦૯૪૩૨૩બલ્યુ), ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદની નિમણૂંક કરેલ છે.

૨૦. ઓડીટરોનો અહેવાલ :

ઓડીટરોના અહેવાલમાં કોઈ પણ પ્રકારની ખામીઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેઓના અહેવાલના એકાઉન્ટ અને ઓડીટરના નોટ સ્વયમ સ્પષ્ટ છે અને તે બાબતે વધુ કોઈ ટીપ્પણી આપવાની રહેતી નથી.

૨૧. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૬)(બી) મુજબ કોમ્પ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની ટીપ્પણીઓ :

કંપનીને પત્ર ક્રમાંક નં. એ/સીએસ/બીઆરસીએલ/૨૦૨૦-૨૧/ઓડબલ્યુ.૬૫૪ તારીખ ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ નો પત્ર કોમ્પ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી પ્રાપ્ત થયેલ છે અને તે કંપનીના તા. ૩૧/૦૩/૨૦૨૧ અંતિતના ઓડીટેડ હિસાબો બાબતોનો છે અને તેમાં જણાવેલ છે કે એવી કોઈ પણ બાબત ધ્યાન પર આવેલ નથી કે જેથી કરીને સી એન્ડ એજીએ સ્ટેચ્યુટરી ઓડીટર્સ રીપોર્ટ પર કોઈ ખાસ ટીપ્પણી કરવાની જરૂર રહેલ નથી.

૨૨. વાર્ષિક રીટર્નની વિગતો :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (એ) અને તેમના હેઠળ બનાવેલા નિયમના અનુસંધાને, કંપનીની પોતાની વેબસાઈટ ન હોવાને કારણે વાર્ષિક અહેવાલ લાગુ પડતું નથી.

૨૩. આંતરિક ઓડીટ અને કન્ટ્રોલ :

મેસર્સ અશોક ઇજેડ એન્ડ એસોસીએટ્સ ને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આંતરિક ઓડીટર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. કંપની દ્વારા આવનાર વર્ષો માટે આંતરિક ઓડીટરોના નિમણુંક માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

૨૪. કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) :

આ સમયગાળા દરમિયાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ કોર્પોરેટ સામાજિક જવાબદારીની કલમ કંપનીને લાગુ પડતી નથી.

૨૫. રીસ્ક મેનેજમેન્ટ પોલીસી :

બીઆરસીએલ દ્વારા તેઓના ધંધાને લગતા ખતરાઓને શોધી કાઢશે અને તેઓ એક રીસ્ક મેનેજમેન્ટ રૂપરેખાને લાગુ કરશે કે જેથી આવા ખતરાઓનો સામનો કરી શકે જેથી કે ધંધાના ઉદ્દેશ્યોને કોઈ જાતના અડચણ સિવાય પૂર્ણ કરી શકાય. બીઆરસીએલ દ્વારા આવા ખતરાઓને માટે એક્સપોઝર નિયંત્રણ દ્વારા ન્યૂનતમ ખતરાઓ થાય તે સુચારૂ કરીને સ્વીકાર્ય ખતરાઓનું નિદર્શન કંપની માટે કરશે અને નુકસાન ઘટાડશે.

૨૬. ઊર્જાનો બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ અને વિદેશી નાણા પ્રાપ્ત કરવા ચૂકવવા સારુ :

કંપની કોઈ પણ જાતનું ઉત્પાદન કાર્ય કરતી નથી કે જેથી ઊર્જાનો બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિનો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવાનો રહેતો નથી. આ સમયગાળા દરમિયાન કંપનીએ કોઈ પણ પ્રકારના વિદેશી નાણા પ્રાપ્ત કરેલ નથી કે ચૂકવેલ નથી.

૨૭. નાણાકીય વર્ષના અંતે અને અહેવાલની તારીખ દરમિયાન થયેલ કોઈ પણ પ્રકારના મહત્વના ફેરફારો કે કબૂલાત કે જેથી નાણાકીય સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ શકે :

નાણાકીય વર્ષના અંતે અને અહેવાલની તારીખ દરમિયાન કોઈ પણ પ્રકારના મહત્વના ફેરફારો કે કબૂલાત કરવામાં આવેલ નથી કે જેની અસર નાણાકીય સ્થિતિ અથવા કંપની ઉપર થાય સિવાય કે મહત્વના મુદ્દા તરીકે દર્શાવેલ આ રીપોર્ટ દરમિયાન કે કંપનીએ તા. ૧૧મી જુન, ૨૦૨૧ ના રોજ ૩,૨૬,૨૫,૦૦૦ રૂ. ૧૦ ના ઈક્વીટી શેર કુલ રૂ. ૩૨,૬૨,૫૦,૦૦૦/- ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ફાળવેલા છે.

૨૮. નિયામકો, કોર્ટ અને ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલ નોંધપાત્ર અને મહત્વના ઓર્ડર કે જે કંપનીની સાતત્યતા અને કંપનીના કાર્યો પર ભવિષ્યમાં અસર કરે તેની વિગત :

કોઈ પણ રેગ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા એવા કોઈ પણ ખાસ મટીરીયલ હુકમ પસાર કરવામાં આવેલ નથી કે જેથી કંપનીની સાતત્યતા કે ભવિષ્યની કામગીરીઓ ઉપર કોઈ પણ પ્રકારની અસર થઈ શકે.

૨૯. ધ સેક્શ્યુલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહીબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ અન્વયે કંપનીની રહેલ જવાબદારીઓ :

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા માટે એક નવો કાયદો ધ સેક્શ્યુલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહીબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ તા. ૮ મી ડિસેમ્બર, ૨૦૧૩ ના રોજ પસાર કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક કંપનીએ એક આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી જરૂરી છે કે જે કોઈ પણ સ્ત્રી કર્મચારી દ્વારા તેઓ સાથે કામકાજના સ્થળે થયેલ જાતીય સતામણી બાબતેના ફરિયાદો કરી શકે.

કંપની દ્વારા ભવિષ્યમાં એવી નીતિ અપનાવશે કે જેથી સ્ત્રીઓ સાથે નોકરીના સ્થળે જાતીય સતામણ ન થાય અને આ નીતિ લાગુ કરવા માટે એક સમિતિની પણ રચના કરશે. આ સમયગાળા દરમિયાન કંપનીને સતામણી બાબતે કોઈ પણ ફરિયાદ મળેલ નથી.

૩૦. લોન, ગેરેન્ટી અને રોકાણની વિગતો :

હાલના સમયગાળામાં કંપનીએ કોઈ પણ પ્રકારની લોન આપેલ નથી કે કોઈ પણ પ્રકારના રોકાણો કે કોઈ લોન પર ગેરેન્ટી આપેલ નથી, કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪(૩)(જી) હેઠળ આવેલ છે અને તેથી કંપનીએ આ બાબતે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવાનો રહેતો નથી.

૩૧. સંબંધિત પક્ષકારોને લગતા કરારો અને વ્યવસ્થાની વિગતો :

હાલના સમયગાળા દરમિયાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮(૧) અન્વયે કંપની દ્વારા સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલ કરારો અને વ્યવસ્થાઓની વિગતો કંપનીના ઓડીટ થયેલ બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવેલ છે.

૩૨. ઓડીટ સમિતિ :

હાલના સમયગાળા દરમિયાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગ ઓફ બોર્ડ ઍન્ડ ઇટ્સ પાવર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ (દ) હેઠળ ઓડીટ સમિતિના સંદર્ભે કોઈ પણ બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૩. નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિ :

હાલના સમયગાળા દરમિયાન કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગ ઓફ બોર્ડ ઍન્ડ ઇટ્સ પાવર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ (દ)ના અનુસંધાને નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિને લગતી બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૪. નિયામકોની જવાબદારી બાબતોનો ખુલાસો :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ના પેટા કલમ (૩) ના કલોઝ (સી) અન્વયેના નિયામકોની જવાબદારી બાબતોનો ખુલાસો નીચે મુજબ છે :

- (એ) વાર્ષિક હિસાબો તૈયાર કરવા બાબતે, લાગુ પડતા હિસાબી સિદ્ધાંતોનું પાલન કરવામાં આવેલ છે અને મહત્વના મુદ્દાઓ બાબતે જરૂરી ખુલાસા પણ આપવામાં આવેલ છે.
- (બી) નિયામકોએ તેવી રીતે હિસાબી નીતિને નક્કી કરવામાં આવી છે અને અનુસરવામાં આવી છે જેથી કરીને તેમને સતત કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા માટે હિસાબી પત્રકોએ કંપનીની સાચી સ્થિતિ દર્શાવે કે જેથી કરીને તેમના નિર્ણય અને તેમના અંદાજો એકદમ સચોટ નીકળે કે જે નાણાકીય વર્ષના નફા-નુકસાનની તાદર્શતા દર્શાવે જે તે નાણાકીય વર્ષ દરમિયાન સચોટ નીવડે.
- (સી) નિયામકોએ હિસાબી પત્રકોને જાળવતી વખતે ધારાના અનુસંધાનોની જરૂરી કાળજી અને સાવચેતી રાખેલ છે કે જેથી કંપનીના હિતોને જાળવી શકાય અને કોઈ પણ પ્રકારની ચૂક અને ગેરરીતિઓને દૂર કરી શકાય.
- (ડી) કંપનીના નિયામકોએ વાર્ષિક હિસાબોને કંપની સતત કાર્યરત રહેશે તે મુજબ તૈયાર કરેલ છે.
- (ઈ) નિયામકોએ પ્રોપર સીસ્ટમ શોધી કાઢેલ છે કે જેથી લાગુ પડતા હાલના નિયમોને ધ્યાને રાખી શકાય અને સીસ્ટમ સારી રીતે અને કાર્યક્ષમ રીતે કામ કરે.

૩૫. સેક્રેટરીયલ ઓડીટ અહેવાલ :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૪ કે જે સેક્રેટરીયલ ઓડીટને લગતું છે તે કંપનીને લાગુ પડે છે તેથી કંપનીએ સેક્રેટરીયલ ઓડીટ અહેવાલ એમઆર-૩ કે જે કંપની ધારા ૨૦૧૩ ની કલમ ૨૦૪ (૧) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ ઍન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજરીયલ પર્સોનલ) નિયમ, ૨૦૧૪ ના નિયમ (૯) પ્રમાણે મેસર્સ કિરણ પટેલ ઍન્ડ એસોસિયેટ્સ, કાર્યરત કંપની સેક્રેટરી દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આ અહેવાલ નિયામકના અહેવાલ સાથે સંકલિત છે.

૩૬. રકમોને એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવા બાબત :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪ અને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) નિયમો, ૨૦૧૬ અન્વયે સાત વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે ડીવીડન્ટની ફાળવણી માટે કંપનીના શેરો કલેઈમ થયા વગર કે ચૂકવણા થયા વગર બાકી રહેલ હોય તો તેને કંપની દ્વારા ભારત સરકારના ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ)માં ટ્રાન્સફર કરવું જરૂરી છે. આવા કોઈ પણ કિસ્સાઓ નથી કે જેમાં અમલીકરણ બાકી રહેલ છે.

૩૭. એકનોલેજમેન્ટ :

કંપનીના નિયામકો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાને અને સ્ટેચ્યુટરી ઓડીટરોને તેઓ દ્વારા આપવામાં આવેલ સહકાર બાબતે આભાર પ્રગટ કરે છે. કંપનીના નિયામકો ગુજરાત સરકાર, જી-રાઈડ, જીઆઈડીસી, એમએસઆઈએલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને તેઓ દ્વારા આપવામાં આવેલ સહકાર અને સતત ટેકા બદલ આભાર પ્રગટ કરે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરોના વતી અને તેમના દ્વારા
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૮/૦૮/૨૦૨૧

સહી/-

અશ્વિનીકુમાર રાજેન્દ્રપ્રસાદ ચાદવ

અધ્યક્ષ

ડીઆઈએન : ૦૬૫૮૧૭૫૩

સેક્ટેરીયલ ઓડિટ અહેવાલ

તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનું
(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૦૪(૧) અને કંપની (વ્યક્તિગત નિમણૂક અને મહેનતાણું) નિયમો,
૨૦૧૪ના નિયમ નં. ૯ અન્વયે)

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,

બ્લોક નં. ૬, ૭મો માળ, ઉદ્યોગ ભવન,

સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧.

અમોએ બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (હવે પછી કંપની તરીકે જણાવશે) દ્વારા તેને લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓની પૂર્તતા અને સારા કોર્પોરેટ વ્યવહારોનું પાલન કર્યું છે, તે અંગેનું સેક્ટેરીયલ ઓડિટ કરેલ છે. સેક્ટેરીયલ ઓડિટ એવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું કે કંપનીના વ્યવહાર / કાયદેસરના અનુપાલનને મૂલવવાનો અને તેના ઉપર અમારો અભિપ્રાય વ્યક્ત કરવાનો અમને વ્યાજબી આધાર પૂરો પાડે છે. કંપનીના ચોપડાઓ, કાગળો, ઠરાવ બુકો, પત્રકો, ફાઈલ કરેલા રીટર્ન અને કંપની દ્વારા નિભાવવામાં આવતા અન્ય રેકોર્ડ અને કંપની એ તેમના અધિકારીઓએ, એજન્ટોએ અને અધિકૃત પ્રતિનિધિઓએ સેક્ટેરીયલ ઓડિટ દરમિયાન આપેલી ચકાસણીના આધારે અમે આથી અહેવાલ આપીએ છીએ કે, અમારા અભિપ્રાય મુજબ અહેવાલમાં જણાવ્યા સુધીનું જણાવેલ રીતે, અને જણાવેલ મર્યાદામાં કંપનીએ ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષને આવરી લેતા (ઓડિટ સમયગાળા) દરમિયાન નીચે આપેલા કાયદાઓની જોગવાઈઓનું પાલન કર્યું છે અને કંપની પાસે યોગ્ય સંચાલક મંડળ પ્રક્રિયાઓ અને પૂર્તતા પદ્ધતિ છે :

અમોએ નીચે દર્શાવેલા કાયદાની જોગવાઈઓ પ્રમાણે કંપનીએ ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટે નિભાવેલ ચોપડાઓ, કાગળો, ઠરાવ બુકો, પત્રકો, ફાઈલ કરેલા રીટર્ન અને અન્ય રેકોર્ડ તપાસ્યા છે :

૧. કંપની ધારા, ૨૦૧૩ અને તે હેઠળ બનાવેલા નિયમો
૨. ધી સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ અને તે હેઠળ બનાવેલા નિયમો અને પેટા કાયદાઓ
૩. ધી ડીપોઝિટરીઝ એક્ટ, ૧૯૯૬ અને તે હેઠળ બનાવેલા નિયમો અને પેટા કાયદાઓ લાગતી હદ સુધી અનુસરવામાં આવેલ છે. મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરર્સની ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ની સૂચના મુજબ ગર્વમેન્ટ કંપનીઓને અપવાદ આપવામાં આવ્યો છે. તેમના શેરોને ડીમીટરીયલાઈઝ કરવાનો કે જે આ કંપનીને લાગુ પડતો નથી.
૪. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯ અને તે હેઠળ બનાવેલા નિયમો, સીધા વિદેશી રોકાણો, દરિયાપાર ના સીધા રોકાણો અને બહારના વાણિજ્યિક ઉછીના નાણાંને લગતી બાબતો.

- (પ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ૧૯૯૨ ('સેબી એક્ટ') હેઠળ સૂચિત કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓ; કે જે આ સમયગાળા દરમિયાન કંપનીને લાગુ પડતી નથી.
- (અ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સબ્સ્ટેન્શીયલ એક્વીઝીશન ઓફ શેર એન્ડ ટેઈક ઓવર્સ) નિયમો, ૨૦૧૧
- (બ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇન્સાઈડર ટ્રેડિંગ) નિયમો, ૧૯૯૨
- (ક) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડીસક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમો, ૨૦૦૯
- (ડ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (એમ્લોઈ સ્ટોક ઓપ્શન સ્કીમ અને એમ્લોઈ સ્ટોક પરચેઝ સ્કીમ), માર્ગદર્શિકાઓ, ૧૯૯૯
- (ઈ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇસ્યુ એન્ડ લિસ્ટિંગ ઓફ ડેટ સીક્યોરિટીઝ) નિયમો, ૨૦૦૮
- (ફ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇસ્યુના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટસ) નિયમો, ૧૯૯૩ - કંપની ધારા અને ગ્રાહક સાથેના વ્યવહારને લગતા
- (ગ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ડી લિસ્ટિંગ ઓફ ઇક્વિટી શેર) નિયમો, ૨૦૦૯
- (હ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (બાય બેક ઓફ સીક્યોરિટીઝ) નિયમો, ૧૯૯૯
- (ઠ) આ સાથે વધુમાં રજૂ કરું છું કે, કંપનીમાં પાલન થતી પ્રથા કે જેની સંબંધિત દસ્તાવેજો અને પત્રકોની સૈદ્ધાંતિક તપાસના આધારે કંપનીએ કંપનીના નિયમો પ્રમાણે નીચે પ્રમાણેના નિયમોને અમલમાં મૂકેલ છે. કે જે કંપનીને વિશેષ રીતે લાગુ પડે છે.

(i) ધી કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એક્ટ, ૧૯૭૦

આ સાથે લાગુ પડતી જોગવાઈઓ પણ અમે ચકાસી છે કે જે નીચે મુજબ છે.

(૧) ભારતીય કંપની સચિવ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ સેક્ટરીયલ ધોરણો

(૨) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડીસ્ક્લોઝર રેકિવરિમેન્ટસ) નિયમો, ૨૦૧૫ (ઓડિટના સમય દરમિયાન કંપનીને આ લાગુ પડતા નથી)

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ કાયદા, નિયમો, માર્ગદર્શિકા, ધોરણો વગેરેની જોગવાઈઓનું અમારા અવલોકનને આધિન પાલન કરેલું છે.

અમને જણાવેલી માહિતી અનુસાર અમે વધુમાં માહિતી આપીએ છીએ કે કંપનીએ હાલમાં યોગ્ય કંપની સેક્ટરીની નિમણૂકની પ્રક્રિયામાં છે કે જે કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૨૦૩ મુજબ મુખ્ય વહીવટીય અધિકારી તરીકે વર્તે.

કંપનીના નિયામક મંડળની રચના ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નિયામક મંડળની રચનામાં જે ફેરફારો થયા છે તે કાયદાની જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવ્યા છે.

બોર્ડ મિટિંગો સુનિશ્ચિત કરવા માટે તમામ નિયામકોને પૂરતી સૂચના આપવામાં આવી છે, કાર્યસૂચિ અને કાર્યસૂચિ પરની વિગતવાર નોંધ ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મોકલવામાં આવી હતી અને ટૂંકી સૂચનાના કિસ્સામાં કંપની અધિનિયમ ૨૦૧૩ મુજબ આવશ્યક પગલાઓના પાલનની ખાતરી આપવામાં આવી છે.

બધા જ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે અને જે ઠરાવના ભાગરૂપે નોંધ લેવામાં આવે છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે, લાગુ પડતા કાયદાઓ, નિયમો, પેટાનિયમો, માર્ગદર્શિકાઓના નિયંત્રણ અને પાલનની ખાતરી કરવા માટે કંપનીના કદ અને કામગીરીને અનુરૂપ પૂરતી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ કંપનીમાં છે.

અમો વધુમાં અહેવાલ આપીએ છીએ કે,

૧. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ પોતાની અધિકૃત મૂડી રૂા. ૨૨૫ કરોડથી વધારીને રૂા. ૭૮૬.૨૨ કરોડ તેમની તા. ૧૯-૦૧-૨૦૨૧ માં બોલાવેલ અસાધારણ સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને વધારેલ છે.

૨. ઓડિટ સમય દરમિયાન કંપનીએ

(અ) તા. ૨૪-૦૭-૨૦૨૦ ના રોજ બોલાવેલ નિયામક મંડળની બેઠકમાં સરક્યુલેશન દ્વારા પસાર કરેલ સામાન્ય ઠરાવથી તેમના વર્તમાન શેરધારકો ને રાઈટ બેસીસના આધારે રૂા. ૧૦ ના એક એવા ૮,૨૫,૮૦,૦૦૦ ના કુલ એકંદરે રૂા. ૮૨,૫૮,૦૦,૦૦૦/- ના શેરની ફાળવણી કરેલ છે.

(બ) તા. ૦૫-૦૧-૨૦૨૧ ના રોજ બોલાવેલ નિયામક મંડળની બેઠકમાં સરક્યુલેશન દ્વારા પસાર કરેલ સામાન્ય ઠરાવથી રૂા. ૧૦ ના એવા ૧૦,૮૭,૮૫,૦૦૦ ઈક્વીટી શેર્સ એકંદરે કુલ ૧,૦૮,૭૯,૫૦,૦૦૦/- તેમના વર્તમાન શેરધારકોને રાઈટ બેસીસ આધારે ફાળવેલા છે.

કે. કે. પટેલ એન્ડ એસોસીએટ્સ

તારીખ: ૧૪-૦૭-૨૦૨૧

સ્થળ : ગાંધીનગર.

સહી/-

સીએસ કિરન કુમાર પટેલ

પ્રોપરાઈટર

સભ્ય નં. ૬૩૮૪, સી.પી. નં. ૬૩૫૨

યુડીન : એફ૦૦૬૩૮૪સી૦૦૦૬૩૨૧૦૮

(આ અહેવાલ અમારા આ જ તારીખના 'પરિશિષ્ટ-અ' (પાના ૫) તરીકે જોડેલ પત્રની સાથે વાંચવો અને તે આ અહેવાલનો અભિન્ન ભાગ બને છે.)

‘પરિશિષ્ટ - અ’

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ,
બ્લોક નં. ૬, ૭મો માળ, ઉદ્યોગ ભવન,
સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧.

અમારો આજ તારીખનો અહેવાલ આ પત્ર સાથે વાંચવો.

- (૧) સેક્ટેરીયલ રેકોર્ડની જાળવણીએ કંપનીના મેનેજમેન્ટની જવાબદારી છે. અમારા ઓડિટના આધારે આ સચવાયેલ રેકોર્ડ પર અભિપ્રાય વ્યક્ત કરવાની જવાબદારી અમારી છે.
- (૨) અમોએ એવી ઓડિટ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ અનુસરી છે કે જે સેક્ટેરીયલ રેકોર્ડમાં સમાવિષ્ટ બાબતોના ખરાપણા અંગે વ્યાજબી ખાતરી મળી શકે તે માટે યોગ્ય હોય. સેક્ટેરીયલ રેકોર્ડમાં સાચી વિગતો પ્રતિબિંબિત થઈ છે. ચકાસણીના આધારે અમો માનીએ છીએ કે અમોએ જે પ્રક્રિયા અને પદ્ધતિઓ અનુસરી છે, તે અમારા અભિપ્રાય માટે વ્યાજબી આધાર પૂરો પાડે છે.
- (૩) અમોએ નાણાકીય રેકોર્ડ અને હિસાબી ચોપડાઓની ચોકસાઈ અને યોગ્યતા ચકાસ્યા નથી.
- (૪) કંપનીના અને અન્ય કાયદાઓ, નિયમો, રેગ્યુલેશન્સ, ધોરણોની પૂર્તતા કરવાની જવાબદારી વહીવટની છે. અમારી તપાસ ફક્ત કાર્યપ્રણાલિની ચકાસણી સુધી સીમિત હતી.
- (૫) સેક્ટેરીયલ ઓડિટ અહેવાલની ભાવિ સદ્ધરતા અંગે અથવા તેના કામકાજનું સંચાલન કેટલી કાર્યક્ષમતા કે અસરકારકતાથી કર્યું છે તે અંગે ખાતરી આપતું નથી.
- (૬) કોવીડ-૧૯ના કારણે રેકોર્ડની ભૌતિક ચકાસણી શક્ય ન હોવાને કારણે સેક્ટેરીયલ ઓડિટ મર્યાદિત સમીક્ષાએ કરેલ છે.

કે. કે. પટેલ એન્ડ એસોસીએટ્સ

સહી/-

સીએસ કિરન કુમાર પટેલ

પ્રોપરાઈટર

સભ્ય નં. ૬૩૮૪, સી.પી. નં. ૬૩૫૨

તારીખ: ૧૪-૦૭-૨૦૨૧

સ્થળ : ગાંધીનગર.

જોડાણ - ૧

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઈએન્ડઆરએસએ) ગુજરાત
એએમજી-૧/એ/સીએસ/બીઆરસીએલ/૨૦૨૦-૨૧/ઓડબલ્યુ.૬૫૪/૨૦/૦૮/૨૦૨૧

પ્રતિ,
મેનેજિંગ ડિરેક્ટર,
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ,
૭મો માળ, બ્લોક નં. ૬, ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

વિષય : કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળ ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિતના બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના નાણાંકીય પત્રકો પર કમ્પ્યુટર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ.

સાહેબશ્રી,

આ સાથે ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળનું બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના નાણાંકીય પત્રકોને લગત ભારતના કમ્પ્યુટર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ બાબતે નીલ કમેન્ટ પ્રમાણપત્ર કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં રજૂઆત સારું સામેલ રાખેલ છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) અન્વયે કંપની દ્વારા ભારતના કમ્પ્યુટર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ દરેક વ્યક્તિઓને મોકલવી જરૂરી છે કે જેઓની કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૬ (૧) મુજબ ઓડિટેડ નાણાંકીય પત્રકો મોકલવામાં આવે છે, અને તે જ સમયે તે રીપોર્ટને કંપનીના સેટ્યુટરી ઓડીટર રીપોર્ટમાં દર્શાવેલ હોય તે જ પ્રમાણે તેને કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં પણ પ્રસ્તુત કરવું જરૂરી છે. ભારતના કોમ્પ્યુટર અને ઓડીટર જનરલના અહેવાલના વાર્ષિક સામાન્ય બેઠકમાં રજૂ કરતી તારીખ આ ઓફિસને અગાઉથી જાણ કરવી જરૂરી છે.

છાપેલા હિસાબોની છ નકલો ઓફિસમાં કામકાજ અને રેકોર્ડ માટે મોકલવી જરૂરી છે.

આ પત્ર અને તેના સલગ્ન જોડાણો મળ્યા બાબતે જરૂરી રસીદ આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

સીનીયર ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ (એએમજી-૧)

બીડાણ : ઉપર મુજબ

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) અન્વયે ૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડના નાણાંકીય પત્રકો અન્વયે ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ

કંપની ધારા, ૨૦૧૩ અન્વયે ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાંકીય સિદ્ધાંતો મુજબ બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડના સ્ટેન્ડઅલોન નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે. કાયદાની કલમ ૧૩૯(૫) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નિયુક્ત કરાયેલા વૈદ્યાનિક ઓડિટર કાયદાની કલમ ૧૩૯(૫) હેઠળ નાણાકીય પત્રકો ઉપર અભિપ્રાય વ્યક્ત કરવા માટે જવાબદાર છે. અધિનિયમ ૧૪૩ હેઠળ કાયદાની કલમ ૧૪૩(૧૦) મુજબ ઓડિટના ધોરણો અનુસાર સ્વતંત્ર ઓડિટના આધારે વૈદ્યાનિક ઓડિટર દ્વારા ૧૬ જુલાઈ, ૨૦૨૧ ના સુધારેલા ઓડિટ રીપોર્ટ દ્વારા દર્શાવેલ છે.

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ વતી બહુચરાજી રેલ કોર્પોરેશન લિ. નું તા. ૩૧-૦૩-૨૦૨૧ના પૂરા થતા વર્ષના નાણાંકીય પત્રકોનું કંપની ધારા ૧૪૩ (૬) (અ) અન્વયે સપ્લીમેન્ટ ઓડિટ કરેલ છે. આ સપ્લીમેન્ટરી ઓડિટ સ્ટેચ્યુટરી ઓડિટર્સના કરેલ કાર્યને ધ્યાને લીધા સિવાય સ્વતંત્ર રીતે કરેલ છે અને સ્ટેચ્યુટરી ઓડિટરીની તપાસ અને કંપનીના કર્મચારીઓના અને અમુક હિસાબી રેકોર્ડની ચકાસણી પર આધારિત છે.

અમારા સપ્લીમેન્ટ ઓડિટ મુજબ કોઈ એવી ખાસ બાબત માલુમ પડેલ નથી કે જેથી સ્ટેચ્યુટરી ઓડિટરના રીપોર્ટ પર ૧૪૩(૬)(બ)ના નિયમ મુજબ કોઈ પણ ટીપ્પણી કરી શકાય.

તેમના દ્વારા અને તેમના વતી

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ

સહી/-

(એચ. કે. ધર્મદર્શી)

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ - ૨), ગુજરાત

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૦/૦૮/૨૦૨૧

ઓડીટરોનો સ્વતંત્ર અહેવાલ

પ્રતિ,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના

સભ્યોને

નાણાંકીય પત્રકો પર અહેવાલ

અભિપ્રાય :

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના (કંપનીના) બેલેન્સ શીટની ચકાસણી કરેલ છે અને તેમાં વર્ષ અંતિત નફા અને નુકસાનના પત્રકો, વર્ષ અંતિત કેશ ફ્લોના પત્રકો, વર્ષ અંતિત ઈક્વીટીમાં ફેરફારના પત્રકો અને નાણાકીય પત્રકોના નોંધોનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત તેમાં અગત્યના હિસાબી પદ્ધતિઓ અને અન્ય સમજણોનો સમાવેશ થાય છે.

અમારા મત અનુસાર અને અમને આપવામાં આવેલ માહિતી અનુસાર ઉપર જણાવેલ નાણાંકીય પત્રકો ધારાના જરૂરી કલમો અનુસારની માહિતી આપે છે અને તે એક સાચો અને ખરો ચિત્ર દર્શાવે છે કે જે ભારતમાં ચાલતા હિસાબી પદ્ધતિઓ અનુસાર છે અને તેમાં ઈન્ડિયન એકાન્ટીંગ સ્ટાન્ડર્ડ્સનું સમાવેશ થાય છે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત કંપનીની સ્થિતિ દર્શાવે છે અને કંપનીની નાણાકીય કામગીરી અને કેશ ફ્લો અને વર્ષના અંતે રહેલ ઈક્વીટીમાં ફેરફાર દર્શાવે છે.

અભિપ્રાયનો આધાર :

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીંગની પદ્ધતિ (એસએ) મુજબ અમોએ ઓડીટ કરેલ છે. તે પદ્ધતિ અનુસારની અમારી જવાબદારીઓને અમારા રીપોર્ટમાં દર્શાવેલ ઓડીટના નાણાકીય પત્રકોમાં ઓડીટરની જવાબદારીઓમાં વધુ સારી રીતે દર્શાવેલ છે. અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના કોડ ઓફ એથીક્સમાં દર્શાવ્યા મુજબ કંપનીથી સ્વતંત્ર છીએ અને અમારા એથીકલ જવાબદારીઓ અનુસાર કે જે અમારા દ્વારા કરવામાં આવેલ નાણાકીય પત્રકોના ઓડીટ ને લગત છે તેનું પાલન અમોએ કંપની ધારા, ૨૦૧૩ મુજબ કરેલ છે અને તેના નિયમોનું પાલન કરેલ છે અને કોડ ઓફ એથીક્સ મુજબની તમામ એથીકલ જવાબદારીઓ પૂર્ણ કરેલ છે. અમો માનીએ છીએ કે જે ઓડીટને લગતા પૂરાવાઓ અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારા નાણાકીય પત્રકોને લગતા અમારા દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય માટે બરાબર છે.

નાણાંકીય પત્રકો માટે મેનેજમેન્ટની જવાબદારીઓ :

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૩૪ (પ) માં દર્શાવેલ બાબતેની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની છે કે તે તૈયાર કરવામાં આવેલ નાણાંકીય પત્રકો કે જે નાણાંકીય સ્થિતિ, નાણાંકીય કામગીરી અને કંપનીના કેશ ફ્લોનો સાચો ચિત્ર દર્શાવે છે તે ભારતમાં ચાલતા હિસાબી સિદ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ અને કે જે ભારતીય હિસાબી પદ્ધતિના નિયમો (ઈન્ડએએસ)ની કાયદાની કલમ ૧૩૩ સાથે કંપનીઝ (ભારતીય હિસાબી પદ્ધતિ) નિયમો ૨૦૧૫ કે જે સુધારવામાં આવેલ છે તેની સાથે વાંચવામાં આવેલ છે.

જવાબદારીઓમાં જરૂરી હિસાબો રેકોર્ડની જાળવણી કે જે ધારાના પ્રાવધાન મુજબ હોવી જોઈએ કે જેથી કંપનીના મિલકતોની સુરક્ષા જળવાઈ રહે અને ગેરરીતિ અને છેતરપીંડીને અટકાવી શકાય, જરૂરી હિસાબી પદ્ધતિઓનું અમલીકરણ કરી શકાય, તેવા નિર્ણયો કરી શકાય કે જે વ્યાજબી અને બરાબર હોય અને જરૂરી આંતરિક નાણાંકીય નિયંત્રણો લાગુ કરી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા તૈયાર કરી તેનું અમલીકરણ કરી શકાય અને નાણાંકીય રેકોર્ડોની ચોકસાઈ અને પૂર્ણતા પણ જાળવી શકાય અને સાચા અને ખરા નાણાંકીય ચિત્રની પ્રાપ્તિ માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય જેથી ભૂલ કે છેતરપીંડીથી ખોટા પત્રકો તૈયાર કરવામાં ન આવે.

નાણાકીય નિવેદનો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ કંપનીની સાતત્યતાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે જવાબદાર છે. જ્યાં સુધી મેનેજમેન્ટ કંપનીનું વિનિમય અથવા બંધ કરવાનો ઈરાદો ન રાખે કે જ્યાં સુધી કંપનીની સાતત્યતાને લગતા, પરિબળો જેવા કે દાર્શનિકતા, સાતત્યતાને લગતા પરિબળો તથા લાગુ પડતી બાબતોનું ધ્યાન રાખવું પડે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ કંપનીના નાણાકીય પત્રકોના પેષણની પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે જવાબદાર છે.

નાણાંકીય પત્રકોના ઓડીટ બાબતે ઓડીટરની જવાબદારી :

અમારો ઉદ્દેશ્ય એ છે કે તે બાબતે ખાતરી કરવી કે નાણાંકીય પત્રકોમાં ઉચાપત કે ભૂલને કારણે કોઈ ખોટી મુખ્ય રજૂઆતથી મુક્ત છે કે કેમ. વ્યાજબી ખામીપણું એક ઉચ્ચ સ્તરની ખાત્રી છે, પરંતુ તે એ બાબતની ગેરેન્ટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડીટ હંમેશાં રહેલ મટીરીયલ ગેરરીતિને હંમેશાં ઓળખી બતાવે. ખોટી રજૂઆતો અને ઉચાપત કે ભૂલ જો કોઈ થયેલ હોય તો તેને ધ્યાને લીધેલ છે અને વ્યક્તિગત રીતે કે એગ્રીગેટમાં નાણાંકીય સ્ટેટમેન્ટ ઉપર યુઝર દ્વારા લેવામાં આવેલ નાણાંકીય નિર્ણયો પરની અસરને પણ ધ્યાને લીધેલ છે.

એસએ મુજબના ઓડીટના ભાગરૂપે, અમોએ પ્રોફેશનલ જજમેન્ટ રાખેલ છે અને ઓડીટમાં પ્રોફેશનલ સ્કેપટીસમ પણ રાખેલ છે. ઉપરાંત અમોએ :

- નાણાંકીય પત્રકોમાં રહેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી તેની ચકાસણી કરેલ છે કે જે કોઈ પણ ગેરરીતિ કે ભૂલ, ડીઝાઈનને કારણે થયેલ હોય અને ખતરાઓને લગત ઓડીટ પદ્ધતિઓનું પાલન કરેલ છે અને અમારા અભિપ્રાય આપવા માટે જરૂરી ઓડીટ પૂરાવાઓ પ્રાપ્ત કરેલ છે.

- આંતરિક નિયંત્રણને લગતી બાબતોની સમજણ પ્રાપ્ત કરેલ છે કે જેની મદદથી પરિસ્થિતિ અનુસાર ઓડીટ પદ્ધતિઓ તૈયાર કરી શકાય. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૩) (૧) મુજબ અમારી જવાબદારી છે કે અમો તેવો અભિપ્રાય આપીએ કે શું કંપની પાસે જરૂરી આંતરિક નાણાંકીય વ્યવસ્થા રહેલ છે અને તેની કામગીરી આવી વ્યવસ્થાને અનુરૂપ છે.
- ઉપયોગ લેવામાં આવેલ હિસાબી પદ્ધતિઓના વ્યાજબીપણાને ચકાસવી અને હિસાબ અંદાજોની યોગ્યતા ચકાસવી અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખુલાસાની ચકાસણી કરવી.
- ગોઈંગ કન્સર્નના આધારે મેનેજમેન્ટના દ્વારા કરવામાં આવેલ તેના ઉપયોગને ચકાસવી અને ઓડીટના પૂરાવાના આધારે ઈવેન્ટ અને કંન્ડીશનોને લગત મટીરીયલ અનિશ્ચિત્તા રહેલ છે કે કેમ તે ચકાસવી કે જે કંપનીના ચાલુ રહેવાની ક્ષમતા પર અસર કરી શકે. જો અમોને તેમ જણાઈ આવે કે મટીરીયલ અનિશ્ચિત્તા રહેલ છે તો નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ રીપોર્ટમાં અમારે બે બાબતે ધ્યાન દોરવાની રહે અને જો આવા ખુલાસાઓ બરાબર ન હોય તો અમારા અભિપ્રાયમાં પરિવર્તન લાવવું. અમારા તારણો ઓડીટ કરેલ તારીખ સુધી ઓડિટ એવિડન્સના આધારે છે. છતાં ભવિષ્યની એવી ઘટના અને પરિસ્થિતિના આધારે કંપનીની ચાલુ રહેવાની શક્યતા ઉપર ખતરો ઊભો થાય.
- અમોએ નાણાંકીય પત્રકોને લગત તમામ પ્રેઝન્ટેશન, સ્ટ્રક્ચર અને વિગતોને ચકાસેલ છે અને તેમાં ખુલાસાઓનો સમાવેશ થાય છે કે જેમાં નાણાંકીય પત્રકો લેવડ દેવડો દર્શાવતી હોય અને એક સાચો પ્રેઝન્ટેશન દર્શાવે છે.
- અમોએ ધારાની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીંગની પદ્ધતિઓ અનુસાર ઓડીટ કરેલ છે. આ પદ્ધતિઓ મુજબ અમારે એથીકલ જરૂરીયાતોનું પાલન કરવું જોઈએ અને પ્લાન કરી ઓડીટ કરવું જોઈએ કે જેથી તેવી સામાન્ય ચોકસાઈ પ્રાપ્ત થાય કે નાણાંકીય પત્રકોમાં કોઈ મટીરીયલ મીસસ્ટેટમેન્ટ રહેલ નથી.

વહીવટ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરેલ છે અને તેમની પાસે અન્ય બાબતો ઉપરાંત ઓડીટમાં પ્રાપ્ત થયેલ વિગતો બાબતે ચર્ચા કરેલ છે અને તેમાં આંતરીક નિયંત્રણમાં રહેલ ખામીઓ કે જે અમારા ઓડીટમાં જણાઈ આવેલ છે તેની પણ ચર્ચા કરેલ છે.

તેના ઉપરાંત વહીવટમાં રહેલ વ્યક્તિઓને અમોએ એવો પત્રક આપેલ છે કે અમોએ અમારી એથીકલ જરૂરીયાતો કે જે સ્વતંત્રતાને લગત છે તેનું પાલન કરેલ છે અને તેઓને તમામ સંબંધો બાબતે અને અન્ય બાબતે માહિતી આપેલ છે કે જે અમારા ઓડીટની સ્વતંત્રતા ને લગત અને તેના સેફગાર્ડને લગત છે.

વહીવટમાં રહેલ વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં આવેલ બાબતોમાંથી, અમે તે બાબતો નક્કી કરીએ છીએ કે જે વર્તમાન સમયગાળાના નાણાકીય નિવેદનોના ઓડિટમાં સૌથી મહત્વની હતી અને તેથી તે મુખ્ય ઓડિટ બાબતો છે અને અમારા ઓડિટ રીપોર્ટમાં આ બાબતોનું વર્ણન કરીએ છીએ સિવાય કે કાયદો અથવા નિયમન આ બાબતો વિશે જાહેરમાં જાહેર કરવામાંથી બાકાત રાખે અથવા કે જે અતિ દુર્લભ હોય, અમે નિર્ધારિત કરીએ છીએ કે અમારા રીપોર્ટમાં એવી કોઈ પ્રતિકૂળ પરિણામો દર્શાવવામાં ન આવે કે જેથી કરીને જાહેર હિત ને અસર કરતી હોય, કે જે રીપોર્ટ અથવા સંદેશાના માધ્યમથી દર્શાવેલ હોય.

અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતો પરનો અહેવાલ :

૧. કંપનીની (ઓડીટર અહેવાલ) ઓર્ડર, ૨૦૧૬ (ધી ઓર્ડર) મુજબની કંપનીની જરૂરીયાતો કે જે ભારત સરકાર દ્વારા ધારાની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૧) મુજબ છે તેના અનુસંધાને અમો “એનેક્ષર - એ” આપીએ છીએ કે જે ઓર્ડર મુજબ એક સ્ટેટમેન્ટ છે અને તે ફકરા ૩ અને ૪ માં દર્શાવેલ છે.
૨. ધારાની કલમ ૧૪૩ (૫) મુજબ અમો અમારો અહેવાલ રજૂ કરીએ છીએ, અને તેનો આધાર કંપનીના ચોપડા અને રેકોર્ડની ચકાસણી છે જે અમોએ જરૂરી સમજેલ છે અને તે અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ મુજબ છે જે “એનેક્ષર - બી” માં દર્શાવેલ છે જે ભારતના કોમ્ટ્રોલર અને ઓડીટર જનરલ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને પેટા સૂચનાઓએ આધિન છે.
૩. ધારાની કલમ ૧૪૩ (૩) મુજબ અમો જણાવીએ છીએ કે :
 - એ) અમારી જરૂરીયાત પ્રમાણે અમોએ ઓડીટને લગતી તમામ માહિતી અને સ્પષ્ટીકારણો પ્રાપ્ત કરેલ છે.
 - બી) અમારા મત પ્રમાણે ચોપડાઓની ચકાસણીથી જણાઈ આવેલ છે કે કંપની દ્વારા હાલના કાયદા પ્રમાણે હિસાબોના ચોપડાઓ ખરી રીતે નિભાવવામાં આવેલ છે.
 - સી) આ રીપોર્ટને લગતા બેલેન્સ શીટ, નફા નુકસાનના પત્રકો અને કેશ ફ્લો પત્રકો હિસાબી ચોપડા પ્રમાણે નિભાવવામાં આવેલ છે.
 - ડી) અમારા મત પ્રમાણે, ઉપર જણાવેલ નાણાકીય પત્રકોની જાળવણી કરતી વખતે ધારાની કલમ ૧૩૩ અને કંપની (ભારતીય હિસાબી ધોરણો) નિયમ ૨૦૧૫ નું પાલન કરવામાં આવેલ છે.
 - ઈ) આ કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જૂન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર.૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૬૪ની પેટા કલમ ૨ લાગુ પડતી નથી.
 - એફ) અમારા કંપનીના નાણાંકીય રીપોર્ટીંગને લગત આંતરીક નાણાંકીય નિયંત્રણની જરૂરીયાત મુજબ અને નિયંત્રણના ઓપરેટીંગ ક્ષમતા મુજબની વિગતો અમોએ અલગ અહેવાલથી “એનેક્ષર સી”માં રજૂ કરેલ છે.

- એચ) ઓડીટર અહેવાલની અન્ય બાબતો કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટસ) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૧૧ ને લગત છે તે વિશે જણાવવાનું કે અમારી નાહિતી અને તેના અનુસંધાને મળેલ સ્પષ્ટીકરણ મુજબની વિગત નીચે પ્રમાણે છે.
- જી) આ કંપની એક સરકારી કંપની હોવાથી મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫મી જૂન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર. ૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૮૭ લાગુ પડતી નથી.
૧. તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિતના બેલેન્સ શીટ સમયે કોઈ પ્રકારના દાવાઓ બાકી રહેલ નથી.
 ૨. કંપનીએ લાંબા સમયના કરાર કે જેમાં ડીરીવેટીવ કરારોનો સમાવેશ થાય છે તેના અનુસંધાને હાલના નિયમો અને હિસાબી પદ્ધતિઓ મુજબ જરૂરી પ્રાવધાનો કરેલ છે.
 ૩. કંપની દ્વારા ઈન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં નાણા ટ્રાન્સફર કરવામાં કે ટ્રાન્સફર કરવાની જરૂરીયાતમાં કોઈ પણ પ્રાકરનો વિલંબ કરેલ નથી.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૬બલ્યુ

સહી/-

મલય જે દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સ્થળ : અમદાવાદ

તારીખ : ૧૬/૦૭/૨૦૨૧

ઓડીટર્સના સ્વતંત્ર અહેવાલને લગતું એનેક્ષર - એ

૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિતના નાણાકીય પત્રકો અમારા દ્વારા બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડના સભ્યોને આથી સમર્પિત

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૧ ના અનુસંધાને)

કંપનીના નાણાકીય પત્રકોના સાચા અને ખરા ચિત્રને પ્રાપ્ત કરવા માટે અમારા દ્વારા કરવામાં આવેલ ઓડીટ પદ્ધતિના આધારે અને અમને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતાઓ મુજબ અમારા દ્વારા ચકાસવામાં આવેલ હિસાબી ચોપડાઓ અને અન્ય રેકોર્ડ મુજબ અમો નીચે મુજબ રીપોર્ટ કરીએ છીએ :

૧. કંપનીની ફીક્સ એસેટના સંદર્ભમાં :

કંપની પાસે કોઈ ફીક્સ એસેટ નથી અને તેથી કલમ લાગુ પડતુ નથી. પરંતુ કંપની પાસે કેપીટલ એસેટની કામગીરી હાલ પ્રગતિમાં છે અને તે નાણાકીય પત્રકોમાં અવાસ્તવિક મિલકતો કાર્યરતના શીર્ષક હેઠ દર્શાવેલ છે.

૨. કંપની પાસે કોઈ પણ પ્રકારની ઈન્વેન્ટરી નથી અને તેથી આ કલમ લાગુ પડતુ નથી.

૩. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ મુજબ જાળવેલ રજીસ્ટરમાં દર્શાવેલ છે કે કંપની એ અન્ય કંપની, પેઢી, લિમીટેડ લાયબલીટી પાર્ટનરશીપ કે અન્ય પાર્ટીને તારણવાણી કે તારણવગરની લોન આપેલ નથી. CARO, ૨૦૧૬ ની પેટા કલમ ૩ લાગુ પડતી નથી.

૪. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈ પણ લોન, રોકાણ, ગેરેન્ટી કે સેક્યુરીટી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ મુજબ આપેલ નથી. તેથી સીએઆરઓ, ૨૦૧૬ ના કલોઝ (૪) મુજબ કોઈ રીપોર્ટીંગ કંપનીએ કરવાનું રહેતું નથી.

૫. કંપનીએ આપેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈ પણ જાતનું નિવેશ પબ્લીક પાસેથી સ્વીકારેલ નથી કે જે ધારાની કલમ ૭૩ થી ૭૬ માં દર્શાવેલ છે અને તેના નીચેના નિયમોમાં દર્શાવેલ છે અને તેથી CARO, ૨૦૧૬ ની કલમ (૫) મુજબ કંપનીએ કોઈ રીપોર્ટીંગ કરવાનું રહેતું નથી.

૬. કેન્દ્ર સરકાર દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ના કલમ ૧૪૮ ના પેટા કલમ (૧) માં જણાવેલ કોસ્ટ રેકર્ડની જાળવણી કંપનીને લાગુ પડતુ નથી. આથી સીએઆરઓ, ૨૦૧૬ ની કલમ (૬) મુજબ કંપનીએ કોઈ રીપોર્ટીંગ કરવાનું રહેતું નથી.

૭. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ સેટ્યુટરી લેણાની માહિતી નીચે મુજબ છે :

(એ) કંપની અનડીસ્પુટેડ સેટ્યુટરી લેણા ભરવામાં નિયમિત છે જેમાં ઈનકમ ટેક્સ, ગુડ્સ અને સર્વિસ ટેક્સ, તથા અન્ય કાયદાકીય કરનો સમાવેશ થાય કે જે લાગતી વળગતી સત્તાઓને ચૂકવવાના હોય છે.

(બી) કોઈ પણ પ્રકારની ડ્યુટી કે ટેક્સ બાબતે કોઈ પણ રેવન્યુ સત્તા સાથે કોઈ પણ પ્રકારની તકરારો હાલમાં ચાલુ નથી.

૮. અમોને આપવામાં આવેલ માહિતી મુજબ કંપની દ્વારા કોઈ પણ નાણાકીય સંસ્થા કે બેન્કને ચૂકવવા પાત્ર નાણાં ચૂકવવામાં ચૂક કરેલ નથી.

૯. અમારી જાણ મુજબ અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ આ વર્ષમાં પ્રારંભિક પબ્લીક ઓફર કે અન્ય પબ્લીક ઓફર (જેમાં ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે)થી કોઈ નાણાં એકત્ર કરેલ નથી, તેથી આ કલમ લાગુ પડતી નથી. અને તેણે કોઈ પણ પ્રકારની લોન લીધેલ નથી. જો કે કંપનીએ ભંડોળને ઈક્વિટી શેરના રાઈટ ઈશ્યુ દ્વારા કંપનીના હેતુઓની પૂર્તિ માટે એકત્રિત કરેલ છે.
૧૦. અમારી જાણ મુજબ અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ આ સમયગાળા દરમ્યાન કંપનીએ છેતરપીંડી કરેલ નથી કે તેના અધિકારીઓએ કે કર્મચારીઓએ કંપની સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડી કરેલ નથી તેમ જણાઈ આવેલ છે.
૧૧. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જૂન, ૨૦૧૫ ના ઠરાવ નં. જીએસઆર ૪૬૩(ઈ) મુજબ કલમ ૧૯૭ ના પ્રાવધાનોથી મુક્ત કરવામાં આવે છે કારણ કે તે એક સરકારી કંપની છે. આથી CARO, ૨૦૧૬ ની કલમ ૧૧ ના પ્રાવધાનો અત્રે લાગુ પડતા નથી.
૧૨. કંપની એક નીધી કંપની નથી અને તેથી સીએઆરઓ, ૨૦૧૬ ના કલમ (૧૨) હેઠળ કંપનીએ રીપોર્ટિંગ કરવાનું રહેતું નથી.
૧૩. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ અને ૧૭૭ નું જે સ્થાને લાગુ પડે ત્યાં કંપની પાલન કરે છે. લાગતા વળગતા પાર્ટીઓના તમામ લેવડદેવડ અને પક્ષકારોના લેવડદેવડની વિગતો નાણાંકીય પત્રકોમાં દર્શાવેલ છે જે ભારતીય હિસાબી સિદ્ધાંતો પ્રમાણે દર્શાવેલ છે.
૧૪. ચાલુ સાલે કંપનીએ કોઈ પણ પ્રીફરેન્શીયલ એલોટમેન્ટ કે શેરોના પ્રાઈવેટ પ્લેસમેન્ટ કે ફુલ્લી કે પાર્શીયલ કન્વર્ટીબલ ડિબેન્ચરો ઈશ્યુ કરેલ નથી. જેથી CARO, ૨૦૧૬ની કલમ (૧૪) અત્રે લાગુ પડતી નથી.
૧૫. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ હાલના સમયગાળામાં કંપનીએ કોઈ પણ પ્રકારના નોન - કેશ લેવડદેવડ તેઓના નિયામકો કે અન્ય વ્યક્તિઓ સાથે કરેલ નથી અને તેથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૯૨ અત્રે લાગુ પડતી નથી.
૧૬. કંપનીને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ધારા, ૧૯૩૪ ની કલમ ૪૫ (આઈએ) એ અંતર્ગત કોઈ નોંધણી કરવાની જરૂરીયાત રહેલ નથી.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૬બલ્યુ

સહી/-

મલય જે દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૦૬

સ્થળ : અમદાવાદ

તારીખ : ૧૬/૦૭/૨૦૨૧

ઓડીટર્સના સ્વતંત્ર અહેવાલને લગત એનેક્સર - બી

૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિતના નાણાંકીય પત્રકો અમારા દ્વારા બહુચરાણુ રેલ કોર્પોરેશન લીમીટેડના સભ્યોને આથી સમર્પિત

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૨ ના અનુસંધાને) કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૪૩(૫) મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો રીપોર્ટ

(૧) મુખ્ય સૂચનાઓ :-

ક્રમ નં.	માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	શું કંપની એવી કોઈ પ્રક્રિયા અમલમાં રાખેલ છે કે જેથી કે તમામ હિસાબીય લેવડ દેવડ આઈટી પ્રક્રિયાથી થઈ શકે ? જો ના, તો આઈટી પ્રક્રિયા સિવાય કરવામાં આવેલ હિસાબી લેવડ દેવડ અને અન્ય કામગીરી અને તેની હિસાબો પર અસર અને તેની નાણાંકીય અસરો જો કોઈ હોય તો તે દર્શાવવો.	હા, કંપનીએ તમામ નાણાંકીય લેવડ દેવડ માટે આઈટી સીસ્ટમ અમલમાં છે.
૨.	શું કોઈ લેન્ડર દ્વારા કંપની દ્વારા લોન ન ભરવાના કારણે કોઈ ચાલુ લોન પર રીસ્ટ્રક્ચરીંગ કરવામાં આવેલ છે કે ડેબ્ટ્સ / લોન / વ્યાજ વગેરેના કોઈ વેવર/રાઈટઓફ ના કિસ્સા બનેલ છે ? જો હા તો તેની નાણાંકીય અસરો દર્શાવો.	ઓડીટના સમય દરમિયાન કંપનીએ કોઈ વેવર / રાઈટઓફ કરેલ નથી.
૩.	શું કેન્દ્રીય/રાજ્ય એજન્સી તરફથી કોઈ ખાસ સ્કીમ માટે મળેલ/ મળવા પાત્ર ભંડોળનો હિસાબ પ્રમાણે/તેની શરતો અને નિયમો મુજબ વાપરવામાં આવેલ છે. જે તેમ ન કરવામાં આવેલ હોય તો તેની યાદી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને કોઈ પણ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં મળેલ નથી સિવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, અને ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનો હિસાબ બરાબર રાખવામાં આવેલ છે અને તે બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલ છે.

(૨) શાખાને લગત સૂચનો : માળખાકીય શાખાઓ :-

ક્રમ નં.	પેટા માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	કંપની પાસે રહેલ જમીન પર દબાણ ન થાય તે માટે કંપની તરફથી યોગ્ય પગલાઓ લેવામાં આવેલ છે કે કેમ. શું કંપનીના કોઈ જમીન પર દબાણ થયેલ છે કે તે દાવા અંતર્ગત છે કે તેનો ઉપયોગ કરવામાં આવેલ નથી કે તેને સર્પલ્સ જાહેર કરવામાં આવેલ છે. વિગતો આપવી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ પ્રમાણે ઓડીટના સમયગાળામાં અમારા જાણ પર આવેલ કે કંપની પાસે કોઈ પણ પ્રકારની જમીન રહેલ નથી.
૨.	શું સરકારના સૂચનો/નીતીઓ મુજબ પબ્લીક પ્રાઈવેટ ભાગીદારી મુજબ કોઈ પણ પ્રોજેક્ટનું વેગ માટે ઓળખાણ કરવામાં આવેલ છે. જો કોઈ ફેરબદલી હોય તો જણાવો.	લાગુ પડતી નથી.
૩.	શું કોઈ ચાલુ કરાર કે જેમા કામગીરીના લક્ષ્યાંકો દર્શાવેલ છે તેમાં ભાવ વધારા કે અન્ય કારણોસર કોઈ રેવન્યુ / નુકસાન કરારોના કારણે થયેલ છે અને શું તે ચોપડાઓમાં બરોબર દર્શાવવામાં આવેલ છે.	અમોને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ આ ઓડિટના સમયગાળા દરમ્યાન અમોને જણાઈ આવેલ કે : ૧. કાર્યોના અમલીકરણ પર દેખરેખ રાખવાની પદ્ધતિ : (અ) કંપનીએ તા. ૦૯-૦૧-૨૦૧૯ના રોજની તેમની પહેલી સંચાલક બેઠકમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી - રાઈડ) ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરેલ હતી અને આ માટેનો કરાર તા. ૨૮-૦૨-૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. (બ) તેથી કંપની પાસે પૂરતો મોનીટરીંગ (દેખરેખ) પદ્ધતિ છે કે જ્યાં જી-રાઈડ ઉપર જણાવેલ ફકરા ૧(અ)માં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા પૂરી પાડે છે.

		<p>૨. એગ્રીમેન્ટ માઈલસ્ટોન સ્ટેટસ :</p> <p>(અ) કંપનીએ ઈપીસી કોન્ટ્રાક્ટ કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લિમિટેડને પ્રથમ તબક્કા કટોસન રોડથી બેચરાજી (૨૬.૬ કિમી.) માટે આપેલ છે. અને તેની માટે માઈલસ્ટોન્સ નક્કી કરેલ છે કે જેની મુદત લંબાવવામાં આવી. જી-રાઈડના પત્ર નંબર જી-રાઈડ/ટ્રાન્જેક્શન એડવાઈઝર/૨૦૧૯-૨૦/૦૩૮/૧૮૭૬ તા. ૨૨-૬-૨૦૨૧ દ્વારા અને તેના માટે નાણાકીય મંત્રાલય, ખર્ચ વિભાગ, પ્રોક્યોરમેન્ટ પોલીસી વિભાગ દ્વારા ઓફિસ મેમોરેન્ડમ રજૂ કરેલ છે.</p> <table border="1" data-bbox="742 828 1420 1310"> <thead> <tr> <th>ક્રમ. નં.</th> <th>માઈલસ્ટોન</th> <th>કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ</th> <th>સુધારેલ પૂર્ણ કરવાની તારીખ</th> <th>રીમાર્ક્સ</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>એમએસ-૧*</td> <td>૧૯-૦૮-૨૦૨૦</td> <td>૧૪-૦૨-૨૦૨૧</td> <td>૬ મહિના વધારો</td> </tr> <tr> <td>૨</td> <td>એમએસ-II</td> <td>૧૯-૦૬-૨૦૨૧</td> <td>૧૯-૧૨-૨૦૨૧</td> <td>૬ મહિના વધારો</td> </tr> <tr> <td>૩</td> <td>એમએસ-III</td> <td>૧૯-૧૦-૨૦૨૧</td> <td>૧૯-૦૨-૨૦૨૨</td> <td>૨૪ મહિના વધારો</td> </tr> <tr> <td>૪</td> <td>એમએસ-IV**</td> <td>૧૯-૦૨-૨૦૨૨</td> <td>૧૯-૦૨-૨૦૨૨</td> <td>-</td> </tr> </tbody> </table> <p>*નોંધ-૧ : માઈલસ્ટોન-૧ કેપીટીએલ દ્વારા તા. ૧૦-૦૨-૨૦૨૧ના રોજ જારી કરેલ પત્ર નં. કેપીટીએલ/જીરાઈડ/કેટીઆરડી-બીએચઆરજે/૦૪૭૦ પ્રમાણે સુધારેલ તારીખમાં પૂર્ણ કરેલ છે.</p> <p>**નોંધ-૨ : માઈલસ્ટોન-૪ નું વધુ વિસ્તરણ પ્રોજેક્ટના પ્રગતિ પ્રમાણે અને તે સમયની સ્થિતિને ધ્યાનમાં લઈ લેવામાં આવશે.</p> <p>૩. ખર્ચમાં વધારાની અસર :</p> <p>કંપનીએ વર્ષ દરમ્યાન કેપીટીએલ દ્વારા માંગવામાં આવેલ વધારાની રકમની નોંધણી ચોપડે પૂરતા પ્રમાણમાં અને કરારમાં બતાવેલ મુજબ કરેલી છે.</p>	ક્રમ. નં.	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	સુધારેલ પૂર્ણ કરવાની તારીખ	રીમાર્ક્સ	૧	એમએસ-૧*	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	૬ મહિના વધારો	૨	એમએસ-II	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૧૨-૨૦૨૧	૬ મહિના વધારો	૩	એમએસ-III	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૨-૨૦૨૨	૨૪ મહિના વધારો	૪	એમએસ-IV**	૧૯-૦૨-૨૦૨૨	૧૯-૦૨-૨૦૨૨	-
ક્રમ. નં.	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	સુધારેલ પૂર્ણ કરવાની તારીખ	રીમાર્ક્સ																							
૧	એમએસ-૧*	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	૬ મહિના વધારો																							
૨	એમએસ-II	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૧૨-૨૦૨૧	૬ મહિના વધારો																							
૩	એમએસ-III	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૨-૨૦૨૨	૨૪ મહિના વધારો																							
૪	એમએસ-IV**	૧૯-૦૨-૨૦૨૨	૧૯-૦૨-૨૦૨૨	-																							

૪.	શું કોઈ ખાસ સ્કીમ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર પાસેથી મળેલ / મળવા પાત્ર ભંડોળનું બરાબર હિસાબ રાખવામાં આવેલ છે / ઉપયોગ કરવામાં આવેલ છે. જો ન કરવામાં આવેલ હોય તો તેની વિગતો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની દ્વારા કોઈ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં પ્રાપ્ત થયેલ નથી સિવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, અને ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનું હિસાબ સારી રીતે રાખવામાં આવેલ છે અને તેને બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
૫.	શું કોઈ બેંક ગેરેન્ટી સમયસર રીવેલીડેટ કરવામાં આવેલ છે ?	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ ચાલુ સાલે કંપની દ્વારા કોઈ બેંક ગેરેન્ટીનો ઉપયોગ કરવામાં આવેલ નથી જો કે કંપની દ્વારા બેંક ગેરંટી પ્રાપ્ત કરવામાં આવી હતી જે સમયસર પુનઃ પ્રમાણિત કરવામાં આવેલ છે.
૬.	ટ્રેડ રીસીવેબલ , ટ્રેડ પેયેબલ, ટર્મ ડીપોઝીટ, બેંક ખાતાઓ અને પ્રાપ્ત થયેલ રોકડના બેલેન્સના કન્ફર્મેશન પર ટીપ્પણીઓ.	અમોને નીચે મુજબના કન્ફર્મેશન પ્રાપ્ત થયેલ છે અને તે નાણાંકીય પત્રકોના આંકડાઓને અનુરૂપ છે. ૧. યસ બેંક અને યૂનીયન બેંક પાસેથી બેંક બેલેન્સ પ્રમાણપત્ર. ૨. જીએસએફએસ પાસેથી ડીપોઝીટ માટે ઈન્ટરેસ્ટ અને બેલેન્સ પ્રમાણપત્ર. ૩. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમિટેડ પાસેથી બેલેન્સ કન્ફર્મેશન. ૪. ઈપીસી કોન્ટ્રાક્ટર(કલ્પતરું પાવર ટ્રાન્સમીશન લિમિટેડ) દ્વારા ગતિશીલતા એડવાન્સ પર મળવાપાત્ર સિલક અને વ્યાજ ૫. સંચાલક મંડળ પાસેથી તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજ રોકડ સિલક ૬. સરવૈયાની તારીખે કોઈ મળવાપાત્ર વેપાર નથી (ટ્રેડ રીસીવેબલ)
૭.	એબોન્ડન કરવામાં આવેલ પ્રોજેક્ટ માટે થયેલ ખર્ચા અને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલ રકમ દર્શાવો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ પ્રોજેક્ટ એબોન્ડન કરવામાં આવેલ નથી. તેથી આ કલમ લાગુ પડતી નથી.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૩બલ્યુ

સહી/-

મલય જે દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સ્થળ : અમદાવાદ

તારીખ : ૧૬/૦૭/૨૦૨૧

ઓડીટર્સના સ્વતંત્ર અહેવાલને લગત એનેક્સર - સી

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૩ (એફ) ના અનુસંધાને)

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૪૩ ની પેટા કલમ ૩ ના કલોઝ (૧) અંતર્ગત આંતરીક નાણાંકીય નિયંત્રણનો નાણાંકીય રીપોર્ટ ઉપર અહેવાલ.

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજનો બહુચરાણુ રેલ કોર્પોરેશન લિમીટેડના (કંપની) આંતરીક નાણાંકીય નિયંત્રણોનો ઓડીટ કરેલ છે અને તે કંપનીના સ્ટેન્ડઅલોન નાણાંકીય પત્રકોના ઓડીટને અનુલક્ષીને છે.

આંતરીક નાણાંકીય નિયંત્રણો માટે મેનેજમેન્ટની જવાબદારી :

આંતરીક નાણાંકીય નિયંત્રણની જાળવણીની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે અને તેનો આધાર કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટીંગ કાયદેરીયાનું આંતરીક નિયંત્રણ છે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલ ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર રીપોર્ટીંગના ગાઈડન્સ નોટમાં દર્શાવવામાં આવેલ છે. આ જવાબદારીઓમાં ડીઝાઈન, અમલીકરણ અને આંતરીકે નાણાંકીય નિયંત્રણોની જાળવણીનો સમાવેશ થાય છે કે જેથી ધંધો સારી અને સમયબદ્ધ રીતે ચાલી શકે, કંપનીની નિતીઓનું પાલન થાય, તેના હેતુઓ સચવાય, ઉચાપત અને ભૂલોને અટકાવી શકાય અને ઓળખી શકાય, હિસાબી રેકર્ડને બારબર અને સંપૂર્ણ રીતે જાળવી શકાય અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત જરૂરી નાણાંકીય માહિતી સમયસર તૈયાર કરી શકાય તેવી બાબતોનો સમાવેશ થાય છે.

ઓડીટરોની જવાબદારી :

અમારી જવાબદારી અમારા ઓડીટના આધારે કંપનીના આંતરીક નાણાંકીય નિયંત્રણો દ્વારા કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટીંગ બાબતે અભિપ્રાય આપવાનો છે. અમોએ અમારું ઓડીટ નાણાંકીય રીપોર્ટીંગ (ધી ગાઈડ નોટ) પર આંતરીક નાણાંકીય નિયંત્રણના ગાઈડન્સ નોટના આધારે અને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) કે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરેલ સ્ટેન્ડર્ડ ઓન ઓડીટીંગ પર આધારિત છે કે જેથી આંતરીક નાણાંકીય નિયંત્રણો પર એપ્લીકેબીલીટ વધારી શકાય. આ સ્ટેન્ડર્ડ અને ગાઈડન્સ નોટ મુજબ અમોએ એથીકલ જરૂરીયાતોનું પાલન કરવું પડે અને ઓડીટ તે રીતે કરવું પડે કે જેથી તે સાબિત થાય કે ફાઈનાન્શીલ રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે અને તે જાળવવામાં આવેલ છે અને તે મટીરીયલ સંદર્ભમાં સારી રીતે લાગુ કરવામાં આવેલ છે.

અમારા ઓડીયમાં એવી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવેલ છે કે જેથી નાણાંકીય રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે તે બાબતે ઓડીટમાં સાબિતી પ્રાપ્ત કરી શકાય. અમારા ઓડીટમાં નાણાંકીય રીપોર્ટીંગ પર થયેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો અને મટીરીયલ રીસ્કની ચકાસણી અને એસેસડ રીસ્ક પર ડીઝાઈનનું ટેસ્ટીંગ અને ઈવેલ્યુએશનની અસર વગેરે સામેલ છે. લાગુ કરવામાં આવેલ પ્રક્રિયા ઓડીટરના જજમેન્ટ પર આધારિત છે જેમાં નાણાંકીય પત્રકો પર મટીરીયલ મીસસ્ટેટમેન્ટના જોખમના મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે કે જે છેતરપીંડી કે ભૂલના કારણે હોય શકે.

અમો માનીએ છીએ કે અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ઓડીટની વિગતો કંપનીના નાણાંકીય રીપોર્ટીંગ પર રહેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો બાબતે ઓડીટ અભિપ્રાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને બરાબર છે.

નાણાંકીય રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણનું મતલબ :

કંપનીનું નાણાંકીય રીપોર્ટીંગ પરનું આંતરીક નાણાંકીય નિયંત્રણ તે પ્રક્રિયા છે કે જેથી નાણાંકીય રીપોર્ટીંગ બાબતે ખાત્રી પ્રાપ્ત કરી શકાય અને હિસાબી નીતિઓ મુજબ એક્ષટરનલ કામગીરી માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય. કંપનીના નાણાંકીય રીપોર્ટીંગ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણો તે નીતિઓ અને પદ્ધતિઓનો સમાવેશ થાય છે કે :

૧. રેકોર્ડની જાળવણી કરવા સારું કે જે વિગતવાર, ચોકસાઈ પૂર્વક કંપનીના એસેટની વિગતો દર્શાવી શકાય,
૨. એવી ખાત્રી આપી શકે કે નાણાંકીય પત્રકો માટેના લેવડ દેવડ કરવા માટે માન્યતા પ્રાપ્ત હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલ છે અને કંપનીના રસીદો અને ખર્ચાઓ કંપનીના મેનેજમેન્ટ અને નિયામકોના હુકમ મુજબ કરવામાં આવેલ છે,
૩. એવી ખાત્રી પ્રાપ્ત કરી શકાય કે કોઈ ગેરકાયદેસર એક્વેઝીશન કે કંપનીના એસેટનું ખોટી રીતે ઉપયોગ કે જે નાણાંકીય પત્રક પર અસર કરી શકે તેની સમયસર માહિતી પ્રાપ્ત કરી શકાય.

નાણાંકીય રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ :

નાણાંકીય રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ સિમિત હોવાથી, કે જેમાં મેળાપીપણાકે મેનેજમેન્ટની અયોગ્ય સંચાલન ના કારણે ભૂલ કે ગેરરીતીથી થયેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી ન શકાય. વધુમાં ભવિષ્યના સમયગાળા માટેના નાણાંકીય રીપોર્ટીંગ પરના આંતરીક નાણાંક નિયંત્રણોના વિશ્લેષણમાં તે ખતરો રહેલ છે કે પરિસ્થિતિમાં ફેરફારથી કે અન્ય કારણોથી તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય નહિ.

અભિપ્રાય :

અમારા મતે ને અમારી પાસે રહેલ માહિતી અને અમોને આપવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કંપની પાસે તમામ મટીરીયલ સંદર્ભમાં, નાણાંકીય રીપોર્ટીંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણ છે અને નાણાંકીય રીપોર્ટીંગ પર આવા આંતરીક નાણાંકીય નિયંત્રણો ૩૧ મી માર્ચ, ૨૦૨૧ના રોજ અમલમાં છે અને કંપની દ્વારા નાણાંકીય રીપોર્ટીંગ પર મૂકવામાં આવેલ આંતરીક નિયંત્રણના આધારે અને આંતરીક નિયંત્રણના જરૂરી કોમ્પોનેન્ટસના આધારે તેમ કહી શકાય કે તે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયાના ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર ફાઈનાન્શીયલ રીપોર્ટીંગના ગાઈડન્સ નોટ મુજબ છે.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૬૫૯૫

સહી/-

મલય જે દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સ્થળ : અમદાવાદ

તારીખ : ૧૬/૦૭/૨૦૨૧

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજનું સરવૈયું (રકમ રૂ.માં)			
વિગત	નોંધ નંબર	૩૧ માર્ચ, ૨૦૨૧	૩૧ માર્ચ, ૨૦૨૦
મિલકતો			
નોન કરન્ટ એસેટ			
મિલકત, પ્લાન્ટ અને યંત્રો		—	—
ચાલુ મુડી કામે	૪	૮,૧૭,૨૩૫	૩,૨૧,૦૨૭
અવાસ્તવિક મિલકતો		—	—
વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતો	૫	૬૫,૩૭,૩૩,૮૭૯	૬,૪૦,૭૯૧
નાણાકીય મિલકતો			
(અ) રોકાણો	૬	—	—
(બ) વેપાર લેણાં		—	—
(ક) લોનો		—	—
(ડ) અન્ય નાણાકીય મિલકતો		—	—
ડીફર્ડ કર મિલકતો (ચોખ્ખી)	૭	—	—
અન્ય નોન કરન્ટ એસેટ	૮	૨૯,૮૨,૯૩,૦૭૯	૧૩,૪૧,૫૮,૬૦૦
કુલ નોન કરન્ટ એસેટ		૯૫,૨૮,૪૪,૨૯૩	૧૩,૫૧,૨૦,૪૧૮
કરન્ટ એસેટ			
સ્ટોક		—	—
નાણાકીય મિલકતો			
(૧) રોકાણો	૯	૯૭,૦૧,૬૯,૪૨૪	—
(૨) વેપાર લેણાં		—	—
(૩) રોકડ અને રોકડ સમકક્ષ	૧૦	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૯૦,૦૭૬
(૪) લોનો		—	—
(૫) અન્ય નાણાકીય મિલકતો		—	—
ચાલુ કર મિલકતો (ચોખ્ખી)	૧૧	—	—
અન્ય કરન્ટ એસેટ	૧૩	—	—
કુલ કરન્ટ એસેટ		૧,૦૨,૩૫,૩૧,૦૪૨	૧૩,૯૦,૦૭૬
કુલ એસેટ		૧,૯૭,૬૩,૭૫,૩૩૫	૧૩,૬૫,૧૦,૪૯૪

વિગત	નોંધ નંબર	૩૧ માર્ચ, ૨૦૨૧	૩૧ માર્ચ, ૨૦૨૦
ઇકવીટી અને જવાબદારીઓ			
ઇકવીટી			
ઇકવીટી શેર મૂડી	૧૪	૧,૯૨,૩૭,૫૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦
અન્ય ઇકવીટી	૧૫	(૩,૫૬,૯૮,૬૧૫)	(૩,૭૧,૯૭,૪૦૬)
કુલ ઇકવીટી		૧,૮૮,૮૦,૫૧,૩૮૫	(૨,૭૧,૯૭,૪૦૬)
જવાબદારીઓ			
શેર અરજના નાણાં ફાળવણી માટે બાકી	૧૬	—	—
નોન કરન્ટ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ			
(૧) બોરોઈંગ	—	—	—
(૨) ચૂકવવા પાત્ર	—	—	—
(૩) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૭	૨,૪૮,૨૯,૦૬૮	—
જોગવાઈઓ		—	—
ડીફર્ડ કર જવાબદારીઓ (ચોખ્ખી)		—	—
અન્ય નોન કરન્ટ જવાબદારીઓ		—	—
કુલ નોન કરન્ટ જવાબદારીઓ		૨,૪૮,૨૯,૦૬૮	—
કરન્ટ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ			
(૧) બોરોઈંગ	૧૮	—	૧૪,૩૧,૨૭,૮૫૫
(૨) ચૂકવવા પાત્રનાં કારણો	૧૯	—	—
સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો		૨,૩૦,૯૨૬	—
સિવાયના સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો		—	૧,૯૨,૬૮,૪૦૩
જોગવાઈઓ	૨૦	૫,૩૪,૦૧,૦૧૬	૧૨,૨૫,૨૬૧
અન્ય કરન્ટ જવાબદારીઓ	૨૧	૭૮,૬૫,૫૮૮	૮૬,૩૮૧
કરન્ટ કર જવાબદારીઓ (ચોખ્ખી)	૨૨	૧૯,૯૭,૩૫૨	—
કુલ કરન્ટ જવાબદારીઓ		૬,૩૪,૯૪,૮૮૨	૧૬,૩૭,૦૭,૯૦૦
કુલ ઇકવીટી અને જવાબદારીઓ		૧,૯૭,૬૩,૭૫,૩૩૫	૧૩,૬૫,૧૦,૪૮૪

ખાસ હિસાબી પદ્ધતિઓ અને નોંધો ૧ થી ૪૦ નાણાંકીય પત્રકોનો ભાગ છે.

હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આંતરિક ભાગ છે.

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૯૪૩૨૩૫૫૫

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોશી

સીએફઓ

સહી/-

બી. સી. વર્લી

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૩૯૪૨

સહી/-

સંતોષ કુમાર

નિયામક / સીઈઓ

ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૯

સ્થળ : અમદાવાદ

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

<p align="center">બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ</p> <p align="center">સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨</p> <p align="center">૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂરા થતા વર્ષનું નફા-નુકસાન ખાતું</p> <p align="right">(રકમ રૂ.માં)</p>				
વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૦ થી ૩૧-૦૩-૨૦૨૧ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૧૯ થી ૩૧-૦૩-૨૦૨૦ના સમયગાળા માટે	
આવક				
કામગીરીમાંથી આવક		-	-	
અન્ય આવક	૨૩	૧,૯૭,૭૯,૨૩૨	૧૭,૫૯,૪૭૦	
કુલ આવક		૧,૯૭,૭૯,૨૩૨	૧૭,૫૯,૪૭૦	
ખર્ચાઓ :				
કર્મચારી લાભના ખર્ચાઓ				
સલાહકાર અને કોન્ટ્રાક્ટરોને ચૂકવણી	૨૪	૮,૨૯,૩૩૬	૬,૩૫,૦૦૩	
નાણાકીય ખર્ચાઓ	૨૫	-	-	
ઘસારો અને અમોરટાઈઝેશન ખર્ચ	૨૬	-	-	
અન્ય ખર્ચાઓ	૨૭	૧,૧૯,૪૮,૫૨૨	૨,૨૨,૦૭,૯૩૮	
કુલ ખર્ચાઓ		૧,૨૭,૭૭,૮૫૮	૨,૨૮,૪૨,૯૪૧	
અસામાન્ય બાબત અને ટેક્ષ પહેલાનો નફો/(નુકસાન)		૭૦,૦૧,૩૭૪	(૨,૧૦,૮૩,૪૭૧)	
અસામાન્ય આઈટમો		-	-	
કરવેરા પહેલાનો નફો / (નુકસાન)		૭૦,૦૧,૩૭૪	(૨,૧૦,૮૩,૪૭૧)	
કરવેરા ખર્ચ				
ચાલુ કર	૧૨	૫૫,૦૨,૫૮૨	-	
વિલંબિત કર		-	-	
કુલ કર ખર્ચ		૫૫,૦૨,૫૮૨	-	
વર્ષ દરમિયાન નફો / (નુકસાન) વેરા બાદ		૧૪,૯૮,૭૯૨	(૨,૧૦,૮૩,૪૭૧)	

અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક			
(૧) વસ્તુઓ કે જે નફા અથવા નુકસાન માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે નહીં	—	—	
(૨) વસ્તુઓ કે જે આવક વેરો જે નફા અથવા નુકસાન માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે નહીં	—	—	
(૩) વસ્તુઓ કે જે નફા અથવા નુકસાન માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે	—	—	
(૪) નફા અથવા નુકસાન માટે પુનઃ વર્ગીકૃત કરવામાં આવશે તેવી વસ્તુઓ લગતો આવકવેરો	—	—	
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક વર્ષ દરમિયાન	—	—	
વર્ષ દરમિયાન કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	૧૪,૯૮,૭૯૨	(૨,૧૦,૮૩,૪૭૧)	
શેર દીઠ કમાણી રૂ. ૧૦ ના એક એવા પૂરા ભરપાઈ થયેલા ૨૮			
પાયની	૦.૦૨	(૩૫.૩)	
ડિલ્યુટેડ	૦.૦૨	(૩૫.૩)	
ખાસ હિસાબી પદ્ધતિઓ અને નોંધો ૧ થી ૪૦ નાણાંકીય પત્રકોનો ભાગ છે.			
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આંતરિક ભાગ છે.			
સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એફઆરએન ૧૦૯૪૩૨૩૭૯	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
સહી/- મલય દલાલ ભાગીદાર સભ્ય નં. ૦૩૬૭૭૬	સહી/- એસ. એન. જોશી સીએફઓ	સહી/- બી. સી. વર્લી નિયામક ડીઆઈએન: ૦૭૧૩૩૯૪૨	સહી/- સંતોષ કુમાર નિયામક / સીઈઓ ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૯
સ્થળ : અમદાવાદ તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧	સ્થળ : ગાંધીનગર તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧		

બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજનું ઇક્વીટીમાં ફેરફારનું પત્રક

(રકમ રૂ.માં)

એ. ઇક્વીટી શેર ભંડોળ	
૧ લી એપ્રિલ ૨૦૧૯	-
૨૦૧૯-૨૦ દરમિયાન ફેરફાર	૧,૦૦,૦૦,૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૦	૧,૦૦,૦૦,૦૦૦
૨૦૨૦-૨૧ દરમિયાન ફેરફાર	૧,૯૧,૩૭,૫૦,૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૧	૧,૯૨,૩૭,૫૦,૦૦૦
બી. અન્ય ઇક્વીટી	
૧ લી એપ્રિલ, ૨૦૧૯	(૧,૬૧,૧૩,૯૩૫)
વર્ષ દરમિયાન થયેલ નફો / નુકસાન ૨૦૧૯-૨૦	(૨,૧૦,૮૩,૪૭૧)
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક	-
કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	(૨,૧૦,૮૩,૪૭૧)
૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ	(૩,૭૧,૯૭,૪૦૬)
વર્ષ દરમિયાન થયેલ નફો / નુકસાન ૨૦૨૦-૨૧	૧૪,૯૮,૭૯૨
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક	-
કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	૧૪,૯૮,૭૯૨
૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ	(૩,૫૬,૯૮,૬૧૫)
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આંતરિક ભાગ છે.	

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૯૪૩૨૩૫૯૫

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોશી

સીએફઓ

સહી/-

બી. સી. વર્લા

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૩૯૪૨

સહી/-

સંતોષ કુમાર

નિયામક / સીઈઓ

ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૯

સ્થળ : અમદાવાદ

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

બહુચરાણુ રેલ કોર્પોરેશન લિમીટેડ		
સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨		
૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત કૅશ ફ્લોનો પત્રક		
(રકમ રૂ.માં)		
વિગત	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
૧. ઓપરેટીંગ કામગીરીમાંથી કૅશ ફ્લો		
નફા-નુકસાનના પત્રક મુજબ વેરા પહેલાનો નફો/(નુકસાન)	૭૦,૦૧,૩૭૪	(૨,૧૦,૮૩,૪૭૧)
એડજેસ્ટ કરેલ :		
વ્યાજનો આવક	(૧,૯૪,૩૨,૧૫૨)	(૪,૬૧,૧૬૫)
નાણાકીય ખર્ચ	-	-
વર્કીંગ કેપીટલમાં ફેરફાર પહેલાનો ઓપરેટીંગ નફો/(નુકસાન)	(૧,૨૪,૩૦,૭૭૮)	(૨,૧૫,૪૪,૬૩૬)
વર્કીંગ કેપીટલના મૂવમેન્ટ માટે એડજેસ્ટમેન્ટ :		
અન્ય કરન્ટ એસેટમાં (વધારો) / ઘટાડો	-	-
ચૂકવવા પાત્ર ટ્રેડમાં વધારો) / (ઘટાડો)	(૧,૯૦,૩૭,૪૭૭)	૩૪,૩૮,૮૫૭
પ્રોવિઝનમાં વધારો / (ઘટાડો)	૫,૨૧,૭૫,૭૫૫	૯,૬૨,૦૬૧
અન્ય કરન્ટ જવાબદારીઓમાં વધારો / (ઘટાડો)	૭૭,૭૯,૨૦૭	૫૬,૭૯૨
અન્ય નાણાકીય જવાબદારીઓમાં વધારો / (ઘટાડો)	૨,૪૮,૨૯,૦૬૮	-
વર્તમાન કરની જવાબદારીઓમાં વધારો / (ઘટાડો)	૧૯,૯૭,૩૫૨	-
વર્કીંગ કેપીટલમાં ફેરફારો બાદનો ઓપરેટીંગ પ્રોફીટ	૬,૭૭,૪૩,૯૦૫	૪૪,૫૭,૭૧૦
ચૂકવેલ વેરો (રીફંડમાં નેટ)	(૫૫,૦૨,૫૮૨)	-
ઓપરેટીંગ કામગીરીમાં નેટ કૅશ ફ્લો (ઉપયોગમાં) (અ)	૪,૯૮,૧૦,૫૪૪	(૧,૭૦,૮૬,૯૨૬)
૨. રોકાણની કામગીરીમાં કૅશ ફ્લો		
ચાલુ કામગીરીમાં વર્કીંગ કેપીટલમાં વધારો	(૪,૯૬,૨૦૮)	(૩,૨૧,૦૨૭)
વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતોમાં (વધારો)/ઘટાડો	(૬૫,૩૦,૯૩,૧૮૮)	(૬,૪૦,૭૯૧)
નોન કરન્ટ એસેટમાં વધારો	(૧૬,૪૧,૩૪,૪૭૯)	(૧૩,૪૧,૫૮,૬૦૦)
રોકાણની કામગીરીમાં	૧,૯૪,૩૨,૧૫૨	૪,૬૧,૧૬૫
રોકાણો જીએસએફએસ	(૯૭,૦૧,૬૯,૪૨૪)	-
રોકાણની કામગીરીમાં નેટ કૅશ ફ્લો(ઉપયોગમાં)(બ)	(૧,૭૬,૮૪,૬૧,૧૪૭)	(૧૩,૪૬,૫૯,૨૫૩)

૩. નાણાકીય કામગીરીમાંથી કેશ ફલો :

શેર કેપીટલમાંથી	૧,૯૧,૩૭,૫૦,૦૦૦	૨૬,૦૦,૦૦૦
એપ્લીકેશન મનીની બાકી ફાળવણીમાંથી	—	—
ટૂંકાગાળાના બોરોઈંગમાંથી પ્રોસીડ્સ/(રીપેયમેન્ટ)	(૧૪,૩૧,૨૭,૮૫૫)	૧૪,૩૧,૨૭,૮૫૫
નાણાકીય કોસ્ટ	—	—
નાણાકીય કામગીરીમાં નેટ કેશ ફલો(ઉપયોગમાં)(સી)	૧,૭૭,૦૬,૨૨,૧૪૫	૧૪,૫૭,૨૭,૮૫૫

કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં વધારો (એ)+(બી)+(સી)	૫,૧૯,૭૧,૫૪૨	(૬૦,૧૮,૩૨૪)
વર્ષનાં શરૂ કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં	૧૩,૯૦,૦૭૬	૭૪,૦૮,૪૦૦
વર્ષના અંતે કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૯૦,૦૭૬

વર્ષના અંતે કેશ અને કેશ ઇક્વિવેલેન્ટનો બ્રેકઅપ		
કરન્ટ / સેવીંગ ખાતામાં બેંક ખાતે રહેલી બેલેન્સ	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૯૦,૦૭૬
	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૯૦,૦૭૬

નોંધો :

- કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં કેશ અને બેન્કની સીલ્લક અને બેન્કમાં રહેલ ડીપોઝીટ (જેમાં મેચ્યુરીટી ૩ મહિના કરતા ઓછા હોય તેનો સમાવેશ થાય છે).
- ભારતીય હિસાબી પદ્ધતિ-૭ મુજબ સ્ટેટમેન્ટ ઓફ કેશ ફલોમાં દર્શાવેલ 'ઈન્ડાયરેક્ટ મેથડ' મુજબ ઉપર દર્શાવેલ કેશ ફલો પત્રક તૈયાર કરવામાં આવેલ છે.
- જરૂરિયાત મુજબ ગત વર્ષના આંકડાઓને રીગ્રુપ અને રી કલેસીફાઈ કરવામાં આવેલ છે જેથી કરીને હાલના વર્ષના આંકડાઓ સાથે સમતુલા જળવાઈ રહે.

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૯૪૩૨૩૫૯૫

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોશી

સીએફઓ

સહી/-

બી. સી. વર્લી

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૩૯૪૨

સહી/-

સંતોષ કુમાર

નિયામક / સીઈઓ

ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૯

સ્થળ : અમદાવાદ

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાંકીય પત્રકોને લગત નોંધો

૧. કંપનીની માહિતી :

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ એ ગુજરાત સરકારના તા.૦૫/૦૨/૨૦૧૮ ના રોજના ઠરાવ નં. એમઆઈએસ૧૦-૨૦૧૭-૧૬૬૫-૧ - ૧ અન્વયેનો બહુચરાજી - કાટોસણ રેલવે પ્રોજેક્ટ માટેનો એક સ્પેશીયલ પર્પસ વ્હીકલ (એસપીવી) છે જેઓ ગુજરાત રાજ્યના કોટાસણ રોડ - બહુચરાજી - યાણસ્મા - રણુજ ૬૫ કિમી લાઈનના ગેજ ફેરફારને લગત ડેવલોપમેન્ટ, નાણાંકીય કામગીરી, આયોજન અને ઈમ્પલીમેન્ટેશનની કામગીરી કરશે.

૨. બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા તા.૨૬મી મે ૨૦૨૧ના રોજ પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ નાણાંકીય પત્રકોને મંજૂરી આપવામાં આવેલ છે.

૩(૧) તૈયારીનો આધાર :

આ નાણાંકીય પત્રકો હિસ્ટોરીકલ કોસ્ટના આધાર પર તૈયાર કરવામાં આવેલ છે, સિવાય કે અમુક નાણાંકીય ઉપકરણો જે ફેર વેલ્યુ પર દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે હિસ્ટોરીકલ કોસ્ટ માલ અને સેવાની વળતરની ફેર વેલ્યુના આધારે હોય છે. ફેર વેલ્યુ એટલે કે એ કિંમત જે બજારના સહભાગીઓ મૂલ્યાંકન તારીખે કોઈ એસેટ વેચીને અથવા તો જવાબદારીઓ હસ્તાંતર કરવા માટે આપેલી કિંમત.

એ. પૂર્વતાનું નિવેદન :

આ નાણાંકીય પત્રકો ભારતીય હિસાબી પદ્ધતિઓ (ઈન્ડ એએસ) મુજબ કંપનીઝ (ઈન્ડીયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમો, અને તેના અન્ય પ્રાવધાનો કે જે કંપની દ્વારા ૨૦૧૩ મુજબ સમયાંતરે બદલાતા રહે છે. તે મુજબ તૈયાર કરવામાં આવેલ છે.

કંપનીના હિસાબી પદ્ધતિઓની વિગત નોંધ ૩ (બી) માં દર્શાવેલ છે.

બી. કાર્યાત્મક અને કરન્સીની રૂપરેખા :

આ નાણાંકીય પત્રકોને ભારતીય રૂપિયામાં (આઈએનઆર) માં તૈયાર કરવામાં આવેલ છે જે કંપનીનો કાર્યરત કરન્સી છે.

સી. અંદાજો અને નિર્ણયોનો ઉપયોગ :

આ નાણાંકીય પત્રકો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ દ્વારા નિર્ણયો, અંદાજો અને ધારણાઓ કરેલ છે કે જે હિસાબી પદ્ધતિઓના અમલને અસર કરે છે અને એસેટ, લાયબલીટી, આવક અને ખર્ચને દર્શાવેલ છે. ખરેખરના પરિણામો કરેલા અંદાજોથી જુદા હોઈ શકે છે.

અગત્યતા અંદાજો અને જજમેન્ટ

આ નોંધમાં ઉચ્ચ સત્રના જજમેન્ટ અને ઝટીલતાની રૂપરેખ આપે છે અને તેવી આઈટમો કે જેને અંદાજો અને એસમ્પશનોના ધોરણે વધારે એટજેસ્ટ કરવામાં આવે અને તે ખરેખર કરતા જુદો એસેસ થઈ તેને દર્શાવવામાં આવેલ છે. દરેક અંદાજો અને જજમેન્ટની વિગતવાર માહિત લાગતા વળગતા નોંધોમાં આપવામાં આવેલ છે અને તેના આધારે દરેક આઈટમની ગણતરી નાણાંકીય પત્રકમાં કરવામાં આવેલ છે.

અગત્યના અંદાજો અને જજમેન્ટને અસરકરતા ક્ષેત્રો :

● **ઘસારો અને ઋણમુક્તિ :**

- ઘસારો અને ઋણમુક્તિ એ નિયામકોના અંદાજો, મિલકતનો ઉપયોગી જીવન, યંત્ર અને સાધનો અને અવાસ્તવિક મિલકતો પર આધાર રાખે છે. અંદાજો તકનીકી વિકાસ હરિફાઈઓ - બજારની બદલાતી નીતિઓ અને અન્ય પરિબળોથી બદલી શકે છે અને તે અંદાજીત ઉપયોગી જીવન અને ઘસારો પરિણામ પણ બદલી શકે છે.

અન્ય ક્ષેત્રો નીચે મુજબ છે.

- **ચાલુ ચૂકવવાપાત્ર વેરા અને વિલંબીત વેરાનો અંદાજ :**

વિલંબીત મિલકત ત્યાં સુધી જ ઓળખવામાં આવે જ્યાં સુધી કામચલાઉ તફાવતોની સમજણ ના પડે ત્યાં સુધી કરવામાં આવે છે. કંપની અમુક કેસમાં વિલંબીત મિલકત કર અને જવાબદારીઓ ચાલુ કરના કાયદાઓ અને દરના આધારે અંદાજો કરતી હોય છે. જેમાં ધંધાનો પ્લાન, સંચાલનની અપેક્ષાઓ અને મિલકતની સમયસર પુનઃપ્રાપ્તિ પણ સામેલ થાય છે. આ અંદાજોમાં ફેરફાર વિલંબીત જવાબદારી કર અથવા વિલંબીત મિલકત કરનું મૂલ્યાંકન પર અસર કરે છે અને તેના હિસાબે નફા-નુકસાનમાં કર નોંધવામાં આવે છે.

કરની જવાબદારીની જોગવાઈઓને કર કાયદાનું અર્થઘટનના ચુકાદાની, કેસના વિકાસની અને કર ઓડિટમાં સંભવિત પરિણામો અને અપીલની જરૂર પડતી હોય છે તેથી વાસ્તવિક પરિણામ અપેક્ષાઓથી અલગ હોઈ શકે અને તે જોગવાઈઓમાં પરિવર્તિત થાય છે. વિલંબીત મિલકત કરનું મૂલ્યાંકન, રોકડ કર સેટલમેન્ટ અને તેથી નફા-નુકસાન ખાતામાં તે પ્રમાણે કર નોંધવામાં આવે છે.

- **જોગવાઈઓ અને આકસ્મિત પરિસ્થિતિઓનું મૂલ્યાંકન અને માપન :**

સમયાંતરે કંપનીને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. જેનું અંતિમ પરિણામ અનિશ્ચિતાઓથી ભરેલું છે. ખર્ચ માટેનું જોગવાઈઓ ત્યારે કરવામાં આવે છે કે જે ચૂકવણી નિશ્ચિતપણે કરવામાં આવશે અથવા કરેલ છે અને કે જેનું વ્યાજબી અંદાજ મૂકવામાં આવેલ છે.

અન્ય પરીબળોની વચ્ચે બિનતરફેણ કારી પરિણામની સંભાવના અને સંભવિત નુકસાનની રકમનો વ્યાજબી અંદાજ કાઢવાની ક્ષમતાનો મૂલ્યાંકન કરતી વખતે નોંધપાત્ર નિર્ણય લેવામાં આવે છે. ખર્ચની જોગવાઈઓની સમીક્ષા દરેક હિસાબી સમયગાળામાં કરવામાં આવે છે અને હકીકતો અને સંજોગોમાં થયેલ ફેરફારોને આધારિત સુધારાઓ કરવામાં આવે છે.

- **સંપત્તિઓની ક્ષતિ :**

પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઈકવીપમેન્ટમાં અવાસ્તવિક મિલકતો કે જેનું ઘસારા અને ઓમરટાયઝેશન થાય તેને ક્ષતિઓ માટે સમયાંતરે ચકાસવામાં આવે છે. વધુમાં જ્યારે એવી પરિસ્થિતિ સ્થાપિત થાય કે જેમાં રોકડ પ્રવાહ ધરાવતું યુનિટની વસૂલી કિંમત તેની ચાલુ કિંમત કરતા ઓછી હોય તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રોકડ પ્રવાહ ધરાવતું યુનિટની વસૂલી કિંમત એટલે તેની ચાલુ કિંમત અને વ્યાજબી કિંમત ઓછા વેચાણ ખર્ચ બંનેમાંથી જે વધુ હોય એ હોય છે કે ગણતરીમાં અમને નોંધપાત્ર અંદાજો અને ધારણાઓનો સમાવેશ થાય છે. જેમાં ટર્ન ઓવર અને અરનિંગ ગુણાંક, વૃદ્ધિ દર, અને નેટ માર્જિનનો સમાવેશ થાય છે. જે અંદાજિત ભાવિ રોકડ પ્રવાહની ગણતરી કરવા માટે વપરાય છે.

(ડી) ફેર વેલ્યુની ગણતરી :

ફેર વેલ્યુ માટે કંપનીના ગણા બધા હિસાબી પદ્ધતિઓની અને ખુલાસાઓની જરૂરીયાત રહેલ છે, બંને નાણાંકીય અને બીન - નાણાંકીય એસેટ્સ અને જવાબદારીઓને લગત.

ફેર વેલ્યુઓને જુદા જુદા લેવલમાં વિભાજિત કરવામાં આવેલ છે અને તેનો આધાર નીચે જણાવેલ વેલ્યુએશન પદ્ધતિઓ પર રહેલ છે.

- પ્રથમ લેવલ: સક્રિય બજારમાં નિર્ધારિત થયેલ કિંમત (એડઝસ્ટ કર્યા સિવાયના) કે જે એક જ પ્રકારના એસેટ અને જવાબદારીઓ માટે છે.
- બીજો લેવલ: લેવલ ૧ માં નિર્ધારિત કરેલ કિંમતો સિવાયના કે જેને એસેટ કે લાયબલીટી, સીધી રીતે (એટલે કે કિંમત તરીકે) કે આડકતરી રીતે (એટલે કે કિંમતમાંથી પ્રાપ્ત થયેલ) નોંધવામાં આવેલ છે.
- ત્રીજો લેવલ: એસેટ કે લાયબલીટીમાંથી પ્રાપ્ત થયેલ ઈનપુટ કે ઓબઝર્વેબલ માર્કેટ ડેટા (અનઓઝરવેબલ - ઈનપુટ) પર આધારિત ન હોય.

જ્યારે કોઈ પણ એસેટ કે લાયબલીટીની ફેર વેલ્યુની ગણતરી કરવામાં આવેલ ત્યારે કંપની દ્વારા દર્શનીય બજાર કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ પણ એસેટ કે લાયબલીટીના ફેર વેલ્યુ માટે ઉપયોગ કરવામાં આવેલ ઈનપુટ જુદા જુદા ફેર વેલ્યુમાં આવતી હોય તો ફેર વેલ્યુની ગણતરીને સૌથી નીચેના સ્તરના ઈનપુટ પર દર્શાવવામાં આવે છે કે સંપૂર્ણ ગણતરી માટે જરૂરી છે.

કંપની ફેર વેલ્યુના સ્તરો વચ્ચેના ટ્રાન્સફરને રીપોર્ટીંગ સમયગાળાના અંતે થયેલ ફેરફારોના આધારે ઓળખે છે.

ફેર વેલ્યુની ગણતરીના સમયે કરેલ એસમ્પ્શનો બાબતેની વિગત નીચે દર્શાવેલ નોંધોમાં સામેલ રાખેલ છે.

(ઇ) વૈશ્વિક મહામારી કોવીડ - ૧૯ :

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ વિશ્વ અને ભારતની આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર રીતે ધીમી કરેલ છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) અને ભારતમાં ફાટી નીકળવું એ ધીમી અર્થતંત્રની કામગીરીને નોંધપાત્ર રીતે વિઘ્ન છે. વર્ષ દરમિયાન કોવિડ-૧૯ ને લીધે કંપનીની કામગીરી પર અસર પડેલ છે. કંપનીએ નાણાંકીય પત્રકો, મળવાપાત્ર મિલકતની કિંમત આંતરીક અને બાહ્ય માહિતી, વર્તમાન અને ભવિષ્યની અર્થતંત્રની નીતિઓની હિસાબી ચોપડે હકારાત્મક અસર નોંધેલ છે. રૂપાંતર દરે ઐતિહાસિક ખર્ચના આધારે માપવામાં આવી છે.

૩(૨) અગત્યના હિસાબી પોલીસીઓ

નીચે દર્શાવેલ હિસાબી પોલીસીઓ હાલના નાણાંકીય પત્રકોના સમયગાળા દરમિયાન અમલમાં મુકવામાં આવેલ છે.

એ. વિદેશી ચલણ વ્યવહારો :

કંપનીના વિદેશી ચલણમાં કરેલા વ્યવહારો કાર્યાત્મક ચલણમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને આ વ્યવહારોની તારીખે રૂપાંતર દર અથવા સરેરાશ દરે કરવામાં આવ્યા છે. અને વ્યવહારની તારીખે સરેરાશ તરીકે વાસ્તવિક દર આશરે કરવામાં આવેલ છે.

નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ કે જે વિદેશ ચલણમાં થયો છે તે જાણ કરવાની તારીખે રૂપાંતરિત થઈને રૂપાંતર દરે કાર્યાત્મક ચલણમાં કરવામાં આવી છે. બિન નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ કે જે વિદેશી ચલણમાં વાજબી દરે થઈ છે તે જ્યારથી વ્યાજબી દર નિર્ધારિત થઈ ત્યારે રૂપાંતર દરે કાર્યાત્મક ચલણમાં રૂપાંતર કરવામાં આવી છે. બિન નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ વ્યવહારની તારીખે વિદેશી ચલણમાંથી ઐતિહાસીક કિંમતે ટ્રાન્સફર કરવામાં આવે છે.

નીચે જણાવેલ ઓસીઆઈ સ્વીકૃત રીતે રૂપાંતર દર તફાવત કે જે રૂપાંતરમાંથી થયેલ છે અને તેના સિવાય રૂપાંતર તફાવત નફા અથવા નુકસાનમાં માન્ય રાખવામાં આવેલ છે.

- ઓસીઆઈ દ્વારા વ્યાજબી દરે ઈક્વિટી રોકાણ (એફવીઓસીઆઈ)
- જ્યાં સુધી હેજિસ અસર કરે ત્યાં સુધી યોગ્ય રોકડ પ્રવાહ હેજિસ.

બી. નાણાંકીય ઉપકરણો :

ઓળખ અને પ્રાથમિક ગણત્રીઓ

ટેડ રીસીવેબલ ઊભા થાય ત્યારે જ તેની ઓળખ કરવામાં આવેલ છે. અન્ય તમામ નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારીઓને અગાઉથી જ કંપની ઓળકે છે કે જ્યારે તે ઈન્સ્ટ્રુમેન્ટના કરારના પ્રાવધાનોનો ભાગ બને છે.

એક નાણાંકીય એસેટ કે નાણાંકીય જવાબદારીને સૌ પ્રથમ તેના ફેર વેલ્યુમાં ગણવામાં આવે છે અને તેવા આઈટમો કે જે ફેર વેલ્યુમાં નથી તેને નફા નુકસાનથી (એફવીટીપીએલ)થી ગણત્રી કરવામાં આવે છે, ટ્રાન્સેક્શનની કિંમતને સીધી રીતે તેને પ્રાપ્ત કે ઈશ્યુ કરતી વખતે ગણત્રી કરવામાં આવે છે.

વર્ગીકરણ અને ત્યારબાદની ગણત્રી અને નફા અને નુકસાન : નાણાંકીય એસેટ

એમોરટાઈઝડ કિંમતે નાણાકીય એસેટ : આવા એસેટો પાછળથી તેના એમોરટાઈઝડ કિંમતે અસરકારક વ્યાજ પદ્ધતિથી ગણવામાં આવે છે. ઈમ્પેરમેન્ટ નુકસાનથી એમોરટાઈઝડ કિંમતમાં ઘટાડો થાય છે. વ્યાજની આવક, ફોરેન એક્સચેન્જની પ્રાપ્તિ અને નુકસાનોની ઓળખ નફા કે નુકસાન ઉપર થાય છે. કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન કે ડીરેકગનાઈઝેશનની અસર નફા અને નુકસાનના પત્રકો ઉપર થાય છે.

નાણાકીય એસેટની સાચી કિંમત કોમ્પ્રીહેન્સીવ આવક (એફવીટી ઓસીઆઈ)ના આધારે :

તમામ ઈફવીટી રોકાણોને ફેર વેલ્યુમાં ગણત્રી કરવામાં આવે છે. જેવા રોકાણો કે જે વેચાણ માટે કરવામાં ન આવેલ હોય અને જ્યાં કંપની દ્વારા તેને એફવીટીઓસીઆઈમાં વર્ગીકરીત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં રોકાણમાં થયેલ તમામ ફેર વેલ્યુ ચેન્જને અધર કોમ્પ્રીહેન્સીવ ઈન્કમમાં (ઓસીઆઈ) માં દર્શાવવામાં આવે છે. એક્યુમીલેટ થયેલ નફા અને નુકસાનને ઓસીઆઈમાં દરેક ઈન્વેસ્ટમેન્ટના વેચાણથી થયેલ આવકમાં ફેરવર્ગીકરણ કરવામાં આવે છે.

નફા અને નુકસાનથી ફેર વેલ્યુને લગત નાણાંકીય એસેટસ (એફવીટીપીએલ) - આવા એસેટસ પાછળથી ફેર વેલ્યુ તરીકે આપવામાં આવે છે. નેટ નફા અને નુકસાન, જેમાં કોઈ વ્યાજ કે ડીવીડન્ટની આવકનો સમાવેશ થાય છે તે નફા કે નુકસાન તરીકે દર્શાવાય છે.

વર્ગીકરણ, પાછળથી કરવામાં આવેલ ગણત્રી અને નફો અને નુકસાન : નાણાંકીય જવાબદારીઓ

નાણાંકીય જવાબદારીઓને પાછળથી એમોરટાઈઝડ કિંમત પર ગણત્રી કરવામાં આવે છે અને તેમાં અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વેચાણ અને એક વર્ષમાં ચૂકવવા પાત્ર રકમો માટે કે જે બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં હોય તેમાં રકમ કિંમત ફેર આવા રોકાણોમાં રહેલ ફેર વેલ્યુ કિંમત પ્રમાણે હોય છે.

ઈક્વિટી સાધનો

ઈક્વિટી સાધન એ કરાર છે કે કંપનીની જવાબદારીઓ ચૂકવ્યા બાદ મિલકતોમાં શેષ વ્યાજનો પૂરાવો આપે છે ઈક્વિટી સાધન જારી કરવા સુધી વધારાના ખર્ચને સીધા આભારી ખર્ચ કોઈ પણ યોખ્યા કરની અસરને ઈક્વિટીમાંથી બાદ કર્યા બાદ ઓળખવામાં આવે છે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય એસેટ

કંપની દ્વારા કોઈ પણ નાણાંકીય એસેટને ડીરેકગનાઈઝ ત્યારે કરવામાં આવે જ્યારે આવા નાણાંકીય એસેટમાંથી રહેલ કેશ ફલોના કોન્ટ્રાક્ટુઅલ હક્ક પુરા થઈ જાય કે તેના દ્વારા કોન્ટ્રાક્ટુઅલ કેશ ફલો ના હક્કોને ટ્રાન્સફર કરવામાં આવે કે જેથી રહેલ તમામ માલિકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કરવામાં આવે કે જ્યારે કંપની દ્વારા તમામ માલિકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કે રીટેઈન કરવામાં ન આવે અને તેના દ્વારા નાણાંકીય એસેટ પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ રહે નહીં.

જો કંપની દ્વારા તેવા લેવડ દેવડો કરવામાં આવે કે જેતી તેના દ્વારા બેલેન્સ શીટમાં દર્શાવેલ એસેટને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ તેના દ્વારા તમામ રીસ્ક અને આવકને પોતાની પાસે રાખવામાં આવે તો આવા ટ્રાન્સફર કરવામાં આવેલ એસેટને ડીરેકગનાઈઝ કરવામાં ના આવે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય જવાબદારીઓ

કંપની દ્વારા કોઈ નાણાંકીય જવાબદારીઓને ત્યારે ડીરેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેને લગત કરારની જવાબદારીઓને પુરી કે રદ કરવામાં આવેલ હોય કે તે એક્ષપાયર થઈ ગયેલ હોય.

કંપની દ્વારા ત્યારે પણ એક નાણાંકીય જવાબદારીને ડીરેકગનાઈઝ કરવામાં આવે છે જ્યારે તેના ટર્મમાં ફેરફાર કરવામાં આવેલ હોય અને નવા ટર્મ મુજબ કેશ ફલોમાં ખૂબ જ વધારે ફેરફારો હોય. હાલના કિસ્સામાં, એક નવા નાણાંકીય જવાબદારી કે જે ફેરબદલી કરેલ શરતો મુજબ તેના ફેર વેલ્યુ પર ઓળખવામાં આવેલ છે. પૂરી થયેલ નાણાંકીય જવાબદારીને લગત રકમ હાથ પર રાખવા અને પેરફાર મુજબના નવા નાણાંકીય જવાબદારીને ઓળખવામાં રહેલ ફરકને નફા અને નુકસાન માં દર્શાવવામાં આવે છે.

ઓફસેટીંગ

નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારી એક ઓફસેટ છે અને બેલેન્સ શીટમાં દર્શાવેલ નેટ રકમ ત્યારે જ હોય જ્યારે કંપની પાસે હાલમાં રકમને ઓફસેટ કરવા માટે કાયદાકીય હક્ક રહેલ હોય અને તે તેને સેટલ કરવા માંગતી હોય કે એસેટ રીલીઝ કરવા અને એક સાથે જવાબદારીઓ સેટલ કરવા માંગતી હોય.

(સી) કરન્ટ અને નોન કરન્ટ વર્ગીકરણ :

કંપની દ્વારા બેલેન્સ શીટમાં એસેટ અને જવાબદારીઓ દર્શાવવામાં આવે છે અને તેનો આધાર કરન્ટ / નોન કરન્ટ વર્ગીકરણ છે. એસેટને કરન્ટ તરીકે ત્યારે દર્શાવવામાં આવે જ્યારે:-

- (એ) તેને રીયલાઈઝ કરવા, કે વેચવા કે કંપનીની જરૂરીયાતો માટે ઉપયોગ કરવાનું હોય ત્યારે.
- (બી) પ્રાથમિક ધોરણે ધંધા માટે રાખવામાં આવેલ હોય.
- (સી) રીપોર્ટિંગની તારીખથી ૧૨ માસમાં તેને રીયલાઈઝ કરવાની થાય તો.
- (ડી) રોકડ કે રોકડ સમાન હોય અને તેની લેવડ દેવડ કરવામાં પ્રતિબંધ ન હોય કે તેને જવાબદારી પુરી કરવા માટે રીપોર્ટિંગની તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય ત્યારે.

બાકી રહેલ તમામ એસેટોને નોન - કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

લાયબલીટી ત્યારે કરન્ટ છે કે જ્યારે :

- (એ) તે કંપની દ્વારા તેના સામાન્ય ક્રમે સેટલ કરવામાં આવનાર હોય ત્યારે.
- (બી) તેને ફક્ત ધંધા માટે રાખવામાં આવેલ હોય તો.
- (સી) તેને રીપોર્ટિંગ તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય તો.
- (ડી) રીપોર્ટિંગની તારીખથી ૧૨ માસમાં કંપની પાસે જવાબદારી સેટલ કરવા માટેનો બીનશરતી હક્ક રહેલન હોય ત્યારે.

બાકી રહેલ તમામ લાયબલીટીને નોન - કરન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

કામગીરીની પ્રક્રિયા

પ્રોસેસ માટે પ્રાપ્ત કરવામાં આવેલ એસેટ અને તેનાથી રકમ કે તેના સમાંતર કોઈ લાભ પ્રાપ્ત થયા વચ્ચેના સમયને ઓપરેટિંગ સાયકલ કહેવામાં આવે છે. કંપનીએ તેની કામગીરીની પ્રક્રિયાને ૧૨ મહિના નક્કી કરેલ છે.

(ડી) મિલકત, પ્લાન્ટ અને યંત્ર :

માન્યતા અને માપદંડ :

સંપત્તિની વસ્તુઓ, પ્લાન્ટ અને યંત્ર પડતર કિંમતે માપવામાં આવે છે. જે મૂડીકૃત ઉધાર ખર્ચ, બાદ એકત્રિત ઘસારો અને એકત્રિત ઘટાડા નુકસાન જો હોય તો સહિત હોય છે.

સંપત્તિની કોઈ પણ વસ્તુની કિંમત, પ્લાન્ટ અને સાધનો તેની ખરીદ કિંમત, આયાત જકાત અને બિનપરતપાત્ર ખરીદ કર, સહિત ને સમાવે છે અને તે વેચાણ છૂટ અને કસર બાદ કર્યા પછી, વસ્તુને તેની ઉપયોગી પરિસ્થિતિમાં લાવવા માટે સીધા આભારી ખર્ચ અને તેની તોડી પાડવાની અંદાજિત કિંમત અને કાઢી નાખવાની અને જે જગ્યાએ સાચવી રાખેલ હોય તેને પુનઃસ્થાપિત કરે છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનોની સ્વ નિર્માણ કિંમત માલસામાન કિંમત અને મંજૂરી, અન્ય સીધા આભારી ખર્ચ કે જે વસ્તુને ઉપયોગી પરિસ્થિતિમાં લાવવા માટે અને તેની તોડી પાડવાની અંદાજિત કિંમત અને કાઢી નાખવા સહિતની કિંમતને પુનઃ સ્થાપિત કરવા સહિતને સમાવે છે.

જો કોઈ પણ સંપત્તિ, પ્લાન્ટ અને સાધનનો નોંધપાત્ર ભાગ અલગ ઉપયોગી જીવન ધરાવતું હોય તો તેને હિસાબી ચોપડે અલગ વસ્તુ (મુખ્ય ભાગ) સંપત્તિ, પ્લાન્ટ અને સાધન તરીકે નોંધ કરેલ છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનોની કોઈ વસ્તુના નિકાસ પર થતો લાભ અથવા નુકસાન નફા અથવા નુકસાન ખાતામાં બતાવવામાં આવે છે.

અનુગામી ખર્ચ :

અનુગામી ખર્ચ ત્યારે જ મૂડીકરણ થયે કે જ્યારે ખર્ચ સાથે જોડાયેલા ભવિષ્ય આર્થિક લાભો કંપનીને થશે.

ઘસારો :

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનો પર ઘસારો કંપની અધિનિયમ ૨૦૧૩ ના શિડ્યુલ ૨ માં જણાવેલ ઉપર જીવન દરના આધારે સીધી લીટીના આધાર પર પૂરો પાડવામાં આવેલ છે. કોઈ મિલકત જેની કિંમત રૂ. ૫,૦૦૦ કરતા ઓછી છે તે જે વર્ષમાં મૂડીકરણ થયું તે જ વર્ષમાં પૂરેપૂરો ઘસારો ગણવામાં આવેલ છે.

એડીશન (ડીઝપોઝલ) પર ના ઘસારાને પ્રો - રેટા આધારે પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે જે તારીખથી આવા એસેટનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોય. (ડીઝપોઝ કરવામાં આવેલ હોય). ઘસારાની રીત, ઉપયોગી જીવનકાળ અને રેસિડ્યુઅલ કિંમતનો રીવ્યુ દરેક નાણાકીય વર્ષમાં કરવામાં આવે છે અને દરેક નાણાકીય વર્ષના અંતે જો જરૂરી હોય તો તેને એડજેસ્ટ કરવામાં આવે છે. જો રીવીઝન કરવાનું થાય તો, રીવાઈઝ કરવામાં આવેલ બાકી ઉપયોગી જીવનકાળ પર અનએમોરાઈઝડ ઘસારાની રકમ ચાર્જ કરવામાં આવે છે. રીટાયરમેન્ટ કે ફાયદા કે નુકસાનથી થયેલ લોસ કે જે કોઈ પણ ફિક્સ એસેટને ડીઝપોઝ કરવાથી થાય તેને નફા અને નુકસાનના પત્રકમાં કિંમત મુજબ દર્શાવવામાં આવે છે.

ચાલુ રહેલ કેપીટલ કામગીરીમાં એવા એસેટ પર થયેલ ખર્ચ કે જેને હજુ પણ કમીશન કરવાની બાકીમાં હોય તેનો સમાવેશ થાય છે. તમામ સીધી રીતે ઓળખાયેલ અને નક્કી થઈ શકે તેવા ખર્ચાઓને કે જે એક સમાન અને એસેટના બાંધકામના સમયગાળાને લગતા હોય તેને જ્યાં સુધી તે ઉપયોગ માટે તૈયાર થયા ત્યાં સુધી તેને કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ (સીડબલ્યુઆઈપી)માં રાખવામાં આવે છે અને તે કમીશન થાય ત્યારબાદ તેને લાગતા વળગતા ફિક્સ એસેટમાં ટ્રાન્સફર કે એલોટ કરવામાં આવે છે.

ઈ. વિકાસ હેઠળની અવાસ્તવિક સંપત્તિ :

વિકાસ હેઠળ ભાડું વહેંચણી અધિકાર :

ખર્ચાઓ કે જે કન્સોસન સેવા હેઠળ સીધા ઓળખી શકાતા હોય તે વિકાસ હેઠળ ભાડા વહેંચણી અધિકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રોજેક્ટ ના પરોક્ષ ખર્ચા જે તે પ્રોજેક્ટના અમલીકરણ સુધી ચાર્જ કરવામાં આવ્યા છે વધુમાં પ્રોજેક્ટના અમલીકરણ માટે જે એડવાન્સ ગતિશીલતા આપવામાં આવી છે તેના પરનો મેળવેલ વ્યાજ વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકતમાંથી બાદ કરવામાં આવેલ છે.

એફ. ક્ષતિ :

નાણાંકીય સાધનોને ક્ષતિ :

કંપની નાણાંકીય સંપત્તિ પરના અંદાજિત ધિરાણ માટે નુકસાન ભથ્થાને અમોરટાઈઝ કિંમત પરના માપદંડને માન્યતા આપે છે.

દર જાણ કરવાની તારીખે કંપની તેની નાણાંકીય સંપત્તિ અમોરટાઈઝ કિંમત લાવવામાં આવી છે અને ધિરાણ નુકસાન પર છે કે નહિ તેની આકારણી કરે છે. નાણાંકીય સંપત્તિ ત્યારે ધિરાણ ક્ષતિગ્રસ્ત થાય છે કે જ્યારે એક અથવા વધારે ઘટનાઓ કે જે નાણાંકીય સંપત્તિની અંદાજિત રોકડ પ્રવાહ પર હાનિકારક અસર થઈ હોય.

કંપની આજીવન અંદાજિત ધિરાણ નુકસાન રકમના બરાબર નુકસાન ભથ્થાનું માપન કરે છે. આ જીવન ધિરાણ નુકસાન એ નુકસાન છે કે જે તમામ મૂળભૂત શક્યતાઓ પર નાણાંકીય સાધનોની અંદાજિત જીવનના પરિણામ રૂપે મળે.

નાણાંકીય સંપત્તિ નક્કી કરતી વખતે શરૂઆતથી જ નાણાંકીય સંપત્તિનો ધિરાણ જોખમ નોંધપાત્ર રીતે થયો હતો અને અંદાજિત અપેક્ષિત ધિરાણ નુકસાન થયા ત્યારે કંપની એ અનુસૂચિત પડતર અથવા પ્રયાસ વગર જરૂરી પ્રાપ્ત થયેલી માહિતી અને કારણભૂત ને માન્ય રાખી છે. આ વસ્તુ કંપનીની ભૂતકાળના અનુભવ અને જણાવેલ ધિરાણ આકારણી અને આગળ દેખાયેલ માહિતીના આધારે માત્રાત્મક અને ગુણાત્મક માહિતી અને વિશ્લેષણ ને પણ સામેલ કરે છે.

અપેક્ષિત ધિરાણ નુકસાનનું માપન :

અપેક્ષિત ધિરાણ નુકસાન એ ભારિત સંભાવનાના ધિરાણ નુકસાન છે. ક્રેડિટ નુકસાનએ રોકડ ઘટની વર્તમાન કિંમતે માપવામાં આવે છે. (દા.ત. કરારના અનુસાર કંપનીના રોકડ પ્રવાહ અને કંપનીના અંદાજિત મેળવવાપાત્ર વેપારના રોકડ પ્રવાહ વચ્ચેનો તફાવત)

સરવૈયામાં અપેક્ષિત ધિરાણ નુકસાન માટે ભથ્થાની રજૂઆત.

નાણાંકીય સંપત્તિ પરનો નુકસાન ભથ્થો અમોરટાઈઝ કિંમતે માપવામાં આવે છે અને સંપત્તિની અંકિત વહન મૂલ્યમાંથી બાદ થાય છે.

માંડી વાળવું :

નાણાંકીય સંપત્તિની અંકિત વહન મૂલ્ય એ હદ સુધી માંડી વાળવામાં આવે છે કે જ્યાં પુનઃપ્રાપ્તિની કોઈ વાસ્તવિક તક નથી (આંશિક અથવા તો સંપૂર્ણ). આ સામાન્ય રીતે એવા કેસમાં થાય છે કે જ્યાં દેવાદાર પાસે કોઈ સંપત્તિ ન હોય અથવા આવકનો કોઈ સ્ત્રોત ન હોય જેનાથી ચૂકવવાની રકમ માટે પૂરો રોકડ પ્રવાહ હોય. જો કે જે નાણાંકીય સંપત્તિ માંડી વાળેલ છે તે એ શરતે કરેલ છે કે કંપનીની પ્રક્રિયાનું પાલન કરીને અમલીકરણની પ્રવૃત્તિઓ કરીને નાણાંની પુનઃપ્રાપ્તિ કરી શકાય.

બિન નાણાંકીય સંપત્તિનો ક્ષતિ :

કંપનીની બિન નાણાંકીય સંપત્તિ, માલસામાન અને વિલંબીત કર સિવાય જાણ કરવાની તારીખે સમીક્ષા કરવામાં આવે છે કે ક્યાંક આ સંપત્તિઓ ને નુકસાનનો સંકેત નથી. અને જો એવો કોઈ સંકેત હોય તો મિલકતની પુનઃપ્રાપ્તિની રકમ અંદાજવામાં આવે. બિન નાણાકીય મિલકતોના ઉપયોગથી અંદાજિત ભાવિ રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય પરથી નક્કી કથરવામાં આવે છે. જો સંપત્તિ (રોકડ ઉત્પાદન એકમ)ની વસૂલ કરી શકાય તેવી રકમ તેની વહન ક્ષમતાની રકમ કરતા ઓછી હોવાનો અંદાજ હોય તો, સંપત્તિની વહન રકમ (રોકડ ઉત્પાદન એકમ) એની વહન પાત્ર રકમ સુધી ઘટાડવામાં આવે છે. આ ક્ષતિની નુકસાન તરત જ નફા નુકસાનના પત્રમાં દર્શાવવામાં આવે છે. જ્યારે થયેલ ક્ષતિથી નુકસાન ભવિષ્યમાં દૂર થાય છે, ત્યારે મિલકતની વહન રકમ (રોકડ ઉત્પાદન એકમ) તેની વસૂલાત પાત્ર રકમના સુધારેલા અંદાજ સુધી વધારવામાં આવે છે, આ બિન-નાણાકીય મિલકતોની નવી વહનપાત્ર રકમ એ મૂળ વહનપાત્ર રકમથી વધવી ના જોઈએ. તે સુનિશ્ચિત કરવામાં આવે છે. ક્ષતિના કારણે થયેલ ખોટની વિપરીતતા તરત જ નફા નુકસાનના પત્રકમાં નોંધવામાં આવે છે. અને તેની અસર દર્શાવવામાં આવે છે.

જી. બોરોઈંગ કિંમત :

બોરોઈંગ કિંમત બોરોઈંગ ભંડોળ/ઉછીના નાણાના સંદર્ભમાં વ્યાજ અને અન્ય કિંમત પર ઉપજે છે (વિદેશી ચલણ વ્યાજ કિંમતની ગોઠવણ ન થાય ત્યાં સુધી તેનો વિનિમય તફાવત સહિત) બોરોઈંગ કિંમત સીધા સંપાદનને આભારી છે અથવા મિલકતનો નિર્માણ કે જે ઉપયોગમાં તૈયાર થવા માટે નોંધપાત્ર સમય લે છે અને તે સંપત્તિની કિંમતના ભાગરૂપે મૂડીકરણ થાય. અન્ય બોરોઈંગ કિંમત તેમના જે તે સમયે થયા તે સમયે ખર્ચા તરીકે નોંધવામાં આવે છે.

એચ. બોરોઈંગ :

બોરોઈંગને કરન્ટ લાયબલીટી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ફક્ત ત્યારે કે જ્યારે કંપનીને રીપોર્ટીંગ સમયગાળાથી ૧૨ મહિના પછી એવો બીન શરતી હક્ક રહેલ હોય કે તેઓ લાયબલીટી માટે સેટલમેન્ટને ફેરવી શકે. જ્યારે લાંબા ગાળાની લોન વ્યવસ્થાના પ્રાવધાનોમાં કોઈ બ્રીચ થયેલ હોય અને તે પણ રીપોર્ટીંગ સમયગાળા પહેલા કે તેના અંતે કે જેની એવી અસર થાય કે આવા લાયબલીટી રીપોર્ટીંગની તારીખે માંગણી પર ચૂકવવા પાત્ર થાય ત્યારે કંપની આવી લાયબલીટીને કરન્ટ તરીકે નોંધતી નથી, અને જો નાણાં આપનાર સ્વીકારે તો રીપોર્ટીંગના સમયગાળા બાદ અને નાણાંકીય પત્રકોની મંજૂરી પહેલા આવા ચૂકવણાની માંગણી બ્રીચના કારણે થયેલ હોય તો.

આઈ. રેવન્યુની મંજૂરી :

રેવન્યુને ત્યારે ઓળખવામાં આવે છે કે જ્યારે તેની ઉઘરાણીની/કે પ્રાપ્તિની પુરતી સંભાવના રહેલ હોય.

વ્યાજના આવકને ઓળખવા માટે અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો અકુઅલ બેઝીસ પર હિસાબ કરવામાં આવે છે.

અન્ય તમામ આવકના સ્ત્રોતો અકુઅલ બેઝ પર એકાઉન્ટીંગ કરવામાં આવે છે.

જે. પ્રાવધાનો (કર્મચારી ફાયદા સિવાયના) :

પ્રાવધાનને કોઈ જુની ઘટનાના આધારે ઓળખવામાં આવે છે કે જેમાં કંપનીને હાલમાં પણ એવી જવાબદારી રહેલ છે કે જેનો અંદાજ લઈ શકાય અને તે સંભવિત છે કે નાણાંકીય બેનીફીટની જરૂર આવા કાયદાકીય કે કરારી જવાબદારીઓને પુરી કરવા માટે પડી શકે છે. પ્રાવધાનો તેના પર નક્કી કરવામાં આવે છે કે ભવિષ્યમાં કેટલો કેશ ફ્લો થઈ શકે (બેલેન્સ શીટની તારીખે થનાર સંભવિત ખર્ચના અંદાજોના આધારે) અને તે પણ વેરા પહેલાના દર મુજબ કે ચાલતા બજાર અંદાજો અને તે સમયે રહેલ પૈસાની કિંમત મુજબ અને જવાબદારીઓમાં રહેલ રીસ્ક મુજબ રહે છે. થનાર ડીસ્કાઉન્ટો નાણાંકીય કિંમત મુજબ રહેશે. ભવિષ્યમાં થનાર ઓપરેટીંગ નુકસાનનો અંદાજ દર્શાવવામાં આવતો નથી.

કંટીજન્સીઓ

સંભવિત નુકસાનને લગતા પ્રાવધાનો કે જે દાવાઓ, લીટીગેશન, એસેસમેન્ટ, ફાઇન, પેનાલ્ટી વગેરે. તેઓને ત્યારે જ ઓળખી શકાય છે કે જ્યારે તેની પૂર્ણતા: જવાબદારી ઊભી થાય છે કે જેના દ્વારા ચોક્કસ કિંમત નક્કી કરી શકાય છે.

કે. કંટીજન્સીને લગતી જવાબદારીઓ :

કંટીજન્સીને ત્યારે દર્શાવવામાં આવે કે જ્યારે એવી સંભવિત જવાબદારી હોય કે જુના કોઈ ઘટનાના કારણે ઉદ્ભવે અને તેનો અસ્તિત્વ ત્યારે જ નિશ્ચિત થાય કે જ્યારે ભવિષ્યમાં એક કે તેનાથી વધારે ઘટનાઓ થાય કે જે કંપનીના પુરા નિયંત્રણમાં ન હોય કે ભૂતકાળના ઘટનાના કારણે હાલમાં કોઈ જવાબદારીઓ ઊભી થઈ હોય કે જ્યાં આવા ઘટનાને સેટલ કરવા માટે નાણાં ચૂકવવાની જરૂરીયાત ઊભી થાય કે આવા થનાર ખર્ચનો પુરેપુરો અંદાજ પ્રાપ્ત કરી ન શકાય. આવી કંટીજન્સી જવાબદારી એ સંભવિત ભવિષ્યની ઘટનાઓ કે જે ઘટિત અથવા અઘટિત હોય અને તે કંપનીના અંકુશમાં રહેલી ના હોય.

એલ. આવક વેરો :

આવક વેરામાં કરન્ટ અને ડીફર્ડ ટેક્સનો સમાવેશ થાય છે. એવી બાબતો કે જે ઈકવીટી અથવા અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક સિવાયની બાબતને નફા કે નુકસાનમાં દર્શાવવામાં આવે.

કરન્ટ ટેક્સ

કરન્ટ ટેક્સમાં ચૂકવવા પાત્ર વેરો કે ટેક્ષેબલ આવકમાંથી મળવાપાત્ર આવક કે નુકસાન જે તે વર્ષનો હોય અને જુના વર્ષોના આધારે ચૂકવવા પાત્ર કે મળવાપાત્ર વેરામાં એડજેસ્ટ કરવામાં આવે છે. કરન્ટ ટેક્સની રકમ તે દર્શાવે છે કે વેરાની રકમનો સૌથી સારો અંદાજ શું છે કે જે ચૂકવવા કે મળવાપાત્ર છે અને તેના પર આવક વેરાની અનિશ્ચિતતાને ધ્યાને લીધેલ હોય. તેની ગણતરી વેરા દરો (અને વેરાના નિયમો) કે જે રીપોર્ટીંગની તારીખે લાગુ પડતા હોય તેના આધારે કરવામાં આવે છે.

કરન્ટ ટેક્સ અને કરન્ટ ટેક્સની જવાબદારીઓ ઓફસેટ ત્યારે જ હોય જ્યારે લાગુ પડતા રકમ પર કોઈ કાયદાકીય હક્કો કે અધિકારો રહેલ હોય, અને તેનો ઉદ્દેશ્ય એસેટને પ્રાપ્ત કરવા અને તેને નેટ બેઝીસ કે એક સાથે સેટલ કરવા માટે થાય છે.

તેવા વેરાના લાભો કે જે કર્મચારી સ્ટોક ઓપ્શનના કારણે પ્રાપ્ત થયેલ હોય કે જે કોમ્પ્રીહેન્સીવ આવકમાં જમા કરવામાં આવેલ આવકમાં ચાર્જ કરવામાં આવેલ વળતર કરતા વધારે હોય ત્યારે.

ડીફર્ડ ટેક્ષ

ડીફર્ડ ટેક્ષને તે રીતે ઓળખવામાં આવે છે કે તે એસેટની રકમ અને જવાબદારીઓમાં રહેલ ફેરફારો કે જેનો ઉપયોગ નાણાંકીય રીપોર્ટીંગ માટે કરવામાં આવેલ હોય અને તેવા રકમને વેરાના કામે ઉપયોગ કરવામાં આવેલ હોય. ડીફર્ડ ટેક્ષને એમ પણ ઓળખવામાં આવે છે કે જેમાં કેરી ફોર્વર્ડ કરવામાં આવેલ ટેક્ષ અને ટેક્ષ કેડીટ હોય. ડીફર્ડ ટેક્ષને ત્યારે રેકગનાઈઝ કરવામાં આવતી નથી જ્યારે :

- કોઈ પણ લેવડ દેવડ વખતે ટેક્ષના નફા / નુકસાનની ગણતરી પર અસર ન કરે તો તેવા એસેટ કે લાયબલીટીમાં અસ્થાઈ ફેરફાર હોય તો.
- ગુડવીલના પહેલા ઓળખ વખતે રહેલ અસ્થાઈ ટેક્ષમાં ફેરફારો.

ડીફર્ડ ટેક્ષ એસેટને તે હદ સુધી ઓળખવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે ભવિષ્યમાં ટેક્ષવાળો નફો ઉપલબ્ધ હોય અને તેની સામે તેનો ઉપયોગ કરી શકાય. બીન વપરાયેલ વેરાના નુકસાનોનો અસ્થિત્વ તે ચોક્કસપણે દર્શાવે છે કે ભવિષ્યમાં વેરામાં નફો રહેશે નહિ. આથી, નુકસાનનો ઈતિહાસ હોય તો, કંપનીએ ડીફર્ડ ટેક્ષ એસેટને ત્યારે જ ઓળખવી જોઈએ કે જ્યારે તેની પાસે જરૂરીયાત મુજબ ટેક્ષમાં તફાવત રહેલ હોય કે ત્યારે જ્યારે એવી ચોક્કસ સાબિતી હોય કે જરૂરીયાત મુજબનો ટેક્ષમાં નફો ઉપલબ્ધ રહેશે કે જેની સામે ડીફર થયેલ ટેક્ષ એસેટ પ્રાપ્ત કરી શકાય. ડીફર થયેલ ટેક્ષ એસેટ - રેકગનાઈઝ થયેલ કે રેકગનાઈઝ થયા વગરની, તેનો રીવ્યુ દરેક રીપોર્ટીંગની તારીખે કરવામાં આવે છે અને તેને તે હદે રેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે સંબંધિત વેરાના ફાયદાઓ પ્રાપ્ત કરી શકાય.

ડીફર્ડ ટેક્ષની ગણતરી તેવા વેરાના દર પર કરવામાં આવે છે કે જે તેવા સમયે લાગુ પડે કે જ્યારે તે એસેટ ઊભો થયો હોય કે જવાબદારી પૂરી થઈ હોય અને રીપોર્ટીંગના સમયે જે નિયમો અસરમાં હોય ત્યારે.

ડીફર્ડ ટેક્ષની ગણતરી તે દર્શાવે છે કે વેરાની જવાબદારીઓ પાછળથી આવશે અને એવી રીતે આવશે કે જે રીતે કંપનીની અપેક્ષા છે, અને તે પણ રીપોર્ટીંગની તારીખે, કે જેથી એસેટ કે લાયબલીટીના કેરીંગ એમાઉન્ટને વસુલ કે ચૂકવી શકાય.

ડીફર્ડ ટેક્ષ એસેટ અને લાયબલીટી ત્યારે ઓફસેટ હોય જ્યારે કરન્ટ ટેક્ષ લાયબલીટી કે એસેટને ઓફસેટ કરવાનો કોઈ કાયદાકીય લાગુ કરવાનો હક્ક રહેલ હોય, અને તે સમાન સત્તા દ્વારા વસુલ કરવામાં આવેલ આવક વેરાને લગત હોય કે સમાન ટેક્ષ એન્ટીટી કે જુદો ટેક્ષ એન્ટીટી હોય, પરંતુ તે કરન્ટ ટેક્ષ લાયબલીટી અને એસેટને નેટ બેઝીસના આધાર સેટલ કરવા માગતી હોય કે તેઓના ટેક્ષ એસેટ કે લાયબલીટીને એકસાથે પ્રાપ્ત કરી શકાય.

ટાઈમીંગના ફેરફારને લગતા ડીફર્ડ ટેક્ષ કે જે તે વર્ષના ટેક્ષ હોલીડે પીરીયડ રેકગનાઈઝ થયા બાદ રીવર્સ કરવામાં આવેલ હોય.

એમ. શેરદીઠ આવક :

સામાન્ય આવક / (નુકસાન) પ્રતિ શેરની ગણતરી વર્ષના નેટ નફા કે નુકસાનનો ભાગાકાર કરીને કરવામાં આવે છે કે જે ઈકવિટી શેરધારકોને લગત હોય કે જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવિટીશેરની સંખ્યાના સરેરાશ મુજબ હોય છે. દરેક બોનસ અને શેર વિભાજનને જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવિટી શેરના સરેરાશ સંખ્યા સામે સરભર કરવામાં આવે છે. દરેક શેરના ડાયલ્યુટેડ આવક / (નુકસાન) ની ગણતરી કરવા માટે દરેક ઈકવિટી શેર ધાકરના વર્ષમાં થયેલા નફા કે નુકસાન અને વર્ષમાં આઉટસ્ટેન્ડીંગ રહેલ શેરોના ભારીત મધ્યકની સંખ્યાને એડજેસ્ટ કરવામાં આવે છે.

એન. કેશ અને કેશના સમાન્તરો :

એક બેલેન્સ શીટમાં કેશ અને કેશ સમાન્તરોમાં બેન્કમાં રહેલ કેશ અને હાથ પર રહેલ અને ટુકા ગાળાના ડીપોઝીટ કે જેની મેચ્યુરીટી સમય ત્રણ માસ કે તેનાથી ઓછો હોય તેનો સમાવેશ થાય છે અને તેના પર વેલ્યુમાં ફેરફારમાં રહેલ રીસ્કની અસર રહેલ છે.

કંપનીના કેશ મેનેજમેન્ટના આંતરીક ભાગ તરીકે કેશ ફ્લો, કેશ અને કેશના સમાન્તર કે જેમાં કેશ અને શોર્ટ ટર્મ ડીપોઝીટ, કે જે ઉપર દર્શાવવામાં આવેલ છે અને બેન્ક ઓવરડ્રાફ્ટના નેટનો સમાવેશ થાય છે.

ઓ. રીપોર્ટીંગના સમયગાળા પછી થયેલ ઈવેન્ટ :

તેવા ઈવેન્ટને એડજેસ્ટ કરવા કે જે રીપોર્ટીંગ પીરીયડના અંતે રહેલ પરિસ્થિતિ દર્શાવે છે. નાણાંકીય પત્રકોને ઈશ્યુના એથોરાઈઝેશન પહેલા દરેક ઈવેન્ટ માટે એડજેસ્ટ કરવામાં આવે છે. એડજેસ્ટ કર્યા સિવાયના ઈવેન્ટ તે દર્શાવે છે કે રીપોર્ટીંગ સમયગાળાના અંતે કેવી પરિસ્થિતિઓ રહેલી છે. રીપોર્ટીંગની તારીખે પછી થયેલ નોન - એડજસ્ટીંગ ઈવેન્ટે એકાઉન્ટ કરવામાં આવતી નથી પરંતુ તેને જાહેર કરવામાં આવે છે.

પી. રોકડ પ્રવાહનું પત્રક :

રોકડ પ્રવાહનો અહેવાલ પરોક્ષ પદ્ધતિથી કરેલ છે. જેમાં નફો (નુકસાન) કરવેરા પહેલા અસર આપીને આ વ્યવહારો બિન રોકડ પ્રકારના હોય તો તેનો પ્રકાર અને કોઈ ફેરફાર અથવા એકુઅલના ધોરણે અથવા ભવિષ્યમાં રોકડ આવક કે ચૂકવણાના આધારે જરૂરી અસર આપેલ છે. વર્ષ દરમિયાન રોકડ પ્રવાહને સંચાલન, રોકાણ અને નાણાંકીય પ્રવૃત્તિ એમ ત્રણ પ્રકારે દર્શાવેલ છે.

ક્યુ. સામાન્ય :

ઉપરોક્ત હિસાબી નીતિઓમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ ન હોય તેવી બાબતો સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો પ્રમાણે છે.

બહુચરાયુ રેલ કોર્પોરેશન લિમીટેડ		
૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના અંતિત નાણાકીય પત્રકોની નોંધ (રકમ રૂ.માં)		
વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
૪ કેપીટલ વર્ક-ઇન-પ્રોગ્રેસ જેમાં *		
કેપીટલ વર્ક-ઇન-પ્રોગ્રેસ-ઓફિસ	૨,૫૩,૧૧૦	-
કેપીટલ વર્ક ઇન પ્રોગ્રેસ - જમીન સંપાદન	૫,૬૪,૧૨૫	૩,૨૧,૦૨૭
★ રીફર નોંધ ૩૫		
કુલ	૮,૧૭,૨૩૫	૩,૨૧,૦૨૭
૫ વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતો *		
વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતો ફેસ-I	૬૫,૩૭,૩૩,૯૭૯	૬,૪૦,૭૯૧
★ રીફર નોંધ ૩૫ અને ૩૮		
કુલ	૬૫,૩૭,૩૩,૯૭૯	૬,૪૦,૭૯૧
૬ રોકાણો બિન વર્તમાન	-	-
૭ વિલંબિત કર મિલકત સંબંધિત		
વિલંબિત કર મિલકત (ચોખ્ખી)	-	-
વિલંબિત કર મિલકત	-	-
વિલંબિત કર જવાબદારીઓ સંબંધિત	-	-
ચોખ્ખી વિલંબિત કર મિલકતો	-	-
૮ અન્ય નોન-કરન્ટ એસેટ		
કેપીટલ એસેટ વર્કની કામગીરી માટે એડવાન્સ *		
- કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લિમીટેડ (કેપીટીએલ)	૨૬,૩૫,૧૯,૯૯૮	૧૩,૦૫,૮૩,૫૬૯
- ગતિશીલતા પર મળવાપાત્ર વ્યાજ ઈપીસી કોન્ટ્રાક્ટરનું એડવાન્સ **	૧,૯૩,૯૬,૫૧૬	-
કાનૂની અથવા સરકારી કાર્યાલાય પાસેની રકમ***		
પ્રાપ્ત થનાર ટીડીએસ ***	-	૪૨,૪૮૧
પ્રાપ્ત થનાર જીએસટી	૧,૫૩,૭૬,૫૬૫	૩૫,૩૨,૫૫૦
કુલ	૨૯,૮૨,૯૩,૦૭૯	૧૩,૪૧,૫૮,૬૦૦
<p>★ ૩૧-૦૩-૨૦૨૧ ના રોજ પૂરા થયેલા વર્ષ મુજબ મોબિલાઈઝેશન એડવાન્સ અને તેના પર મળવાપાત્ર વ્યાજની રકમ આગામી ૧૨ મહિનામાં વસૂલ કરી શકાય તેવી ખાતરી નથી. આથી મોબિલાઈઝેશન એડવાન્સ અને તેના પર મળવાપાત્ર વ્યાજ અન્ય બિન-વર્તમાન અસ્કયામતો હેઠળ પ્રસ્તુત લાંબાગાળાની સંપત્તિના સ્વરૂપમાં છે.</p> <p>** નોંધ ૩ (iii) ઈ અને ૩૮ નો સંદર્ભ લો.</p> <p>*** નોંધ ૨૨ નો સંદર્ભ લો.</p> <p>**** નોંધ ૩૫ નો સંદર્ભ લો.</p>		

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
૯ રોકાણો - વર્તમાન જીએસએફએસમાં રહેલ રોકાણો	૯૭,૦૧,૬૯,૪૨૪	—
કુલ	૯૭,૦૧,૬૯,૪૨૪	—
(એ) નોંધાયેલ રોકાણની કુલ રકમ અને તેનું બજાર મૂલ્ય	—	—
(બી) અવતરણ વિનાના રોકાણની કુલ રકમ	૯૭,૦૧,૬૯,૪૨૪	—
(સી) રોકાણના મૂલ્યમાં ક્ષતિની કુલ રકમ	—	—
૧૦ કેશ અને કેશ ઇક્વિવેલેન્ટ બેન્ક સાથે રહેલ સીલક		
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા નં. ૫૧૦૧૦૧૦૦૭૧૨૪૯૫૮	૮૦,૦૪,૮૦૬	—
યસ બેન્ક કરન્ટ ખાતુ નં. ૦૧૮૬૮૫૭૦૦૦૦૦૧૮૪	૪,૫૩,૫૬,૮૧૨	૧૩,૯૦,૦૭૬
કુલ	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૯૦,૦૭૬
૧૧ વર્તમાન કર મિલકતો (ચોખ્ખી)	—	—
કુલ	—	—
૧૨ કરવેરા		
નફા અને નુકસાનના પત્રકમાં દર્શાવેલ કરવેરા		
વર્તમાન કર	૫૫,૦૨,૫૮૨	—
વિલંબિત કર	—	—
વર્તમાન વર્ષમાં થયેલ કુલ કરવેરા ખર્ચ	૫૫,૦૨,૫૮૨	—
વર્ષ દરમિયાનનો કરવેરા ખર્ચનો હિસાબી નફાનું અવમૂલ્યન નીચે પ્રમાણે છે		
કર અને અપવાદરૂપ વસ્તુ પહેલા નફા અને નુકસાન	૭૦,૦૧,૩૭૪	(૨,૧૦,૮૩,૪૭૧)
લાગુ કર દર	૨૭.૮૨	—
ગણતરી કરેલો કર ખર્ચ	૧૯,૪૭,૭૮૨	—
કર અસર :		
મુક્ત આવક	—	—
અમાન્ય ખર્ચ (૧,૨૭,૭૭,૮૫૮★૨૭.૮૨%)	૩૫,૫૪,૮૦૦	—
વધારાનું ભથ્થુ જો MAT Credit હોય તો	—	—
વર્તમાન કર જોગવાઈઓ	૫૫,૦૨,૫૮૨	—
પીપીઈ અને અવાસ્તવિક મિલકતોના ખાતા પર વધારાની વિલંબિત કર જવાબદારી	—	—
વધારાની વિલંબિત કર જવાબદારી અથવા	—	—
મિલકત પર ખાતા અને નાણાકીય મિલકત અને અન્ય વસ્તુ પર	—	—
વિલંબિત કર જોગવાઈઓ	—	—
નફા અને નુકસાનના પત્રકમાં દર્શાવેલ કરવેરા	૫૫,૦૨,૫૮૨	—
અસરકારક કર દર	૭૯%	—
અસાધારણ વસ્તુ પર દર	—	—

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત		
૧૩ અન્ય ચાલુ મિલકતો	—	—		
	કુલ	—		
૧૪ ઇક્વીટી શેર કેપિટલ				
ઓથોરાઇઝ્ડ				
૭૮,૬૨,૨૦,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ	૭,૮૬,૨૨,૦૦,૦૦૦	૨,૨૫,૦૦,૦૦,૦૦૦		
(૨૨,૫૦,૦૦,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ)★	૭,૮૬,૨૨,૦૦,૦૦૦	૨,૨૫,૦૦,૦૦,૦૦૦		
ઇશ્યુ કે સબસ્ક્રાઇબ થયેલ				
૧૮,૨૩,૭૫,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ	૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦		
(૧૦,૦૦,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ)★	કુલ ૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦		
પેડ-અપ કેપિટલ				
૧૮,૨૩,૭૫,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ	૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦		
(૧૦,૦૦,૦૦૦ ઇક્વીટી શેર પ્રતિ ૧૦ રૂ.ના ફૂલ્લી પેડ અપ)★	કુલ ૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦		
★ કોંસમાં દર્શાવેલ વિગતો પાછલા વર્ષની વિગતો દર્શાવે છે.				
નોંધો :				
(૧) સમયગાળા શરૂઆતે અને અંતે આઉટસ્ટેન્ડીંગ શેરોના રીકન્સીલેશન				
વિગત	૨૦૨૦-૨૧		૨૦૧૯-૨૦	
	શેરોની સંખ્યા	રકમ	શેરોની સંખ્યા	રકમ
વર્ષની શરૂઆતમાં	૧૦,૦૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦	—	—
ઉમેરો : વર્ષ દરમિયાન ઇશ્યુ થયેલ	૧૮,૧૩,૭૫,૦૦૦	૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦
વર્ષના અંતે આઉટ સ્ટેન્ડીંગ	૧૮,૨૩,૭૫,૦૦૦	૧,૮૨,૩૭,૫૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦
(૨) ઇક્વીટી શેર્સ સાથે જોડાયેલ નિયમો અને હક્કો				
- કંપની પાસે રૂા. ૧૦ ના એક એવા ફક્ત એક જ ઇક્વીટી શેર્સનો પ્રકાર છે.				
- દરેક શેર ધારક એક શેર પર એક વાર મત આપવાનો હકદાર છે.				
- કંપની ફંડમાં જાય તેવા કેસમાં ઇક્વીટી શેર ધારક કંપનીની બધી ચૂકવણીઓની પતાવટ થઈ ગયા બાદ કંપનીની મિલકત મેળવવાના હકદાર છે. તેઓને તેમના ધારણ કરેલા શેર પ્રમાણે પ્રપોશનેટલી ચૂકવણી કરવામાં આવશે.				
(૩) રાઈટ ઇશ્યુ હેઠળ શેર્સની ફાળવણી :				
વર્ષ દરમિયાન કંપનીએ રૂા. ૧૦ ના એક એવા કુલ ૧૮,૧૩,૭૫,૦૦૦ શેર્સ નીચે જણાવેલ પ્રમોટરોને ફાળવેલા છે.				
- રૂા. ૧૦ ના એક એવા ૧૦,૦૮,૪૦,૦૦૦ શેર્સ ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ.				
- રૂા. ૧૦ ના એક એવા ૫,૮૧,૭૦,૦૦૦ શેર્સ મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ				
- રૂા. ૧૦ ના એક એવા ૩,૨૩,૬૫,૦૦૦ શેર્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ				

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	
(૪) ૫% કરતા વધારે શેર કેપીટલ ધરાવતા શેર ધારકોની વિગત નીચે મુજબ છે :				
શેર્સ હોલ્ડરનું નામ	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી-રાઈડ)	૧૦,૧૨,૫૦,૦૦૦	૫૨.૬૩%	૪,૧૦,૦૦૦	૪૧.૦૦%
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)	૫,૮૫,૦૦,૦૦૦	૩૦.૪૧%	૩,૩૦,૦૦૦	૩૩.૦૦%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	૩,૨૬,૨૫,૦૦૦	૧૬.૯૬%	૨,૬૦,૦૦૦	૨૬.૦૦%
કંપનીના રેકોર્ડ મુજબ કે તેમાં તેનાં શેર ધારકો / સભ્યોના રજીસ્ટર ઉપર દર્શાવેલ શેર ધારણ કાયદા મુજબ અને શેરના ખરેખરના માલિક છે.				
યાલુ સાલે કંપનીએ કોઈ પણ બોનસ શેર ઈશ્યુ કરેલ નથી.				
૧૫ અન્ય ઘટવીટી				
રીટેઇન કરેલ આવક				
રીટેઇન કરેલ આવક મુજબ ઓપનીંગ બેલેન્સ	(૩,૭૧,૮૭,૪૦૬)		(૧,૬૧,૧૩,૮૩૫)	
ઉમેરો / ઘટાડો એજેસ્ટમેન્ટ વર્ષ માટે	-		-	
નેટ (નુકસાન) / નફો યાલુ સાલે	૧૪,૮૮,૭૮૨		(૨,૧૦,૮૩,૪૭૧)	
બંધ સિલક	(૩,૫૬,૯૮,૬૧૫)		(૩,૭૧,૮૭,૪૦૬)	
કુલ રીઝર્વ અને સરપ્લસ	(૩,૫૬,૯૮,૬૧૫)		(૩,૭૧,૮૭,૪૦૬)	
૧૬ શેર કેપીટલ મની એલોટમેન્ટ કરવામાં બાકી રહેલ રકમ	-		-	
	કુલ	-	કુલ	-
૧૭ અન્ય નાણાકીય જવાબદારીઓ ઢિન વર્તમાન				
રીટેન્શન રકમ	૨,૪૮,૨૯,૦૬૮		-	
	કુલ	૨,૪૮,૨૯,૦૬૮	કુલ	-
નોંધ ૩૨ માં આવરી લેવામાં આવેલી અન્ય નાણાકીય જવાબદારીઓને લગતા ચલણ અને પ્રવાહિતના જોખમો માટે કંપનીનું એક્સપોઝર				
૧૮ બોરોઇંગ - નોન કરન્ટ				
ટૂંકાગાળાના બોરોઇંગ*				
સંબંધિત પક્ષકારોને લોન અને એડવાન્સ - તારણ વગરની				
- ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(જી-રાઈડ)	-		૧૪,૩૧,૨૭,૮૫૫	
* રીફર નોંધ : ૩૭				
	કુલ	-	કુલ	૧૪,૩૧,૨૭,૮૫૫
નોંધ ૩૨ માં આવરી લેવામાં આવેલ ઉધાર સંબંધિત ચલણ અને પ્રવાહિતાના જોખમો માટે કંપનીના સંપર્કમાં				

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
૧૯ ટ્રેડ ચૂકવવા પાત્ર - કરન્ટ		
માઈક્રો એન્ટરપ્રાઈઝ અને સ્મોલ એન્ટરપ્રાઈઝના કુલ આઉટસ્ટેન્ડીંગ	૨,૩૦,૯૨૬	—
માઈક્રો એન્ટરપ્રાઈઝ અને સ્મોલ એન્ટરપ્રાઈઝ સિવાયના અન્ય કુલ આઉટસ્ટેન્ડીંગ	—	૧,૯૨,૬૮,૪૦૩
કુલ	૨,૩૦,૯૨૬	૧,૯૨,૬૮,૪૦૩
કંપનીના કરન્સી અને લીકવીડીટી રીસ્ક કે જે ચૂકવવાપાત્ર ટ્રેડને લગત છે તેને નોંધ ૩૨ માં દર્શાવવામાં આવેલ છે.		
૨૦ પ્રાવધાનો - કરન્ટ		
ચૂકવવા પાત્ર એકાઉન્ટીંગ ફી	—	૨,૭૭,૮૭૫
ચૂકવવા પાત્ર કન્સલ્ટન્સી / પ્રોફેશનલ ચાર્જ	૭૮,૬૨૫	૨૭,૦૦૦
ચૂકવવા પાત્ર કન્વેન્સ ખર્ચ (અંદાજિત)	—	૫,૪૦૦
ચૂકવવા પાત્ર વ્યાજ	—	૫,૫૮,૭૧૨
ચૂકવવા પાત્ર આંતરિક ઓડીટ ફી	૪૭,૦૩૩	૪૦,૫૦૦
ચૂકવવા પાત્ર મેન પાવર સેવાઓ	૧,૪૦,૧૨૬	૧,૩૦,૧૯૪
ચૂકવવા પાત્ર સ્ટેચ્યુટરી ઓડીટ ફી	૪૬,૨૫૦	૪૫,૦૦૦
ચૂકવવા પાત્ર વાહન ભાડું	૨,૦૯,૪૧૮	૧,૪૦,૫૮૦
પ્રાવધાનો ચૂકવવા પાત્ર ઈપીસી કરાર	૫,૧૧,૩૦,૩૮૩	—
પ્રાવધાનો ચૂકવવા પાત્ર પીએમસી શુલ્ક	૧૫,૧૨,૧૫૮	—
પ્રાવધાનો ચૂકવવા પાત્ર - કચેરી	૨,૩૭,૦૨૩	—
કુલ	૫,૩૪,૦૧,૦૧૬	૧૨,૨૫,૨૬૧
૨૧ અન્ય વર્તમાન જવાબદારીઓ		
બીડ સિક્યોરીટી / ખાતું થાપણ	૧,૦૭,૨૫૦	—
ચૂકવવા પાત્ર સ્ટેચ્યુટરી ડ્યુ	—	—
ટીડીએસ ચૂકવવા પાત્ર	૨૮,૭૧,૨૮૬	૮૬,૩૮૧
શ્રમ ઉપકર	૧૫,૯૩,૪૮૨	—
ચૂકવવા પાત્ર ટીડીએસ / જીએસીટી	૩૨,૯૩,૫૭૦	—
કુલ	૭૮,૬૫,૫૮૮	૮૬,૩૮૧
૨૨ કરન્ટ ટેક્ષ લાયબીલીટી (નેટ)		
આવકવેરો પ્રાવધાનો વર્ષ ૨૦૨૦-૨૧	૫૫,૦૨,૫૮૨	—
બાદ :		
એડવાન્સ કર ચૂકવેલ વર્ષ ૨૦૨૦-૨૧	૨૦,૦૦,૦૦૦	—
કુલ ટીડીએસ મળેલ	૧૫,૦૫,૨૩૦	૧૯,૯૭,૩૫૨
કુલ	૧૯,૯૭,૩૫૨	—

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
૨૩ અન્ય આવક		
ટેન્ડર પ્રક્રિયા ફી	૩,૩૮,૯૮૦	૧૨,૯૮,૩૦૫
પરચુરણ આવક	૮,૧૦૦	—
પ્રાપ્ત થયેલ વ્યાજ		
૧) જીએસએફએસમાં આઈસીડીએસ પર વ્યાજ	૧,૦૯,૯૩,૯૭૨	—
૨) પ્રવાહી થાપણ પર વ્યાજ	૮૪,૩૫,૬૩૧	૪,૨૪,૮૧૩
૩) આવક વેરા પરતનો વ્યાજ	૨,૫૪૯	૨૦
૪) ચાલુ ખાતા પર વ્યાજ	—	૩૬,૩૩૨
કુલ	૧,૯૭,૭૯,૨૩૨	૧૭,૫૯,૪૭૦
૨૪ કર્મચારી બેનીફીટ ખર્ચ, કોન્ટ્રાક્ટરો અને કન્સલ્ટન્ટને ચૂકવણું		
મેન પાવર ચૂકવણું	૮,૨૯,૩૩૬	૬,૩૫,૦૦૩
કુલ	૮,૨૯,૩૩૬	૬,૩૫,૦૦૩
૨૫ નાણાકીય કિંમત		
નાણાકીય કિંમત (ગત વર્ષ રૂ. ૬,૨૦,૭૯૧)	૪૩,૪૧,૪૦૪	—
બાદ : વિકાસ હેઠળ અવાસ્તવિક સંપત્તિના ટ્રાન્સફર		
તબક્કા (ગત વર્ષ રૂ. ૬,૨૦,૭૯૧)	(૪૩,૪૧,૪૦૪)	—
★રીફર નોંધ નં. ૩૭ અને ૩૮		
કુલ	—	—
૨૬ ધસારો અને એમોરેટાઇઝેશન ખર્ચ		
ધસારો	—	—
કુલ	—	—
૨૭ અન્ય ખર્ચાઓ		
બેન્ક ચાર્જીસ	૨૦૧	૫૯
બોર્ડ મીટીંગ ખર્ચ	—	૨૪,૪૮૧
કન્સલ્ટન્ટ્સી / પ્રોફેશનલ ચાર્જ	૨,૭૧,૮૪૭	૧૩,૫૪,૫૯૭
ફીઝીબીલીટી સ્ટડી ખર્ચ	—	૨૬,૮૫,૭૧૮
ઇનકોર્પોરેશન ખર્ચ	—	—
ટીડીએસના ચૂકવણાં પર વ્યાજ	૪૭૦	૧,૭૨૭
આવક વેરા પર વ્યાજ	—	૧૦
કચેરી ખર્ચ	૭૬૮	૫,૦૯૯
કચેરી ખર્ચ (પ્રાથમિક ખર્ચ)	—	—
રાઉન્ડ ઓફ	૭	૩
સ્ટેશનરી અને પ્રીન્ટીંગ ચાર્જ	૭૦,૭૩૭	૧૮,૦૫૪
સ્ટેટ્યુટરી ઓડીટ ફી	૫૦,૦૦૦	૫૦,૦૦૦
પ્રવાસ અને કન્વેન્સ ખર્ચ - અન્ય	૧૮,૦૦૦	૮૫,૭૬૫
વાહન ભાડા ખર્ચ	૧૫,૧૮,૧૭૮	૭,૧૪,૬૨૫
સમારકામ અને જાળવણી	૧૯,૦૦૦	—
જાહેરાત ખર્ચ★	૨,૯૦,૦૩૮	—
બાદ : કેપીટલ વર્ક ઇન પ્રોગ્રેસમાં ટ્રાન્સફર કરેલ ખર્ચા	(૨,૦૫,૩૭૪)	૮૪,૬૬૪

વિગત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
ઈપીસી પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ખર્ચ**	૫૧,૪૬,૬૮,૧૨૬	
બાદ : વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતોમાં ટ્રાન્સફર તબક્કા-I માં ટ્રાન્સફર કરેલ ખર્ચ પીએમસી કરાર ખર્ચ ***	(૫૧,૪૬,૬૮,૧૨૬) ૬,૫૧,૮૫,૭૪૬	-
બાદ : વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતો ટ્રાન્સફર તબક્કા - I ટ્રાન્સફર કરેલ ખર્ચ આરઓસી અને કાયદેસર ખર્ચ ****	(૬,૫૧,૮૫,૭૪૬) ૮૮,૮૮,૬૫૦	-
બાદ : વિકાસ હેઠળ અવાસ્તવિક મિલકતો ટ્રાન્સફર તબક્કા - I	-૭૪૦૦૦	૯૮,૧૪,૬૫૦
	કુલ	૧,૧૮,૪૮,૫૨૨
૧,૭૨,૬૭,૮૦૦		૨,૨૨,૦૭,૮૩૮
★ નોંધ નં. : ૩ (ii) (d) અને ૩૫ ★★ નોંધ નં. : ૩ (ii) (e) અને ૩૮ *** નોંધ નં. : ૩૬ અને ૩૮ **** નોંધ નં. : ૩૮ અન્ય ખર્ચોનો સમાવેશ : ● ઓડીટર્સ મહેનતાણા (પગાર) : સ્ટેટ્યુટરી ઓડીટ ખર્ચ	૫૦,૦૦૦ કુલ	૫૦,૦૦૦ ૫૦,૦૦૦
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક (ઓસીઆઈ) તેવા કોઈ પણ કોમ્પ્રીહેન્સીવ આવકના ભાગ નથી કે જે દર્શાવવા યોગ્ય છે.		
૨૮ શેર દીઠ આવક ('ઈપીએસ') પ્રતિ શેર થયેલ આવકની ગણતરી થયેલ નેટ નફો / (નુકસાન) કે જે ઈક્વીટી શેર ધારકને પ્રાપ્ત છે તેને રૂ. ૧૦ ના ઈક્વીટી શેરના સરેરાશ સંખ્યાથી ભાગીને કરવામાં આવે છે કે જે નીચે મુજબ છે :		
વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦૨૦
દરેક ઈક્વીટી શેર ધારકને લગત નફો / (નુકસાન) વર્ષ દરમિયાનના ઈક્વીટી શેરોની સંખ્યાનો ઈપીએસ :		
નેટ પ્રોફીટ / (લોસ) શેર હોલ્ડર્સના ભાગનો	૧૪,૮૮,૭૮૨	(૨,૧૦,૮૩,૪૭૧)
વર્ષ દરમિયાનના ઈક્વીટી શેરોની સંખ્યાનો ઈપીએસ :	૮,૩૪,૨૧,૭૮૧	૫,૮૭,૨૬૦
પ્રતિ શેર ફેસ વેલ્યુ (રૂ. ૧૦)	૧૦	૧૦
પ્રતિ શેર બેઝીક અને ડીલ્યુટેડ આવક	૦.૦૨	(૩૫.૩૦)
★ કોઈ પોટેન્શીયલ ઈક્વીટી રહેલ નથી તેથી બેઝડ અને ડાયલ્યુટેડ ઈપીએસ એક જ છે.		
૨૯ કન્ટ્રીજન્સી લાયબીલીટીસ અને કેપીટલ કમીટમેન્ટ		
વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦૨૦
કેપીટલ કમીટમેન્ટ*	૨,૨૩,૮૫,૮૫,૮૬૪	૨,૫૦,૪૬,૧૬,૪૩૧
કુલ	૨,૨૩,૮૫,૮૫,૮૬૪	૨,૫૦,૪૬,૧૬,૪૩૧
★ નોંધ નં. ૩૯		

૩૦ સેગમેન્ટની માહિતી

ઈએન્ડ-એએસ ૧૦૮ મુજબ સેગમેન્ટની માહિતી આપવા માટે વપરાયેલ ઓપરેટીંગ સેગમેન્ટને ઓળખવામાં આવેલ છે અને તેનો આધાર કંપનીના વહીવટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ આંતરિક રીપોર્ટ છે કે જેનાથી સેગમેન્ટને રીસોર્સ એલોટ કરવામાં આવેલ છે અને તેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે.

નિયામક બોર્ડ ભેગા મળીને કંપનીના 'મુખ્ય કાર્યકારી નિર્ણય લેનાર' અથવા 'સીઓડીએમ' છે જેનો અર્થ ઈન્ડ-એએસ ૧૦૮ મુજબ છે. આંતરિક રીપોર્ટીંગ માટે ઉપયોગમાં લેવાયેલ ઈન્ડિકેટરો હાલના પર્ફોરમેન્સ એસેસમેન્ટ માપદંડ મુજબ ઈવોલ્વ કરી શકે છે.

ક્ષેત્રીય વિસ્તારની માહિતી

કંપની દ્વારા ઈકોનોમીક વાતાવરણમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી કે જેમાં જુદા જ ખતરાઓ અને આવક રહેલ છે. તેથી તે એક જ ક્ષેત્રીય સેગમેન્ટમાં કામ કરી રહેલ છે.

૩૧ માઈક્રો, નાના અને મીડીયમ એન્ટરપ્રાઈઝને ચૂકવવાપાત્ર રકમ

કંપનીએ માઈક્રો, નાના અને મીડીયમ એન્ટરપ્રાઈઝોને કોઈ પણ નાણાં ચૂકવવાના રહેતા નથી કે જે ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજથી ૪૫ દિવસથી વધુ રહેલ છે.

૩૨ નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટ અને તેના ઓબ્જેક્ટીવ અને પોલીસી

કંપનીને માર્કેટ રીસ્ક, ક્રેડિટ રીસ્ક અને લીક્વિડિટી રીસ્કનો સામનો કરવો પડે છે. કંપની ઉચ્ચ વહીવટ દ્વારા આવા ખતરાઓને લગત બાબતોનું સંચાલન કરવામાં આવે છે. કંપનીના ઉચ્ચ વહીવટને નાણાં વિભાગનો સહાય પ્રાપ્ત છે કે જેઓ નાણાકીય ખતરા બાબતે અભિપ્રાય આપે છે અને કંપનીના નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટનું ફેમ વર્ક બનાવે છે. નાણાં વિભાગ દ્વારા કંપનીના ઉચ્ચ વહીવટને એવો આશ્વાસન આપવામાં આવે છે કે કંપની દ્વારા નાણાંકીય ખતરાઓનો સારી રીતે વહીવટ કરવામાં આવી રહેલ છે.

(એ) માર્કેટને લગત રીસ્ક

માર્કેટ રીસ્ક એવો રીસ્ક છે કે જેના કારણે કોઈ પણ નાણાંકીય ઉપકરણનો ભવિષ્યનો કેશ ફ્લો ફ્લ્યુએટ થઈ શકે છે; કારણ કે માર્કેટ દરમાં ફેરફારો થાય છે. માર્કેટ દરમાં વ્યાજના દરનો ખતરો રહેલ છે. નીચેના ભાગોમાં દર્શાવેલ સંવેદનશીલ વિશ્લેષણ ૩૧ માર્ચ, ૨૦૨૧ની સ્થિતિ અનુસાર છે. આ વિશ્લેષણમાં માર્કેટ વેરીએબલના મુવમેન્ટના અસરનો સમાવેશ થતો નથી, જેમ કે ગ્રેચ્યુઈટી અને અન્ય નિવૃત્તિ બાદની જવાબદારીઓ, અને નોન ફાઈનેન્શીયલ એસેટ અને લાયબીલીટીનો સમાવેશ થાય છે.

(૧) વ્યાજ દરનો ખતરો

વ્યાજ દરનો રીસ્ક તે રીસ્ક છે કે જેમાં માર્કેટના વ્યાજ દરમાં ફેરફારને કારણે નાણાકીય ઉપકરણના ફેર વેલ્યુ કે ભવિષ્યના કેશ ફ્લોમાં બદલાવ થાય છે. કંપનીના બોરોઈંગ વ્યાજ મુક્ત છે અને તેથી ઈન્ડ-એએસ ૧૦૭માં દર્શાવેલ વ્યાજદરના રીસ્કની અસર થતી નથી. જી-રાઈડ પાસેથી લીધેલ લોન ૮.૫% વ્યાજ દરે છે. પરંતુ તે લોન ટૂંકાગાળા માટેની છે. માટે કંપનીના રોકડ પ્રવાહના લાંબા સમયે અસર કરશે નહીં.

(બી) લીકવીડીટી રીસ્ક

લીકવીડીટી રીસ્ક એવો રીસ્ક છે કે જેમાં કંપની હાલના કે ભવિષ્યના કેશ અને કોલેટ્રલ જવાબદારીઓને નુકસાન કર્યા સિવાય પૂરી કરી શકતી નથી. કંપનીનો ઉદ્દેશ તે છે કે દરેક સમયે ઓપટીમમ લીકવીડીટી જળવાઈ રાખે કે જેથી તેની રોકડ અને કોલેટ્રલ જરૂરિયાતો પૂરી કરી શકે. કંપની તેના લીકવીડીટીની સ્થિતિનો બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે અને તેની પાસે એક મજબૂત કેશ મેનેજમેન્ટ સીસ્ટમ રહેલ છે. તેની પાસે સારા એવા નાણાકીય સ્ત્રોતો છે જેમાં ઓછા ખર્ચે બેન્કની લોનોનો સમાવેશ થાય છે.

(૧) કરાર આધારિત ચુકવણા અંગે કંપનીની નાણાકીય જવાબદારીઓ દર્શાવતું પત્રક નીચે મુજબ છે.

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	ઓન ડીમાન્ડ	૩ મહિનાથી ઓછું	૩ થી ૧૨ મહિના સુધી	૧-૫ વર્ષ સુધી	૫ વર્ષથી વધુ	કુલ
બોરોઈંગ	-	-	-	-	-	-
ચૂકવવા પાત્ર ટ્રેડ	-	૨,૩૦,૯૨૬	-	-	-	૨,૩૦,૯૨૬
અન્ય નાણાકીય લાયબલીટી - નોન કરન્ટ	-	-	-	૨,૪૮,૨૯,૦૬૮	-	૨,૪૮,૨૯,૦૬૮
૩૧ માર્ચ ૨૦૨૦ અંતિત						
બોરોઈંગ	-	-	૧૪,૩૧,૨૭,૮૫૫	-	-	૧૪,૩૧,૨૭,૮૫૫
ચૂકવવા પાત્ર ટ્રેડ	-	-	૧,૯૨,૬૮,૪૦૩	-	-	૧,૯૨,૬૮,૪૦૩
અન્ય નાણાં. લાયબલીટી - નોન કરન્ટ	-	-	-	-	-	-

(સી) ક્રેડીટ રીસ્ક

ક્રેડીટ રીસ્ક એવો રીસ્ક છે કે જેમાં સામાવાળી પાર્ટી કોઈ પણ નાણાંકીય ઉપકરણ કે ગ્રાહક સંપર્કને લગત પોતાની જવાબદારીઓ પૂરી ન કરે જેના કારણે નાણાંકીય નુકસાન થાય. કંપનીને તેના ઓપરેટીંગ કામગીરી કરવા માટે ક્રેડીટ રીસ્કનો સામનો કરવો પડે છે (પ્રાથમિક ધોરણે ટ્રેડ રીસીવેબલ) અને તેના નાણાંકીય પ્રવૃત્તિઓ, જેમાં બેંક, નાણાંકીય સંસ્થાઓ અને અન્ય નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટમાં તેનો સમાવેશ થાય છે.

(૧) ટ્રેડ રીસીવેબલ

કંપનીના તમામ બાકી રહેલ કસ્ટમર રીસીવેબલને મોનીટર કરવામાં આવી રહેલ છે. કંપનીને કોઈ બેડ ડેબ્ટ કે લોંગ આઉટસ્ટેન્ડીંગનો વર્ષ દરમિયાન સામનો કરવો પડેલ નથી. ઉપરાંત કંપનીના તમામ બાકી રહેલ કસ્ટમર રીસીવેબલ રીપોર્ટીંગની તારીખથી ૬ માસની અંદરના છે અને તે જ પ્રમાણે ટ્રેડ રીસીવેબલને ખૂબ જ લો ક્રેડીટ રીસ્ક લાગુ પડે છે અને મેનેજમેન્ટે એવી ખાતરી કરે છે કે ટ્રેડ રીસીવેબલનો કોઈ ઈમ્પેરમેન્ટની જરૂરિયાત રહેલ નથી.

(૨) નાણાંકીય ઉપકરણો અને રોકડ ડીપોઝીટ

બેંકમાં રહેલ બેલેન્સ બાબતેના ક્રેડીટ રીસ્કને કંપનીના નાણાં વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે અને તે કંપનીના ઉચ્ચ વહીવટની નિગરાણીમાં રહેલ છે. બેંક કે નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ બેલેન્સ લો રીસ્ક ક્રેડીટ છે; કારણ કે કંપનીને સારા ક્રેડીટ રેટીંગ આપવામાં આવેલ છે. તે રેગ્યુલેટરી સત્તાની નિગરાણીમાં છે.

૩૩ રીલેટેડેડ પાર્ટી ડીઝક્લોશર

(૧) સંબંધિત પક્ષકારો અને સંબંધોની રૂપરેખા :

વિગત	ચાલુ વર્ષ	ગત વર્ષ
હોલ્ડીંગ એન્ટીટી	ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી-રાઈડ)	એનએ
એસોસીયેટ એન્ટીટી	મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમીટેડ(MSIL)	ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી-રાઈડ)
		ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)
		મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમીટેડ (MSIL)

એવી સંસ્થાઓ કે જેના પર ખાસ મેનેજરીયલ પર્સનલ અને તેઓના સંબંધીઓ ખાસ અસર કરી શકે.

ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી-રાઇડ)

ખાસ મેનેજમેન્ટ પર્સનલ / એક્ઝીક્યુટીવ ડીરેક્ટર

શ્રી સંતોષ કુમાર	સીઈઓ / નિયામક	
શ્રી અશ્વિની કુમાર યાદવ	ચેરમેન	
શ્રી એસ. એન. જોશી	સીએફઓ	(૨૨/૯/૨૦૨૦ થી)

નિયામક નોન - એક્ઝીક્યુટીવ

શ્રી બજરંગ વર્લી	નિયામક
શ્રી કવિતા શાહ	નિયામક
શ્રી બચ્ચુ વેનુગોપાલ	નિયામક
શ્રી રાજ સ્વરૂપ કપુર	નિયામક

(૨) સંબંધિત પાર્ટીઓ સાથે લેવડ દેવડ

ટ્રેન્સેક્શનની સમગ્રી / સંબંધિત પાર્ટી સાથે બેલેન્સ	હોલ્ડિંગ એન્ટીટી		એસોસીયેટ એન્ટીટી		ખાસ વહીવટી પર્સોનેલ અને તેઓના સંબંધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
લોન પ્રાપ્ત થયેલ	૨,૮૯,૭૮,૨૫૯	-	-	૧૪,૩૧,૨૭,૮૫૫	-	-
લોન ચૂકવેલ	૧૭,૨૧,૦૬,૧૧૪	-	-	-	-	-
ખર્ચનો રીઈમ્બર્સમેન્ટ (કેપીટલાઈઝ-CWIP)	-	-	-	૨૦,૦૦૦	-	-
અન્ય ચૂકવેલ ખર્ચ	-	-	-	૨૬,૮૫,૭૧૮	-	-
ચૂકવેલ વ્યાજ (કેપીટલાઈઝ-CWIP)	૪૩,૪૧,૪૦૪	-	-	૬,૨૦,૭૯૧	-	-
પીએમસી શુલ્ક (કેપીટલાઈઝ-CWIP)	૬,૫૧,૮૫,૭૪૬	-	-	-	-	-
ઈકવીટી શેર યોગદાન પ્રાપ્ત થયું	૧,૦૦,૮૪,૦૦,૦૦૦	-	૫૮,૧૭,૦૦,૦૦૦	-	-	-
બીડ પ્રોસેસીંગ ફી- એકત્રિત અને ટ્રાન્સફર	૮૦,૦૦૦	-	-	-	-	-
કુલ	૧,૨૭,૯૧,૦૧,૫૨૩	-	૫૮,૧૭,૦૦,૦૦૦	૧૪,૬૪,૫૪,૩૬૪	-	-

★ ચાલુ વર્ષ દરમિયાન જીઆઈડીસી પાસેથી ૨૪ જુલાઈ, ૨૦૨૦ ના રોજ રૂા. ૩૨,૩૬,૫૦,૦૦૦ શેરમૂડી પેટે મળેલ છે.

વર્ષના અંતે બેલેન્સ	હોલ્ડીંગ એન્ટીટી		એસોસીયેટ એન્ટીટી		ખાસ વહીવટી પર્સોનેલ અને તેઓના સંબંધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
મળવાપાત્ર રકમ	—	—	—	—	—	—
ચૂકવવાપાત્ર રકમ	—	—	—	૧૬,૩૦,૦૪,૮૮૯	—	—

૩૪ ફેર વેલ્યુની ગણતરી

કંપનીના નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના ફેર વેલ્યુ અને કેરીંગ રકમના ક્લાસની સરખામણી નીચે મુજબ છે :

કેટેગરી	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	
	કેરીંગ વેલ્યુ	ફેર વેલ્યુ	કેરીંગ વેલ્યુ	ફેર વેલ્યુ
૧) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાંકીય એસેટ				
ટ્રેડ રીસીવેબલ (કરન્ટ/નોન કરન્ટ)	—	—	—	—
રોકડ અને રોકડને સમાંતર	૫,૩૩,૬૧,૬૧૮	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૮૦,૦૭૬	૧૩,૮૦,૦૭૬
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ/નોન કરન્ટ)	—	—	—	—
કુલ	૫,૩૩,૬૧,૬૧૮	૫,૩૩,૬૧,૬૧૮	૧૩,૮૦,૦૭૬	૧૩,૮૦,૦૭૬
૨) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાંકીય લાયબીલીટી				
બોરોઈંગ	—	—	૧૪,૩૧,૨૭,૮૫૫	૧૪,૩૧,૨૭,૮૫૫
ચૂકવવાપાત્ર ટ્રેડ	૨,૩૦,૮૨૬	૨,૩૦,૮૨૬	૧,૮૨,૬૮,૪૦૩	૧,૮૨,૬૮,૪૦૩
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ/નોન કરન્ટ)	૨,૪૮,૨૮,૦૬૮	૨,૪૮,૨૮,૦૬૮	—	—
કુલ	૨,૫૦,૫૬,૯૬૪	૨,૫૦,૫૬,૯૬૪	૧૬,૨૩,૯૬,૨૫૮	૧૬,૨૩,૯૬,૨૫૮

નાણાંકીય એસેટ અને જવાબદારીના ફેર વેલ્યુમાં તે રકમનો સમાવેશ થાય છે કે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટને સહમત પક્ષકારો વચ્ચે હાલના લેવડ દેવડ તરીકે એક્ષચેન્જ કરી શકાય, સિવાય કે તે જબરજસ્તીનો કે લીકવીડેશન સેલ હોય. મેનેજમેન્ટે પ્રાપ્ત થયેલ ટ્રેડ, રોકડ અને રોકડના સમાંતર, અન્ય બેન્કની સીલ્લક, અન્ય નાણાંકીય એસેટ, બોરોઈંગ, ચૂકવવાપાત્ર ટ્રેડ અને અન્ય નાણાંકીય લાયબીલીટીસને ચકાસેલ છે અને તે કેરીંગ એમાઉન્ટના એપ્રોક્સીમેટ છે કે જે ઈન્સ્ટ્રુમેન્ટના ટૂંકાગાળાના મેચ્યુરીટીવાળા છે.

ફેર વેલ્યુ હેરાફી :

તમામ ફાઈનાન્સીયલ ઈન્સ્ટ્રુમેન્ટ કે જે માટે ફેર વેલ્યુ ઓળખાયેલ છે કે ખુલાસો કરવામાં આવેલ છે તે ફેર વેલ્યુના કેટેગરીમાં આવે છે, અને તેનું વિવરણ નીચે આપવામાં આવેલ છે, અને તેનો આધાર સૌથી નીચેના સ્તરનું ઈનપુટ પર છે કે જે ફેર વેલ્યુની ગણતરી માટે પૂરી રીતે અગત્યનું છે.

લેવલ ૧ : સક્રિય બજારમાં નિર્ધારિત થયેલ (એડજેસ્ટ કર્યા સિવાય) રકમ કે જે ચાલુ માર્કેટમાં એક સમાન એસેટ કે લાયબીલીટી માટે રહેલ છે.

લેવલ ૨ : વેલ્યુએશન ટેકનીકો કે જેના માટે સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વપરાય કે જે ફેર વેલ્યુની ગણતરીમાં ખાસ અસર કરી શકે અને જે ઓબજર્વેબલ હોય સીધી કે આડકતરી રીતે.

લેવલ ૩ : તેવા વેલ્યુએશન ટેકનીકો કે જેમાં સૌથી નીચેના સ્તરનું ઈનપુટ લેવલની ગણતરીમાં ખાસ અસર કરી શકે અને તેનો આધાર ઓબજર્વેબલ માર્કેટ ડેટા પર ન રહેલ હોય.

નીચે દર્શાવેલ કોષ્ટક કંપનીના એસેટ અને લાયબીલીટીઓના ફેર વેલ્યુ ગણતરીને દર્શાવે છે.

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટેટીવ ડીસ્ક્લોશરો :

વિગત	કુલ (કેરીઇંગ વેલ્યુ)	ચાલુ બજારમાં ના કોટેડ કિંમત (લેવલ-૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ-૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેબલ ઈનપુટ (લેવલ-૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય એસેટ મળવાપાત્ર ટ્રેડ	-	-	-	-
રોકડ અને તેનો સમાંતર	૫,૩૩,૬૧,૬૧૮	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ/નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૫,૩૩,૬૧,૬૧૮	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત લાયબીલીટીઓનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટેટીવ ડીસ્ક્લોશરો :

વિગત	કુલ (કેરીઇંગ વેલ્યુ)	ચાલુ બજારમાં ના કોટેડ કિંમત (લેવલ-૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ-૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેબલ ઈનપુટ (લેવલ-૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય લાયબીલીટી મળવાપાત્ર ટ્રેડ	-	-	-	-
રોકડ અને તેનો સમાંતર	૨,૩૦,૮૨૬	-	-	-
અન્ય નાણાંકીય લાયબીલીટી(કરન્ટ / નોન કરન્ટ)	૨,૪૮,૨૮,૦૬૮	-	-	-
કુલ	૨,૫૦,૫૯,૮૯૪	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટેટીવ ડીસ્ક્લોશરો :

વિગત	કુલ (કેરીઇંગ વેલ્યુ)	ચાલુ બજારમાં ના કોટેડ કિંમત (લેવલ-૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ-૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેબલ ઈનપુટ (લેવલ-૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય એસેટ મળવાપાત્ર ટ્રેડ	-	-	-	-
રોકડ અને તેનો સમાંતર	૧૩,૮૦,૦૭૬	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૧૩,૮૦,૦૭૬	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત લાયબીલીટીઓનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટીવ ડીસ્ક્લોશરો :

વિગત	કુલ (કેરીઇંગ વેલ્યુ)	ચાલુ બજારમાં ના કોટેડ કિંમત (લેવલ-૧)	ખાસ નોંધપાત્ર ઇનપુટ (લેવલ-૨)	નોંધપાત્ર નોન ઓબ્ઝર્વેબલ ઇનપુટ (લેવલ-૩)
એમોરાઇઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય લાયબીલીટી				
બોરોઇંગ	૧૪,૩૧,૨૭,૮૫૫	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	૧,૯૨,૬૮,૪૦૩	-	-	-
અન્ય નાણાંકીય લાયબીલીટી (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૧૬,૨૩,૯૬,૨૫૮	-	-	-

૩૫ રી-ગ્રુપીંગના કારણે નાણાંકીય પત્રકોમાં ગયા વર્ષના આંકડાઓ પરની અસર :

રી-ગ્રુપ કરેલ વસ્તુઓ	રકમ	ગયા વર્ષના ગ્રુપ હેડળ	ચાલુ વર્ષના ગ્રુપ હેડળ
મૂડી પ્રગતિ કામો	૩,૨૧,૦૨૭	મૂડી પ્રગતિ કામો	મૂડી પ્રગતિ કામો
મૂડી પ્રગતિ કામો	૬,૪૦,૭૯૧	મૂડી પ્રગતિ કામો	વિકાસ હેડળ અવાસ્તવિક મિલકત
સરકારી સત્તાઓ / વૈદ્યાનિક પાસે રહેલ સિલક***	૩૫,૭૫,૦૩૧	અન્ય ચાલુ મિલકતો	અન્ય બિન ચાલુ મિલકતો

૩૬ જી-રાઈડ ને આપેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કનસલ્ટન્સી પરની નોંધ :

જી-રાઈડ તા. ૦૯-૦૧-૨૦૧૯ ના રોજ મળેલ નિયામક મંડળની બેઠકમાં પસાર કરેલ ઠરાવ મુજબ બીઆરસીએલને કટોસન રોડ - બેયરાજી - ચાણસ્મા - રાનુજ એમએસઆઈએલ સાઈડ સહિતના નિર્માણ કાર્ય માટે પ્રોજેક્ટ કિંમતના ૧૦% પર નિમણૂક કરેલા છે. જે કરાર તા. ૨૮-૦૮-૨૦૨૦ ના રોજ થયેલ છે.

પીએમસી ખર્ચ તેની મૂળ અંદાજિત કિંમત પર રાખેલ છે જે રૂા. ૪૫૨.૬૦ કરોડ છે જેની ફેઝ વાઈસ PMC ચાર્જસ ૪૫.૨૬ કરોડની વિગત નીચે મુજબ છે :

(૧) કટોસન રોડથી બેયરાજી રોડ એમએસઆઈએલ સાઈડ સહિત (ફેઝ-I)	૧૯.૮૨ કરોડ
(૨) બેયરાજી થી રાનુજ (ફેઝ-II)	૨૫.૪૪ કરોડ
કુલ મંજૂર કરેલ પીએમસી ખર્ચ	૪૫.૨૬ કરોડ

રીવાઈઝડ પ્રોજેક્ટ ખર્ચ (ફેઝ વાઈઝ) અને પીએમસી ચાર્જ તા. ૨૦-૦૮-૨૦૨૦ ના રોજ મળેલ ૧૫મી નિયામક બેઠકમાં મંજૂર કરેલ છે.

જી-રાઈડની ૧૫ મી નિયામક મંડળની બેઠકમાં મંજૂર થયેલ તબક્કા વાર્ષિક ફેઝ-I નો કટોસન રોડ - બેચરાજી - ચણાસમા - રાનુજ નો ચૂકવવા પાત્ર પીએમસી ખર્ચ એમએસઆઈએલ સહિતની વિગતો નીચે મુજબ છે.

ક્રમ નં.	પીએમસીના તબક્કાઓ	તબક્કા-I માટે પીએમસી શુલ્ક (In INR Cr)	તબક્કા-I માટે પીએમસી શુલ્ક (In INR Cr) કર સહિત
૧	વ્યવહાર સલાહ (તબક્કા-I માટે મંજૂર શુલ્કના ૩૦%)	૧૮.૮૨ કરોડ	૫.૮૪૬ કરોડ
૨	યોજના સંચાલન (તબક્કા-I માટે મંજૂર શુલ્કના ૪૫%)		૮.૮૧૯ કરોડ
૩	કમિશનિંગ અને પરીક્ષણ (તબક્કા-I માટે મંજૂર શુલ્કના ૨૫%)		૪.૮૫૫ કરોડ

તા. ૩૧.૦૩.૨૦૨૧ ના રોજ બીલીંગ સ્થિતિ

ક્રમ નં.	પીએમસીના તબક્કાઓ	જીએસટી સહિત પ્રમાણિત રકમ (INR)	દર્શ્યુ કરેલ બીલ (INR)
૧	વ્યવહાર સલાહ (તબક્કા-I માટે મંજૂર શુલ્કના ૩૦%)	-	૫,૮૪,૬૦,૦૦૦
૨	યોજના સંચાલન (તબક્કા-I માટે મંજૂર શુલ્કના ૪૫%) (પીએમસી શુલ્ક @ ૮.૮૧૯ કરોડ માટે રૂ. ૨૬૩.૫૨ કરોડ* (INR))		
એ	આઈપીસી-૦૧ ખાતે ૩૧-૦૭-૨૦૨૦	૨,૫૬,૧૭,૦૩૬	૮,૬૭,૦૨૫
બી	આઈપીસી-૦૨ ખાતે ૨૧-૦૮-૨૦૨૦	૨,૩૦,૭૧,૫૧૯	૭,૮૦,૮૭૦
સી	આઈપીસી-૦૩ ખાતે ૨૨-૦૯-૨૦૨૦	૬૫,૪૩,૮૭૨	૨,૨૧,૪૮૧
ડી	આઈપીસી-૦૪ ખાતે ૧૨-૧૧-૨૦૨૦	૭૩,૯૨,૨૮૦	૨,૫૦,૧૯૭
ઈ	આઈપીસી-૦૫ ખાતે ૦૧-૧૨-૨૦૨૦	૩,૮૩,૪૬,૨૮૩	૧૨,૯૭,૮૫૪
એફ	આઈપીસી-૦૬ ખાતે ૨૩-૧૨-૨૦૨૦	૬,૪૫,૮૮,૮૦૩	૨૧,૮૬,૦૫૨
જે	આઈપીસી-૦૭ ખાતે ૨૮-૦૧-૨૦૨૧	૧૧,૯૪,૪૬,૦૮૩	૪૦,૪૨,૭૨૮
એચ	આઈપીસી-૦૮ ખાતે ૦૩-૦૩-૨૦૨૧	૮,૯૪,૬૬,૬૧૭	૩૦,૨૮,૦૫૪
આઈ	આઈપીસી-૦૯ ખાતે ૧૯-૦૩-૨૦૨૧	૮,૯૦,૦૩,૩૩૧	૩૦,૧૨,૩૭૪
જે	આઈપીસી-૧૦ ખાતે ૨૮-૦૪-૨૦૨૧ કોલમ બીલમાંથી રકમમાં વધારો થયો છે. તે જીએસટી બાદ કરે છે; કારણ કે તેન માટે માત્ર જોગવાઈનો હિસાબ કરવામાં આવ્યો છે અને કુલ ઈનવોઈસ બીલ નહીં. (માર્ચ, ૨૦૨૧)	૫,૨૭,૨૦,૧૬૦	૧૫,૧૨,૧૫૮
	અત્યાર સુધીના કુલ બીલ ઊભું થયું.	૫૧,૬૧,૯૬,૦૯૪	૭,૬૬,૫૮,૭૯૩

૩૭ જી-રાઈડ પાસેથી લીધેલ લોન અને આપેલ વ્યાજની નોંધ :

વિગત	રકમ
૦૧-૦૪-૨૦૨૦ ના રોજનું ઓપનીંગ બેલેન્સ	૧૪,૩૧,૨૭,૮૫૫
વર્ષ દરમિયાન મળેલી લોન	૨,૮૯,૭૮,૨૫૯
બાદ : વર્ષ દરમિયાન ચૂકવેલ લોન	૧૭,૨૧,૦૬,૧૧૪
૩૧-૦૩-૨૦૨૧ ના રોજની લોનની કલોઝીંગ બેલેન્સ	-

વર્ષ દીઠ જી-રાઈડ @ ૯.૫% મુજબ લોન પર ચૂકવવામાં આવેલ કુલ વ્યાજ*	૪૩,૪૧,૪૦૪
---	-----------

* જી-રાઈડને ચૂકવવામાં આવેલ વ્યાજ વિકાસ હેઠળ અવાસ્તવિક સંપત્તિમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

૩૮ વિકાસ હેઠળ અવાસ્તવિક સંપત્તિ / મિલકતો

(રકમ રૂ.માં)

ક્રમ નં.	કામની શ્રેણી / વસ્તુનું વર્ણન	આઈ.પી.સી. બીલ	કિંમત ફેરફાર બીલ	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
i	સિવિલ અને ટ્રેક કામો				
	પ્રોજેક્ટ સુવિધાઓ	૧,૩૪,૫૩,૭૮૨			
	માટી કામ	૮,૮૨,૦૭,૮૪૩	૨૨,૨૦,૫૧૩		
	રક્ષણ કામ	૨,૫૦,૮૬,૨૫૮	-		
	RUBs	૧,૮૪,૬૨,૭૭૮	૧,૮૧,૮૭૪		
	ટ્રેક કામ	૨૭,૮૭,૪૮,૭૪૪	૧૪,૨૬,૫૮૪		
	સોલિદ અન્ય સિવિલ આન્જિનીયરીંગ કામો				
	અફઓબી અને સબવે	૯,૪૧૮,૧૧૭	૩,૧૭,૧૬૬	૪૩,૭૫,૨૪,૭૬૭	-
ii	સીંગલીંગ કામ કરે છે	૩,૦૮,૦૪,૪૩૪	૨,૪૪,૩૬૩	૩૧,૦૪૮,૭૯૬	-
iii	ટેલિકોમ્યુનિકેશન કામ કરે છે.	૧,૦૫,૦૮,૩૫૬	(૧,૮૭,૦૩૧)	૧,૦૩,૧૧,૩૨૫	-
iv	વીજળીકરણ કામ કરે છે. (OHE કામ કરે)				
	ઓવરહેડ સાધનોનું કામ, ઓએચઈ, ટીએસએસ, એસએસમાં ફેરફાર	૩,૦૨,૫૨,૨૩૭	-	૩,૦૨,૫૨,૨૩૭	-
v	સામાન્ય ઇલેક્ટ્રિકલ વર્કસ (GEW)				
	૩૩ કેવી સુધીની એચટી પાવર લાઇન કોસીંગમાં ફેરફાર (યુજી કેબલીંગ દ્વારા બદલ)	૫૬,૦૩,૮૫૬	(૭૨,૮૫૫)	૫૫,૩૧,૦૦૧	-
vi	પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી શુલ્ક			૬,૫૧,૮૫,૭૪૬	-
vii	ઇલેક્ટ્રિકલ કામ માટે જીઈટીસીઓને ચૂકવણી			૨,૮૦,૩૭,૨૫૯	૨૦,૦૦૦
viii	સાઇટ ક્લીયરીંગ કામ			૧,૨૧,૧૨૫	-
ix	જી-રાઈડ પરથી લોન પર વ્યાજ			૪૩,૪૧,૪૦૪	૬,૨૦,૭૯૧
x	રેલ્વે પાસેથી ખરીદેલ રેલ માટે ચૂકવણી			૨,૮૨,૫૩,૧૦૬	-
xi	વધારા ફાઇડર બાય માટે ચૂકવણી			૩,૦૮,૨૦,૮૪૯	-
	પેટા કુલ			૬૭,૨૫,૩૭,૭૧૫	૬,૪૦,૭૯૧
	બાદ : ગતિશીલતા એડવાન્સ પર વ્યાજ*			૧,૮૪,૪૪,૫૨૭	-
	કુલ વિકાસ હેઠળ અવાસ્તવિક સંપત્તિ મિલકતો			૬૫,૪૦,૯૩,૧૮૮	૬,૪૦,૭૯૧
	તા. ૩૧-૦૩-૨૧ ૩૧-૦૩-૨૦૨૦ ના રોજ સમાપ્ત થયેલ વિકાસ વર્ષ હેઠળ કુલ અવાસ્તવિક સંપત્તિ / મિલકતો			૬૫,૩૭,૩૩,૯૭૯	૬,૪૦,૭૯૧

* મોબીલાઈઝેશન એડવાન્સ પરના વ્યાજમાં અગાઉના સમયગાળાને લગતા રૂ. ૪,૮૦,૧૬૬ નો સમાવેશ થાય છે.

૩૯ મૂડી પ્રતિબદ્ધતા			
૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા વર્ષ માટે			
પક્ષનું નામ જેની સાથે કરાર કરવામાં આવ્યો હતો	કરારનું કુલ મૂલ્ય	કરારની કિંમત માર્ચ, ૨૦૨૧ સુધી અમલમાં છે.	બાકી કરાર મૂલ્ય
કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ-ઈપીસી કરાર	૨,૬૩,૫૨,૦૦,૦૦૦	૭૭,૪૦,૬૭,૫૦૫	૧,૮૬,૧૧,૩૨,૪૯૫
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પીએમસી કોન્ટ્રાક્ટ	૪૫,૨૬,૦૦,૦૦૦	૭,૫૧,૪૬,૬૩૧	૩૭,૭૪,૫૩,૩૬૯
કુલ મૂડી પ્રતિબદ્ધતા	૩,૦૮,૭૮,૦૦,૦૦૦	૮૪,૯૨,૧૪,૧૩૬	૨,૨૩,૮૫,૮૫,૮૬૪
૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થયેલા વર્ષ માટે			
પક્ષનું નામ જેની સાથે કરાર કરવામાં આવ્યો હતો	કરારનું કુલ મૂલ્ય	કરારની કિંમત માર્ચ, ૨૦૨૦ સુધી અમલમાં છે.	બાકી કરાર મૂલ્ય
કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ-ઈપીસી કરાર	૨,૬૩,૫૨,૦૦,૦૦૦	૧૩,૦૫,૮૩,૫૬૯	૨,૫૦,૪૬,૧૬,૪૩૧
કુલ મૂડી પ્રતિબદ્ધતા			૨,૫૦,૪૬,૧૬,૪૩૧
૪૦ પાછલા વર્ષના આંકડાઓને ચાલુ વર્ષ માટે સરખાવી શકાય તે માટે જરૂરી હોય ત્યાં ફરીથી જૂથબદ્ધ / ફરી વર્ગીકરણ કરવામાં આવ્યા છે.			
નોંધ ૧ થી ૪૦ ના સીગનેટરીઓ			
<p>સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે</p> <p>શાહ અને દલાલ વતી નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા</p> <p>ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ</p> <p>એફઆરએન ૧૦૮૪૩૨૬૭૫</p>			
સહી/- મલય દલાલ ભાગીદાર સભ્ય નં. ૦૩૬૭૭૬	સહી/- એસ. એન. જોશી સીએફઓ	સહી/- બી. સી. વર્લી નિયામક ડીઆઈએન: ૦૭૧૩૩૯૪૨	સહી/- સંતોષ કુમાર નિયામક / સીઈઓ ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૯
સ્થળ : અમદાવાદ તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧	સ્થળ : ગાંધીનગર તારીખ : જુલાઈ ૧૬, ૨૦૨૧		

07

Industries & Mines Department
3rd Administrative Report of
Bahucharaji Rail Corporation Limited
Pursuant to Section 394(2) of the Companies Act, 2013
(for the F.Y. 2020-21)

Bahucharaji Rail Corporation Limited (BRCL) is a Joint Venture of Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited, incorporated under provision of the Companies Act, 2013 on 13.12.2018.

BRCL has been incorporated to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road–Bechraji–Chanasma-Ranuj (65 Kms) line project in the state of Gujarat.

During the year the Company has undertaken following business activities:

- a) The work of Transaction Advisory has been assigned to GRIDE for processing and awarding tenders for various activities for the project. EPC contractor for the project has been finalized for Phase-I and Phase-II.
- b) For field supervision and contract management, Project Management Consultancy agency has been fixed.
- c) Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- d) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- e) Monitoring the progress of project for various activities.
- f) Lessoning with Railways and State Government on all issues related to Project.

The management is hopeful that it will be able to accelerate its activities and speed up implementation of the project in the forth coming years.

During the reporting period, company has incurred profit of Rs. 14,98,792/-


Additional Chief Secretary

Industries & Mines Department
Government of Gujarat



3rd Annual Report (F.Y. 2020-2021)



BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN : U45101GJ2018SGC105602)

Third Annual Report F.Y. 2020-2021

Date : 28/09/2021

Time : 04:45 p.m.

Place : Block No. 6, 7th Floor

Udhyog Bhawan, Sector-11,

Gandhinagar-382011, Gujarat

:: Registered Office ::

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Block No. 6, 7th Floor, Udhyog Bhavan, Sector-11,

Gandhinagar-382011.

Phone: 079-232-32728/29, E-mail: info@brcl.org.in

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN : U45101GJ2018SGC105602)

INDEX

Sr. No.	Particulars	Page No.
1.	Board of Directors	4
2.	Notice of 3rd Annual General Meeting	5
3.	Board's Report	6
4.	Independent Auditor's Report	22
5.	Balance Sheet	36
6.	Profit and Loss Account	38
7.	Cash Flow Statement	41
8.	Notes to Financial Statements	43

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN : U45101GJ2018SGC105602)

Board of Directors

Sr. No.	Name of Director and Key Managerial Personnel	DIN / PAN	Designation
1	SHRI ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV	06581753	Chairman
2	SHRI BAJRANG WARLI CHHAGANBHAI	07133942	Director
3	SHRI SANTOSH KUMAR	07854179	Director
4	SMT. KAVITA RAKESHKUMAR SHAH	08268558	Director
5	SHRI BATCHU VENUGOPAL	08303687	Director
6	SHRI RAJ SWARUP KAPOOR	08303688	Director
7	SHRI SANTOSH KUMAR	AFPPK5776D	CEO(KMP)
8	SHRI SHAMBHUPRASAD NAGESHVAR JOSHI	ABEPJ6568K	CFO(KMP)

Statutory Auditors

M/s Shah & Dalal
Chartered Accountants,
Ahmedabad

Bankers

Yes Bank, Gandhinagar
Union Bank of India, Gandhinagar

Registered Office

Block No. 6, 7th Floor,
Udyog Bhavan, Sector-11,
Gandhinagar-382011

Notice for the 3rd Annual General Meeting

NOTICE is hereby given that the Third Annual General Meeting of the Company Bahucharaji Rail Corporation Limited will be held on **Tuesday, the 28th September, 2021 at 4:45 p.m. (at a shorter notice) through Video conferencing/OAVM mode at Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector 11, Gandhinagar - 382011** to transact the following business:

ORDINARY BUSINESS:

1. To receive, consider and adopt the Audited Financial Statement of the Company for the Financial Year ended March 31, 2021 together with the reports of the Board of Directors and Auditors and comments of Comptroller and Auditor General of India thereon.
2. To appoint Smt Kavita Shah (DIN: 08268558), who retires by rotation as a Director and being eligible and offers herself for re-appointment
3. To appoint Shri Batchu Venugopal (DIN: 08303687), who retires by rotation as a Director and being eligible and offers himself for re-appointment
4. To authorize Board of Directors of the Company to fix the remuneration of the Statutory Auditors of the Company appointed by the office of CAG of India for audit of accounts of the Company for the year 2021-22.

Regd. Office:

Block No. 6, 7th Floor,
Udyog Bhavan,
Sector -11,
Gandhinagar - 382 011

By order of the Board of Directors**Sd/-****CHAIRMAN/DIRECTOR****Date: 28th September, 2021****NOTES:**

1. Shareholders seeking any information regarding any aspect of this report are requested to write to the company well in advance so as to enable the management to keep the information ready.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**(CIN: U45101GJ2018SGC105602)****Reg. Office: Block No. 6, 7TH Floor, Udhog Bhavan, Sector-11, Gandhinagar, Gujarat-382011****BOARD'S REPORT**

To,
The Members,
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
Gandhinagar, Gujarat

Your Directors have pleasure in presenting their 3rd Annual Report on the business and operations of Bahucharaji Rail Corporation Limited ("the Company") and the accounts for the financial year ended on 31st March, 2021.

1. FINANCIAL SUMMARY OR HIGHLIGHTS/ PERFORMANCE OF THE COMPANY:

The financial position of the Company for financial year ended on 31st March, 2021 is as follows:

(Amount in Rs.)

Particulars	2020-21	2019-20
Revenue from Operations	0	0
Other Income	1,97,79,232	17,59,470
Total Revenue	1,97,79,232	17,59,470
Less: Total Expenses	(1,27,77,858)	(2,28,42,941)
Profit / (Loss) Before Tax	70,01,374	(2,10,83,471)
Less: Tax Expenses	55,02,582	0
Profit / (Loss) after tax	14,98,792	(2,10,83,471)

2. BRIEF DESCRIPTION OF THE COMPANY'S WORKING DURING THE YEAR:

The Company is presently in the process of implementation of the project. The Commercial Operations yet to be started.

a) The work of Transaction Advisory has been assigned to GRIDE for processing

and awarding tenders for various activities for the project. EPC contractor for the project has been finalized for Phase-I and Phase-II.

- b) For field supervision and contract management, Project Management Consultancy agency has been fixed.
- c) Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- d) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- e) Monitoring the progress of project for various activities.
- f) Liasoning with Railways and State Government on all issues related to Project

The management is hopeful that it will be able to accelerate its activities and speed up implementation of the project in the forth coming years.

3. EFFECT OF COVID-19:

The novel Coronavirus (COVID-19) pandemic is spreading around the globe rapidly. The virus has taken its toll on not just human life, but businesses and financial markets too, the extent of which is currently indeterminate. Entities need to carefully consider the accounting implications of this situation and outcome of the same may be different from the estimated at these financial Statements. The Company will continue to closely monitor any material changes arising out of future economic conditions and impact on its activities.

4. CHANGE IN THE NATURE OF BUSINESS, IF ANY:

During the financial year under review, there is no Change in the nature of business.

5. DIVIDEND:

During the financial year under review, the Board of Directors did not recommend any Dividend on the Equity Shares of the Company.

6. TRANSFER TO RESERVES:

During the financial year under review, Company has not transferred any amount to General Reserve.

7. SHARE CAPITAL OF THE COMPANY AND CHANGE IN SHARE CAPITAL, IF ANY:

The Authorized, Issued, Subscribed and Paid-up Share Capital of the Company as at 31st March, 2021 as follows:

SHARE CAPITAL STRUCTURE	
Authorised Share Capital *	Rs. 7,86,22,00,000 (Rupees Seven Hundred Eighty Six Crores and Twenty Two Lakhs Only) divided into 78,62,20,000 (Seventy Eight Crores Sixty Two Lakhs Twenty Thousand) Equity Shares of Rs. 10/- each.
Issued, Subscribed and Paid-up Share Capital **	Rs. 1,92,37,50,000/- (Rupees One Hundred Ninety Two Crores Thirty Seven Lakhs Fifty Thousand only) divided into 19,23,75,000 Equity Shares of Rs. 10/- each.

* During the financial year under review, Authorized Share Capital of the Company increased from Rs. 225,00,00,000 (Rupees Two Hundred Twenty Five Crore Only) divided into 22,50,00,000 (Twenty Two Crores Fifty Lakhs) Equity Shares of Rs. 10/- each to Rs. 7,86,22,00,000 (Rupees Seven Hundred Eighty Six Crores Twenty Two Lakhs Only) divided into 78,62,20,000 (Seventy Eight Crores Sixty Two Lakhs Twenty Thousand) Equity Shares of Rs. 10/- each.

** Allotment of 19,13,75,000 (Nineteen Crore Thirteen Lakh Seventy Five Thousand) Equity shares of Rs. 10/- (Ten) each to equity shareholders of the Company on right basis in tranches, which shall rank pari passu in all respect with existing share holders w.e.f 24th July, 2020 and 5th January, 2021 respectively.

8. SUBSIDIARIES, JOINT VENTURES AND ASSOCIATE COMPANIES:

The Company is Joint Venture Company promoted by, Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited. Therefore by virtue of shareholding agreement of the company becomes Joint Venture company of J.V. Partners.

9. DISCLOSURE REGARDING ISSUE OF EQUITY SHARES WITH DIFFERENTIAL RIGHTS:

The Company has not issued any Equity Shares with Differential Voting Rights during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 4 (4) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

10. DISCLOSURE REGARDING ISSUE OF SWEAT EQUITY SHARES:

The Company has not issued any Sweat Equity Shares during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 8 (13) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

11. DISCLOSURE REGARDING ISSUE OF EMPLOYEE STOCK OPTION:

The company has not issued any shares under Employee Stock Option Scheme during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 12 (9) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

12. PARTICULARS OF EMPLOYEES:

As the Bahucharaji Rail Corporation Limited is not a Listed Company therefore section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014, statement of particulars of employees are not applicable to the Company.

13. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

During the year under review, In accordance with the provisions of the Companies

Act, 2013 applicability the Board appointed Shri Santosh Kumar, (DIN: 07854179) Director of the company as a Chief Executive Officer (CEO) and Shri Shambhuprasad Joshi designated as Chief Financial Officer (CFO) of the Company w.e.f 22nd September, 2020

14. MANAGERIAL REMUNERATION:

The Company is not required to make disclosures pursuant to Rule 5 of Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 relating to Managerial Remuneration being an Unlisted Company.

15. DEPOSITS:

During the financial year under review, the Company has not accepted any Deposits from the public and it is therefore not required to comply with the requirement under the Companies (Accounts) Rules, 2014.

16. DIRECTORS LIABLE TO RETIRE BY ROTATION:

Pursuant to the Section 152(6) of the Companies Act, 2013, Smt Kavita Shah (DIN: 08268558) and Shri Batchu Venugopal (DIN: 08303687) retires by rotation at the AGM of the Company and being eligible offer themselves for re-appointment

The Company has received the disclosure in Form DIR-8 stating that they are eligible to be re-appointed at the forthcoming Annual General Meeting of the Company.

17. BOARD MEETING:

Notice of Meeting is prepared and circulated in advance to the Directors as required under Secretarial Standards. During the year, Three Board Meetings were convened and held on 26th June 2020, 22nd September, 2020 and 19th January, 2021. Relaxations were given by MCA in Financial Year 2020 due to COVID-19 outbreak vide General Circular No. 11/ 2020 dated 24th March, 2020 whereby gap of 180 days between two board meetings was allowed.

18. BOARD EVALUATION:

Your Board is committed to assessing its own performance in order to identify its strengths and areas in which it may improve its functioning and processes for evaluation of performance of individual Directors, Chairman of the Board, and the Board as a whole. The Director Appointment / re-appointment / continuation of Directors are subject to the outcome of the annual evaluation process.

19. AUDITORS:

The Auditors, M/s. SHAH & DALAL (FRN: 109432W), Chartered Accountant, Ahmedabad, were appointed as Statutory Auditors of the Company for the Financial Year 2021-2022 by the Comptroller and Auditor General of India, vide Letter No. CA.V/COY/GUJARAT, BRCL (1)/1195 dated 26/08/2021.

20. AUDITORS' REPORT:

The Auditors' Report does not contain any qualification. Notes to Accounts and Auditors remarks in their report are self-explanatory and do not call for any further comments.

21. COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143 (6) (b) OF THE COMPANIES ACT, 2013:

The Company has received letter No. A/CS/BRCL/2020-21/OW.654 dated 20th September, 2021 from Comptroller and Auditor General of India on the audited accounts of the company for the year ended on 31/03/2021 stating that nothing significant has come to the knowledge which would give raise to any comment upon statutory Auditors' Report by C & AG.

22. ANNUAL RETURN:

Pursuant to the provisions of Section 134 (3) (a) of the Companies Act, 2013 read with the rules made thereunder, the Annual Return of the Company was not required since the company does not have its own website.

23. INTERNAL AUDIT & CONTROLS:

The internal auditor appointed was M/s Ashok Chhajer & Associates were appointed as internal auditor for FY 2020-21. The Company has initiated process for appointment of Internal Auditors for further years by following Tender Process.

24. CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR):

During the year under review, under Section 135 of the Companies Act, 2013 the provision of Corporate Social Responsibility is not applicable to the company.

25. RISK MANAGEMENT POLICY:

BRCL shall identify the possible risks associated with its business and commits itself to put in place a Risk Management Framework to address the risk involved on an ongoing basis to ensure achievement of the business objective without any interruptions. BRCL shall optimize the risks involved by managing their exposure and bringing them in line with the acceptable risk appetite of the Company.

26. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION AND FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO:

The Company has no activities which require disclosure relating to conservation of energy or technology absorption as it is not a Manufacturing Company. There has been no foreign exchange earnings or outgo during the year under review.

27. MATERIAL CHANGES AND COMMITMENTS, IF ANY, AFFECTING THE FINANCIAL POSITION BETWEEN THE END OF THE FINANCIAL YEAR AND THE DATE OF THE REPORT:

No material changes and commitments have occurred after the close of the financial year till the date of this report, which affect the financial position of the Company other than those specifically highlighted in this report. However the Company has allotted 3,26,25,000 equity shares of Rs. 10/- each aggregating to Rs. 32,62,50,000/- dated 11th June, 2021 to Gujarat Industrial Development Corporation (GIDC).

28. DETAILS OF SIGNIFICANT AND MATERIAL ORDERS PASSED BY THE REGULATORS OR COURTS OR TRIBUNALS IMPACTING THE GOING CONCERN STATUS AND COMPANY'S OPERATIONS IN FUTURE:

No significant or material orders were passed by the regulator or court or tribunals which impact the going concern status and Company's operations in future.

29. OBLIGATION OF COMPANY UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION AND REDRESSAL) ACT, 2013:

In order to prevent sexual harassment of women at work place a new act The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 has been notified on 9th December, 2013. Under the said Act every company is required to set up an Internal Complaints Committee to look into complaints relating to sexual harassment at work place of any women employee.

Company will adopt a policy in future for prevention of Sexual Harassment of Women at workplace and will set up Committee for implementation of said policy, if required. During the financial year under review, Company has not received any complaint of harassment

30. PARTICULARS OF LOANS, GUARANTEES AND INVESTMENTS:

During the year under review, the Company has not given any loans, made any investments or given guarantees on any loans, which fall within the purview of the provisions of Section 134(3)(g) of the Companies Act, 2013 and hence, no disclosures are required to be made thereof.

31. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS WITH RELATED PARTIES:

During the year under review, contracts and arrangements with related parties under Section 188(1) of the Companies Act, 2013, are reported in the Audited Balance sheet of the Company.

32. AUDIT COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with Rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 was not applicable to the company in context of Audit Committee.

33. NOMINATION AND REMUNERATION COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 were not applicable to the company in context of Nomination and Remuneration Committee.

34. DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

The Directors' Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that-

- (a) In the preparation of the Annual Accounts, the applicable Accounting Standards had been followed along with proper explanation relating to material departures;
- (b) the Directors had selected such Accounting Policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Company at the end of the financial year and of the profit and loss of the Company for that financial year;
- (c) The Directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the Company and for preventing and detecting fraud and other irregularities;
- (d) The Directors had prepared the Annual Accounts on a going concern basis;
- (e) The Directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

35. SECRETARIAL AUDIT REPORT:

Section 204 of the companies Act, 2013 relating to Secretarial Audit became applicable to the Company during the year. Therefore the Company has obtained Secretarial Audit Report in Form No. MR-3 pursuant to Section 204(1) of the Companies Act, 2013 and rule (9) of the Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 from M/s Kiran Patel and Associates, a Practicing Company Secretary. A copy of the Report is annexed to this Directors Report.

36. TRANSFER OF AMOUNTS TO INVESTOR EDUCATION AND PROTECTION FUND:

In terms of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) of the Government of India. There were no such instances requiring compliance with the same.

37. ACKNOWLEDGEMENTS:

Your Directors express their warm wish to place on record their sincere appreciation to the Co-Operation extended by the Registrar of Companies, Comptroller & Auditor General of India and Statutory Auditors. The Directors are also grateful to the Government of Gujarat, G-RIDE, MSIL, GIDC Officers and staff of the Company for their co-operation and look forward for their continued support.

**For & on behalf of the Board of Directors of
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**

Place: Gandhinagar

Date: 28/09/2021

Sd/-

ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV

Chairman

DIN: 06581753

SECRETARIAL AUDIT REPORTFOR THE FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2021

[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule No.9 of the Companies (Appointment and Remuneration Personnel) Rules, 2014]

To,

The Members,

Bahucharaji Rail Corporation Limited

Block No. 6, 7th Floor, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382 011

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by **Bahucharaji Rail Corporation Limited**. The Secretarial Audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon. Based on our verification of the Company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the Company has, during the audit period covering the financial year ended on **31st March, 2021** complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2021 according to the provisions of:

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made thereunder;
- (ii) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made thereunder;
- (iii) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed there-under are complied with to the extent applicable. Further, MCA vide notification dated 22nd January, 2019 exempted government companies from dematerialization of shares and hence the same is not applicable to the Company.
- (iv) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made there-under to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and

External Commercial Borrowings.

- (v) The following Regulations and Guidelines prescribed under the Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act') **are not applicable** to the Company during the period under review.
- (a) The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - (b) The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 1992;
 - (c) The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2009;
 - (d) The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999;
 - (e) The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - (f) The Securities and Exchange Board of India (Registrars to an Issue and Share Transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - (g) The Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009; and
 - (h) The Securities and Exchange Board of India (Buyback of Securities) Regulations, 1998;
- (vi) I further report that, having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records in pursuance thereof on test-check basis, the Company has complied with the following laws applicable specifically to the Company:
- (i) The Contract Labour (Regulation & Abolition) Act, 1970

I have also examined compliance with the applicable clauses of the following:

- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.
- (ii) The Company being unlisted is not required to comply with the Listing Agreements of Stock Exchange(s) / SEBI (LODR) Regulations, 2015.

During the period under review, the Company has complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to our following observations:

We further report that as per information provided to us, the Company is in process of appointing a suitable candidate as Company Secretary as Key Managerial Personnel (KMP) u/s 203 of the Companies Act, 2013.

We further report that

The Board of Directors of the Company is duly constituted as on 31st March, 2021. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance, and in case of shorter notice required compliance as per Companies Act, 2013 has been ensured.

Majority decision is carried through and recorded as part of the minutes.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

We further report that

1. During the year under review the Company has increased its authorized capital from Rs. 225 Crores to Rs.786.22 Crores by passing the Ordinary resolution in the extra ordinary general meeting of the members held on 19.01.2021.
2. During the audit period the Company has :-
 - (i) allotted 8,25,80,000 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 82,58,00,000 by passing the Board Resolution by circulation on 24.07.2020 to the existing shareholders on right basis.
 - (ii) allotted 10,87,95,000 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 1,08,79,50,000 by passing the Board Resolution by circulation on 05.01.2021 to the existing shareholders on right basis.

For K. K. Patel & Associates

sd/-

CS Kiran Kumar Patel

Proprietor

Date: 14.07.2021

Place: Gandhinagar

FCS No. 6384, CP No. 6352

UDIN: F006384C000632108

*(This report is to be read with our letter of even date which is annexed as **Annexure A (Page5)** and forms an integral part of this report.)*

'Annexure A'

To,

The Members,

Bahucharaji Rail Corporation Limited

Block No. 6, 7th Floor, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382 011

Our report of even date is to be read along with this letter.

- 1. Maintenance of secretarial record is the responsibility of the management of the Company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.*
- 2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.*
- 3. We have not verified the correctness and appropriateness of financial Statements of the company.*
- 4. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.*
- 5. The Secretarial Audit report is not an assurance as to the future viability of the Company nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the company.*
- 6. Due to Covid-19, the secretarial audit is carried out with limited review as physical verification of records was not possible.*

For K. K. Patel & Associates

sd/-

CS Kiran Kumar Patel

Proprietor

FCS No. 6384, CP No. 6352

Date: 14/07/2021

Place: Gandhinagar

ANNEXURE - I**Office of the Principal Accountant General (E&RSA), Gujarat****AMG-I/A/CS/BRCL/2020-21/OW-654, 20/09/2021**

To

The Managing Director,

Bahucharaji Rail Corporation Limited,7th Floor, Block No. 6,

Udhyog Bhavan, Sector No. 11,

Gandhinagar - 382011.

Subject- Comment of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2021.

Sir,

Please find enclosed nil comment certificate of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of **Bahucharaji Rail Corporation Limited** for the year ended 31 March 2021 for being placed before Annual General Meeting of the Company.

Under Section 143(6) of the Companies Act, 2013, the comments of the Comptroller and Auditor General of India are required to be sent by Company to every person entitled to copies of audited financial statement under Section 136(1) of the Companies Act, 2013 and also to be placed before the Annual General Meeting of the Company at the same time and in the same manner as the Statutory Auditors' Report of the Company. The date of placing the Report of the Comptroller and Auditor General of India before the Annual General Meeting may please be intimated to this office.

Six copies of the printed accounts may please be sent to this office for our use and record.

Receipt of this letter with its enclosures may please be acknowledged.

Yours faithfully,

Sr. Dy. Accountant General (AMG-I)

Encl: As above

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE STANDALONE FINANCIAL STATEMENTS OF BAHUCHARAJI RAIL CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2021.

The preparation of standalone financial statements of the **Bahucharaji Rail Corporation Limited** for the year ended 31 March 2021 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143(10) of the Act. This is stated to have been done by them vide their Revised Audit Report dated 16 July, 2021.

I, on the behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the standalone financial statements of **Bahucharaji Rail Corporation Limited** for the year ended 31 March 2021 under Section 143(6)(a) of the Act, This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditors' Report under section 143(6)(b) of the Act.

**For and on behalf of the
Comptroller and Auditor General of india**

sd/-

(H. K. Dharmadarshi)

Principal Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad

Date : 20/09/2021

INDEPENDENT AUDITOR'S REPORT

To

The Members of

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Report on the Financial Statements

Opinion

We have audited the accompanying financial statements of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** ('the Company'), which comprise the Balance Sheet as at March 31, 2021, the Statement of Profit and Loss for the year then ended, the statement of cash flows for the year then ended, Statement of Changes in Equity for the year then ended and notes to the financial statements, including a summary of significant accounting policies and other explanatory information.

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act, 2013, as amended (the Act) in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India including Indian Accounting Standards (Ind AS), of the state of affairs of the Company as at March 31, 2021, and its financial performance including other comprehensive income, its cash flows and the changes in equity for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules there under, and we have fulfilled our other ethical responsibilities in accordance with these

requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion on the Financial Statements.

Management’s Responsibility for the Financial Statements

The Company’s Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act 2013 (“the Act”) with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance including other comprehensive income and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.

This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company’s ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors are also responsible for overseeing the Company’s financial reporting process.

Auditor’s Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor’s report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs, will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud

or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identified and assessed the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and also performed audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtained an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Companies Act, 2013, we are also responsible for expressing our opinion on whether the company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluated the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Concluded on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluated the overall presentation, structure and content of the financial statements including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with the mall relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2016 ("the Order") issued by the Central Government in terms of Section 143(11) of the Act, we give in "**Annexure A**" a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order, to the extent applicable.
2. We are enclosing our report in terms of section 143(5) of the act, on the basis of such checks of the Books and Records of the company as we considered appropriate and according to information and explanation given to us, in the "**Annexure B**" on the direction and sub-directions issued by Comptroller and Auditor General of India.
3. As required by Section 143(3) of the Act, we report that:
 - a. We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit;
 - b. In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books;
 - c. The Balance Sheet, the Statement of Profit & Loss including Statement of other comprehensive income and the Cash Flow Statement and statement of changes in equity dealt with by this Report are in agreement with the books of account;

- d. In our opinion, the aforesaid financial statements comply with the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended;
- e. The company being Government Company, provisions of sub section 2 of section 164 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs;
- f. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate report in “**Annexure C**”; and
- g. The company being Government Company, provisions of section 197 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs;
- h. With respect to the other matters to be included in the Auditor’s Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended, in our opinion and to the best of our knowledge and belief and according to the information and explanations given to us:
 1. The Company does not have any pending litigations as on Balance Sheet dated March 31,2021.
 2. The Company has made provision, as required under the applicable law or Indian Accounting Standards, for material foreseeable losses, if any, on long-term contracts including derivative contracts.
 3. There has been no delay in transferring amounts, required to be transferred, to the Investor Education and Protection Fund by the Company.

For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Place : Ahmedabad
Date : 16/07/2021

Sd/-
Malay J Dalal
Partner
Membership No.: 036776

“ANNEXURE A” REFERRED TO IN THE INDEPENDENT AUDITOR'S REPORT**Of even date to the members of BAHUCHARAJI RAIL CORPORATION LIMITED on the Financial Statements for the year ended 31st March, 2021.**

(Referred to in paragraph 1 under 'Report on other legal and regulatory requirement' of our report of even date)

Based on the audit procedures performed for the purpose of reporting a true and fair view on the Financial Statements of the Company and taking into consideration the information and explanations given to us and the books of account and other records examined by us in the normal course of audit, we report that:

(i) In respect of its fixed assets:

The company does not have any fixed asset therefore this clause is not applicable. However, the company has Capital Asset Work in Progress as well as Capital Work in Progress under Intangible Assets Under Development and they are reflected in Financial Statement.

(ii) The company does not have any inventory therefore this clause is not applicable.

(iii) The company has not granted any loans, secured or unsecured, to companies, firms, Limited Liability Partnership or other parties covered in the register maintained under section 189 of the Companies Act, 2013. Hence reporting under clause (iii) of CARO 2016 is not applicable to the Company.

(iv) According to the information and explanation given to us, the Company has not granted any loans, nor given any guarantees and securities u/s 185 and 186 of the Companies Act, 2013. Hence reporting under clause (iv) of CARO 2016 is not applicable to the Company.

(v) According to the information and explanation given to us, the Company has not accepted any deposits from the public within the meaning of provision of section 73 to 76 of the Act and the rules framed there under and hence reporting under clause (v) of the CARO 2016 is not applicable.

(vi) The maintenance of cost records specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013 is not applicable to this Company. Hence reporting under clause (vi) of CARO 2016 is not applicable to the Company.

(vii) According to the information and explanation given to us, in respect of statutory dues:

(a) The Company had been regular in depositing undisputed statutory dues, including, Income Tax, Goods and Service Tax, and other material statutory dues applicable to it to the appropriate authorities.

(b) There is no dispute with revenue authorities regarding any duty or tax payable.

- (viii) According to the information and explanation given to us, the Company has not defaulted in repayment of dues to a financial institution or bank.
- (ix) To the best of our knowledge and according to the information and explanation given to us, during the year Company has not raised money by way of Initial Public Offer and/or Further Public Offer(including Debt Instrument)and also company has not obtained any Term loan and therefore this clause is not applicable to the company. However, company has utilized the monies raised by way of right issue of equity shares for the purpose for which they were raised.
- (x) To the best of our knowledge and according to the information and explanation given to us, no fraud by the Company and no fraud on the Company by its officers or employees has been noticed or reported during the period.
- (xi) The Company is exempted from section 197 of the Companies Act, 2013 since this is the Government Company as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs. Hence reporting under clause (xi) of CARO 2016 is not applicable to the Company.
- (xii) The Company is not a Nidhi Company and hence reporting under clause (xii) of CARO 2016 is not applicable to the Company.
- (xiii) In our opinion and according to the information and explanation given to us, the Company is in compliance with section 188 and 177 of the Companies Act, 2013, where applicable. For all transaction with the related parties and the details of related parties transaction have been disclosed in the financial statements etc., as required by the applicable Indian Accounting Standards.
- (xiv) During the period the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly convertible debentures and hence reporting under clause (xiv) of CARO 2016 is not applicable to the Company.
- (xv) In our opinion and according to the information and explanation given to us, during the period Company has not entered into any non-cash transaction with its directors or persons connected with him and hence provision of section 192 of the Companies Act, 2013 are not applicable.
- (xvi) The company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934.

For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Place : Ahmedabad
Date : 16/07/2021

Sd/-
Malay J Dalal
Partner
Membership No.: 036776

“ANNEXURE B” REFERRED TO IN THE INDEPENDENT AUDITOR'S REPORT

Of even date to the members of BAHUCHARAJI RAIL CORPORATION LIMITED on the Financial Statements for the year ended 31st March, 2021.

(Referred to in paragraph 2 under 'Report on other legal and regulatory requirement' of our report of even date)

Report under Section 143(5) of Companies Act, 2013 for the Financial Year 2019-20

(1) MAIN DIRECTION:

Sr. No.	Directions	Comments
1.	Whether the Company has system in place to process all the accounting transactions through IT system? If no, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes. All Accounting transactions are processed through IT Systems.
2.	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/ internet etc. made by a lender to the Company due to the Company's inability to repay the loan? If yes, the financial impact may be stated.	No waiver/write off is done during the period under Audit.
3.	Whether funds received/receivable for specific schemes from Central/State agencies were properly accounted for/ utilised as per its term and conditions? List the cases of deviation.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.

(2) SECTOR SPECIFIC DIRECTIONS : INFRASTRUCTURE SECTOR

Sr. No.	Sub-Directions	Comments
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached, under litigation, not put to use or declared surplus? Details may be provided.	As per the information and explanation provided to us, during the course of audit we have observed that the company does not have any idle land and therefore, there is no question of encroachment to the idle land as well as there is no litigation in connection to idle land.
2.	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines / policies of the Government? Comment on deviation if any.	Not Applicable.
3.	Whether system for monitoring the execution of works vis-à-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenues / losses from contracts, etc., have been properly accounted for in the books.	As per the information and explanation provided to us, we report as under: 1. System for Monitoring the Execution of Works: a. Company has appointed Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) in its 1 st Board Meeting held on 09.01.2019 as Project Management Consultant (PMC) and the Contract for said PMC has been executed on 28.08.2020 i.e. during the year under report b. Company therefore has an adequate system of monitoring for the project where G-RIDE is providing service as mentioned in PMC Agreement at Para 1.1, which constitute a better monitoring system for company project.

		<p>2. Agreement Milestone Status: a. Company has awarded EPC Contract to Kalpataru Power Transmission Limited (KPTL) for 1st Phase of Katosan Road – Becharaji (26.6 Kms) and specified Milestone (MS) for the project as under, which are extended by issuing letter bearing reference no. G-RIDE/Transaction Advisor/2019-20/038/1876 dated 22.06.2021 to KPTL as per the Office Memorandum issued by Ministry of Finance, Department of Expenditure, Procurement Policy Division:</p> <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <thead> <tr> <th style="text-align: center;">Sr. No.</th> <th style="text-align: center;">Milestone</th> <th style="text-align: center;">Completion Date as per Contract Agreement</th> <th style="text-align: center;">Revised Completion Date</th> <th style="text-align: center;">Remarks</th> </tr> </thead> <tbody> <tr> <td style="text-align: center;">1</td> <td style="text-align: center;">MS-I*</td> <td style="text-align: center;">19-08-2020</td> <td style="text-align: center;">14-02-2021</td> <td style="text-align: center;">6 Months Extension</td> </tr> <tr> <td style="text-align: center;">2</td> <td style="text-align: center;">MS-II</td> <td style="text-align: center;">19-06-2021</td> <td style="text-align: center;">19-12-2021</td> <td style="text-align: center;">6 Months Extension</td> </tr> <tr> <td style="text-align: center;">3</td> <td style="text-align: center;">MS-III</td> <td style="text-align: center;">19-10-2021</td> <td style="text-align: center;">19-02-2022</td> <td style="text-align: center;">24 Months Extension</td> </tr> <tr> <td style="text-align: center;">4</td> <td style="text-align: center;">MS-IV**</td> <td style="text-align: center;">19-02-2022</td> <td style="text-align: center;">19-02-2022</td> <td style="text-align: center;">-</td> </tr> </tbody> </table> <p>*Note-1: Milestone-I has been completed within revised completion date as per Letter No. KPTL/GRIDE/KTRD-BHRJ/0470 dated 10.02.2021 issued by KPTL.</p> <p>**Note-2: Based on the Progress of Work, further extension of Milestone-IV shall be considered and decision will be taken at appropriate time depending upon the prevailing conditions.</p> <p>3. The Impact of Cost Escalation: Company has adequately accounted the Escalation Amount in Books of Account claimed by the EPC Contractor (KPTL) during the year under report, which are as per the Contract Agreement and approved by the competent authority.</p>	Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks	1	MS-I*	19-08-2020	14-02-2021	6 Months Extension	2	MS-II	19-06-2021	19-12-2021	6 Months Extension	3	MS-III	19-10-2021	19-02-2022	24 Months Extension	4	MS-IV**	19-02-2022	19-02-2022	-
Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks																							
1	MS-I*	19-08-2020	14-02-2021	6 Months Extension																							
2	MS-II	19-06-2021	19-12-2021	6 Months Extension																							
3	MS-III	19-10-2021	19-02-2022	24 Months Extension																							
4	MS-IV**	19-02-2022	19-02-2022	-																							

4.	Whether funds received/receivable for specific schemes from central/ State agencies were properly accounted for/utilized ? List the cases of deviations.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.
5.	Whether the bank guarantees have been revalidated in time?	As per the information and explanation provided to us, the company has not availed any Bank Guarantee during the year. However, the company has received Bank Guarantees and the same has been revalidated by the Company in time.
6.	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	We have obtained following Confirmations and all are in agreement with figures of Financial Statements: <ol style="list-style-type: none"> 1. Bank Balance Certificate from Yes Bank and Union Bank of India 2. Balance & Interest certificate of Deposit with GSFS. 3. Balance Confirmation of Gujarat Rail Infrastructure Development Limited 4. Balance and Interest receivable on Mobilization advances from EPC Contractor (M/s. Kalpataru Power Transmission Limited) 5. Cash Balance as on 31.03.2021 from Management 6. There were no trade receivables as on Balance Sheet date and therefore, Nil Balance Certificate has been obtained from the Management.
7.	The cost incurred on abandoned projects may be quantified and the amount actually written-off shall be mentioned.	As per the information and explanation provided to us, there are no abandoned projects therefore this point is not applicable.

For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay J Dalal
Partner

Place : Ahmedabad
Date : 16/07/2021

Membership No.: 036776

ANNEXURE “C” TO THE INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in paragraph 3(f) under ‘Report on other legal and regulatory requirement’ of our report of even date)

Report on the Internal Financial Controls over Financial Reporting under clause (i) of Sub section 3 of Section 143 of the companies Act, 2013 (‘the Act’).

We have audited the Internal financial controls over financial reporting of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“the Company”) as on 31st March, 2021 in conjunction with our audit of the standalone financial statements of the company for the year ended on that date.

MANAGEMENT’S RESPONSIBILITY FOR INTERNAL FINANCIAL CONTROLS

The Company’s management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential component of internal control stated in the guidance note on audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company’s policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

AUDITOR’S RESPONSIBILITY

Our responsibility is to express an opinion on the Company’s Internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the guidance note on Audit of internal financial controls over financial reporting (the “Guidance Note”) issued by the Institute of Chartered Accountants of India and the standards on auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those standards and the guidance note require that we comply with ethical requirement and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness if internal control based on the assessed risk. The procedure selected depend on auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due of fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting with reference to these financial statements.

MEANING OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING WITH REFERENCE TO THESE FINANCIAL STATEMENTS

A company's internal financial controls over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation for external purpose in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that:

1. pertain to the maintenance of records that, in reasonable details, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
2. provide reasonable assurance that transaction are recorded as necessary to permit preparation of financial statement in accordance with generally accepted accounting principles, and that receipt and expenditures of the company are being made only in accordance with authorization of management and directors of the company; and
3. provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

INHERENT LIMITATION OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING WITH REFERENCE TO THESE FINANCIAL STATEMENTS

Because of the inherent limitation of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projection of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

OPINION

In our opinion, to the best of our information and according to the explanation given to us, the company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March, 2021, based on the internal control over financial reporting criteria established by the Company Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountant of India. considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountant of India.

For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay J Dalal
Partner

Membership No.: 036776

Place : Ahmedabad
Date : 16/07/2021

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED			
(CIN: U45101GJ2018SGC105602)			
Balance Sheet as at March 31, 2021			
(Amount in ₹)			
Particulars	Notes No.	As at March 31, 2021	As at March 31, 2020
ASSETS			
NON-CURRENT ASSETS			
Property, Plant and Equipment		-	-
Capital Work-in-Progress	4	8,17,235	3,21,027
Intangible Assets		-	-
Intangible Assets Under Development	5	65,37,33,979	6,40,791
Financial Assets			
(i) Investments	6	-	-
(ii) Trade Receivables		-	-
(iii) Loans		-	-
(iv) Other Financial Assets		-	-
Deferred Tax Assets (Net)	7	-	-
Other Non-Current Assets	8	29,82,93,079	13,41,58,600
TOTAL NON-CURRENT ASSETS		95,28,44,293	13,51,20,418
CURRENT ASSETS			
Inventories		-	-
Financial Assets			
(i) Investments	9	97,01,69,424	-
(ii) Trade Receivables		-	-
(iii) Cash and Cash Equivalents	10	5,33,61,618	13,90,076
(iv) Loans		-	-
(v) Other Financial Assets		-	-
Current Tax Assets (Net)	11	-	-
Other Current Assets	13	-	-
TOTAL CURRENT ASSETS		1,02,35,31,042	13,90,076
TOTAL ASSETS		1,97,63,75,335	13,65,10,494

EQUITY AND LIABILITIES			
EQUITY			
Equity share capital	14	1,92,37,50,000	1,00,00,000
Other equity	15	(3,56,98,615)	(3,71,97,406)
TOTAL EQUITY		1,88,80,51,385	(2,71,97,406)
LIABILITIES			
Share Application Money Pending for Allotment	16	-	-
NON-CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Borrowings		-	-
(ii) Trade Payable		-	-
(iii) Other financial liabilities	17	2,48,29,068	-
Provisions		-	-
Deferred tax liabilities (net)		-	-
Other non current liabilities		-	-
TOTAL NON-CURRENT LIABILITIES		2,48,29,068	-
CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Borrowings	18	-	14,31,27,855
(ii) Trade Payable due to:	19		
Micro & Small Enterprise		2,30,926	-
Other than Micro & Small Enterprise		-	1,92,68,403
Provisions	20	5,34,01,016	12,25,261
Other current liabilities	21	78,65,588	86,381
Current tax liabilities (net)	22	19,97,352	-
TOTAL CURRENT LIABILITIES		6,34,94,882	16,37,07,900
TOTAL EQUITY AND LIABILITIES		1,97,63,75,335	13,65,10,494
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements 1 to 40			
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal		For and on behalf of the Board	
Chartered Accountants			
FRN. 109432W			
sd/-	sd/-	sd/-	sd/-
Malay Dalal	S. N. Joshi	B. C. Warli	Santosh Kumar
Partner	CFO	Director	Director / CEO
Membership No. 036776		DIN: 07133942	DIN: 07854179
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: July 16, 2021	Date: July 16, 2021		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED			
(CIN: U45101GJ2018SGC105602)			
Statement of Profit and Loss for the year ended on March 31, 2021			
(Amount in ₹)			
Particulars	Notes No.	For the period from April 01, 2020 to March 31, 2021	For the period from April 01, 2019 to March 31, 2020
Income			
Revenue from operations		-	-
Other Income	23	1,97,79,232	17,59,470
Total Income		1,97,79,232	17,59,470
Expenses			
Employee benefit expense, payment to contractors and consultants	24	8,29,336	6,35,003
Finance costs	25	-	-
Depreciation and amortisation expense	26	-	-
Other expenses	27	1,19,48,522	2,22,07,938
Total Expenses		1,27,77,858	2,28,42,941
Profit /(Loss) before exceptional item and taxes		70,01,374	(2,10,83,471)
Exceptional Item(Net off Tax)		-	-
Profit/(loss) before tax		70,01,374	(2,10,83,471)
Tax expense			
Current tax	12	55,02,582	-
Deferred Tax		-	-
Total Tax Expenses		55,02,582	-
Profit/(loss) after tax for the period		14,98,792	(2,10,83,471)

Other comprehensive income			
(i) Items that will not be reclassified to profit or loss		-	-
(ii) Income tax on items that will not be reclassified to profit or loss		-	-
(iii) Items that will be reclassified to profit or loss		-	-
(iv) Income tax relating to items that will be reclassified to profit or loss		-	-
Total Other Comprehensive Income/(Loss) for the Year(Net off Tax)		-	-
Total Comprehensive Income for the period		14,98,792	(2,10,83,471)
Earnings Per Equity Share of Face Value of Rs. 10 each			
	28		
Basic		0.02	(35.3)
Diluted		0.02	(35.3)
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements 1 to 40			
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal	For and on behalf of the Board		
Chartered Accountants			
FRN. 109432W			
sd/-	sd/-	sd/-	sd/-
Malay Dalal	S. N. Joshi	B. C. Warli	Santosh Kumar
Partner	CFO	Director	Director / CEO
Membership No. 036776		DIN: 07133942	DIN: 07854179
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: July 16, 2021	Date: July 16, 2021		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

STATEMENT OF CHANGES IN EQUITY AS ON 31/03/2021

(Amount in ₹)

A. EQUITY SHARE CAPITAL	
As at 1st April 2019	-
Changes during the year 2019-20	1,00,00,000
As at 31st March 2020	1,00,00,000
Changes during the year 2020-21	1,91,37,50,000
As at 31st March 2021	1,92,37,50,000
B. OTHER EQUITY	
As at 1st April 2019	(1,61,13,935)
Profit/(loss) for the year 2019-20	(2,10,83,471)
Other Comprehensive Income	-
Total Comprehensive Income	(2,10,83,471)
Balance As at 31st March 2020	(3,71,97,406)
Profit/(loss) for the year 2020-21	14,98,792
Other Comprehensive Income	-
Total Comprehensive Income	14,98,792
Balance As at 31st March 2021	(3,56,98,615)
see accompanying notes to the Financial Statements	

As per our report of even date
For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W
For and on behalf of the Board

sd/-

Malay Dalal
Partner
Membership No. 036776

sd/-

S. N. Joshi
CFO

sd/-

B. C. Warli
Director
DIN: 07133942

sd/-

Santosh Kumar
Director / CEO
DIN: 07854179
Place: Ahmedabad
Date: July 16, 2021
Place: Gandhinagar
Date: July 16, 2021

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)
Cash Flow Statement for the year ended March 31, 2021
(Amount in ₹)

Particulars	2020-2021	2019-2020
1 Cash Flows from Operating Activities		
Profit/(Loss) before tax as per Statement of Profit & Loss	70,01,374	(2,10,83,471)
Adjusted for:-		
Interest Income	(1,94,32,152)	(4,61,165)
Finance Cost	-	-
Operating Profit/(Loss) before Working Capital Changes	(1,24,30,778)	(2,15,44,636)
Adjusted for Movement in Working Capital:		
(Increase)/ Decrease in Other Current Assets	-	-
Increase/ (Decrease) in trade Payable	(1,90,37,477)	34,38,857
Increase/ (Decrease) in Provisions	5,21,75,755	9,62,061
Increase/ (Decrease) in Other Current liabilities	77,79,207	56,792
Increase/ (Decrease) in Other Financial liabilities	2,48,29,068	-
Increase/ (Decrease) in Current Tax liabilities	19,97,352	-
Operating Profit after Working Capital Changes	6,77,43,905	44,57,710
Taxes Paid (Net of Refund)	(55,02,582)	-
Net cash flow from / (used in) operating activities (A)	4,98,10,544	(1,70,86,926)
2 Cash Flows from Investing Activities:		
(Increase)/Decrease in Capital Work in Progress	(4,96,208)	(3,21,027)
(Increase)/Decrease in Intangible Assets		
Under Development	(65,30,93,188)	(6,40,791)
(Increase)/Decrease in Non Current Assets	(16,41,34,479)	(13,41,58,600)
Interest Income	1,94,32,152	4,61,165
Investment in GSFS	(97,01,69,424)	-
Net cash flow from / (used in) investing activities (B)	(1,76,84,61,147)	(13,46,59,253)

3 Cash flow from financing activities :		
Proceeds From Share Capital	1,91,37,50,000	26,00,000
Proceeds from Application Money pending allotment	-	-
Proceeds/(Repayment) from/of short term borrowing	(14,31,27,855)	14,31,27,855
Finance Cost	-	-
Net cash flow from / (used in) financing activities (C)	1,77,06,22,145	14,57,27,855
Net increase in cash and cash equivalents (A)+(B)+(C)	5,19,71,542	(60,18,324)
Cash and cash equivalents as at the beginning of the year	13,90,076	74,08,400
Cash and cash equivalents as at end of the year	5,33,61,618	13,90,076
Break up of cash and cash equivalents at the end of the year		
Balances with Banks-In Current/Saving Accounts	5,33,61,618	13,90,076
	5,33,61,618	13,90,076
Notes:		
1 Cash and cash equivalent include cash and bank balances and deposits with the Bank (Original Maturity less than 3 months).		
2 The above Cash Flow Statement has been prepared under the 'Indirect method' as set out in the Ind AS - 7 Statement of Cash Flow.		
3 Previous year figures have been regrouped and reclassified wherever considered necessary to conform to the current year's figures.		
As per our report of even date	For and on behalf of the Board	
For Shah & Dalal		
Chartered Accountants		
FRN. 109432W		
sd/-	sd/-	sd/-
Malay Dalal	S. N. Joshi	B. C. Warli
Partner	CFO	Director
Membership No. 036776		DIN: 07133942
		Santosh Kumar
		Director / CEO
		DIN: 07854179
Place: Ahmedabad	Place: Gandhinagar	
Date: July 16, 2021	Date: July 16, 2021	

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**Notes to Financial Statements for the year ending on March 31, 2021****1. Corporate Information**

Bahucharaji Rail Corporation Limited, is a special purpose vehicle (SPV) for the Railway project as per GR No.MIS-10-2017-1665-1-1 dated 05/02/2018 issued by Government of Gujarat to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road-Becharaji-Chanasma-Ranuj for 65 Kms line project in the state of Gujarat.

2. The financial statements were authorized for issue in accordance with resolution of the Directors on 26th May 2021.

3 (i) Basis of Preparation

These financial statements have been prepared on a historical cost basis, except for certain financial instruments which are measured at fair value at the end of each reporting period. Historical cost is generally based on the fair value of the consideration given in exchange for goods and services. Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date.

A. Statement of Compliance

These financial statements of the company have been prepared to comply with Indian Accounting Standards (Ind AS) including the rules notified under the relevant provision of the Companies Act, 2013, amended from time to time.

Details of the Company's accounting policies are included in Note 3(ii).

B. Functional and Presentation Currency

These financial statements are presented in Indian Rupees (INR), which is also the Company's functional currency.

C. Use of Estimates and Judgments

In preparing these financial statements, management has made judgements, estimates and assumptions that affect the application of accounting policies and the reported amounts of assets, liabilities, income and expenses. Actual results may differ from these estimates.

Critical Estimates and Judgments

This note provides an overview of the areas that involved a higher degree of judgement or complexity, and of items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements.

Areas involving critical estimates or judgements are :

- Depreciation and Amortization :
 - Depreciation and amortization is based on management estimates of the future useful lives of the property, plant and equipment and intangible assets. Estimates may change due to technological developments, competition, changes in market conditions and other factors and may result in changes in the estimated useful life and in the depreciation and amortization charge.
- Other areas are as below :
 - Estimation of current and deferred tax expense and payable :

Deferred tax assets are recognized to the extent that it is regarded as probable that deductible temporary differences can be realized. The Company estimates deferred tax assets and liabilities based on current tax laws and rates and in certain cases, business plans, including management's expectations regarding the manner and timing of recovery of the related assets. Changes in these estimates may affect the amount of deferred tax liabilities or the valuation of deferred tax assets and thereby the tax charge in the Statement of Profit and Loss.

Provision for tax liabilities require judgements on the interpretation of tax legislation, developments in case laws and the potential outcomes of tax audits and appeals which may be subject to significant uncertainty. Therefore, the actual results may vary from expectations resulting in adjustments to provisions, the valuation of deferred tax assets, cash tax settlements and therefore the tax charge in the Statement of Profit and Loss.

- Recognition and measurement of provisions and contingencies :

From time to time, the Company is subject to legal proceedings and other contingencies the ultimate outcome of each being always subject to many uncertainties inherent in litigation. A provision for expense is made when it is considered probable that a payment will be made and the amount of the loss can be reasonably estimated.

Significant judgement is made when evaluating, among other factors, the probability of unfavourable outcome and the ability to make a reasonable estimate of the amount of potential loss. Expense provisions are reviewed at each accounting period and revisions made for the changes in facts and circumstances.

- Impairment of Assets :

Property, plant and equipment and intangible assets that are subject to depreciation/ amortization are tested for impairment periodically including when events occur or changes in circumstances indicate that the recoverable amount of the cash generating unit is less than its carrying value. The recoverable amount of cash generating units is higher of value-in-use and fair value less cost to sell. The calculation involves use of significant estimates and assumptions which includes turnover and earnings multiples, growth rates and net margins used to calculate projected future cash flows, risk-adjusted discount rate, future economic and market conditions.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to accounting estimates are recognized prospectively.

D. Measurement of Fair Values

A number of the Company's accounting policies and disclosures require measurement of fair values, for both financial and non-financial assets and liabilities.

Fair values are categorized into different levels in a fair value hierarchy based on the inputs used in the valuation techniques as follows.

- Level 1: quoted prices (unadjusted) in active markets for identical assets or liabilities.
- Level 2: inputs other than quoted prices included in Level 1 that are observable for the asset or liability, either directly (i.e. as prices) or indirectly (i.e. derived from prices).
- Level 3: inputs for the asset or liability that are not based on observable market data (unobservable inputs).

When measuring the fair value of an asset or a liability, the Company uses observable market data as far as possible. If the inputs used to measure the fair value of an asset or a liability fall into different levels of the fair value hierarchy, then the fair value measurement is categorized in its entirety in the same level of the fair value hierarchy as the lowest level input that is significant to the entire measurement.

The Company recognizes transfers between levels of the fair value hierarchy at the end of the reporting period during which the change has occurred.

Further information about the assumptions made in measuring fair values is included in the note of financial instruments.

E. Global Health Pandemic on COVID-19

The outbreak of corona virus (COVID-19) pandemic globally and in India is causing significant disturbance and slowdown of economic activity. The Company's operations and revenue during the period were impacted due to COVID-19. The Company has taken into account the possible impact of COVID-19 in preparation of financial statements, including its assessment of recoverable value of its assets based on internal and external information up to the date of approval of these financial statements and current indicators of future economic conditions.

3 (ii) Significant Accounting Policies

The accounting policies set out below have been applied consistently to the period presented in these financial statements.

a. Foreign Currency Transactions:

Transactions in foreign currencies are translated into the functional currency of the Company at the exchange rates at the dates of the transactions or an average rate if the average rate approximates the actual rate at the date of the transaction.

Monetary assets and liabilities denominated in foreign currencies are translated into the functional currency at the exchange rate at the reporting date. Non-monetary assets and liabilities that are measured at fair value in a foreign currency are translated into the functional currency at the exchange rate when the fair value was determined. Non-monetary assets and liabilities that are measured based on historical cost in a foreign currency are translated at the exchange rate at the date of the transaction.

Exchange differences are recognized in profit or loss, except exchange differences arising from the translation of the following items which are recognized in OCI:

- Equity investments at fair value through OCI (FVOCI);
- qualifying cash flow hedges to the extent that the hedges are effective.

b. Financial Instruments:Recognition and Initial Measurement

Trade receivables are initially recognized when they are originated. All other financial assets and financial liabilities are initially recognized when the Company becomes a party to the contractual provisions of the instrument.

A financial asset or financial liability is initially measured at fair value plus, for an item not at fair value through profit and loss (FVTPL), transaction costs that are directly attributable to its acquisition or issue.

Classification and Subsequent Measurement and Gain and Losses: Financial Assets

Financial Assets at amortized cost- These assets are subsequently measured at amortized cost using the effective interest method. The amortized cost is reduced by impairment losses. Interest income, foreign exchange gains and losses and impairment are recognized in profit or loss. Any gains or loss or derecognition is effected in profit or loss statement

Financial Assets at Fair Value through Other Comprehensive Income (FVTOCI) – All equity investments are measured at fair values. Investments which are not held for trading purposes and where the Company has exercised the option to classify the investment as at FVTOCI, all fair value changes on the investment are recognized in Other Comprehensive Income (OCI). The accumulated gains or losses are recognized in OCI are reclassified to retained earnings on sale of such investment.

Financial assets at Fair Value through Profit and loss (FVTPL) - These assets are subsequently measured at fair value. Net gains and losses, including any interest or dividend income, are recognized in profit or loss.

Classification, Subsequent Measurement and Gains and Losses : Financial Liabilities

Financial liabilities are subsequently measured at amortized cost using effective interest method. For trade and other payable maturing within one year from the

balance sheet date, the carrying value approximates fair value due to short maturity of these investments.

Equity Instruments

An equity instrument is a contract that evidences residual interest in the assets of the company after deducting all of its liabilities. Incremental costs directly attributable to the issuance of equity instruments are recognized as a deduction from equity instrument net of any tax effects.

Derecognition: Financial Assets

The Company derecognizes a financial asset when the contractual rights to the cash flows from the financial asset expire, or it transfers the rights to receive the contractual cash flows in a transaction in which substantially all of the risks and rewards of ownership of the financial asset are transferred or in which the company neither transfers nor retains substantially all of the risks and rewards of ownership and does not retain control of the financial asset.

If the Company enters into transactions whereby it transfers assets recognized on its balance sheet but retains either all or substantially all of the risks and rewards of the transferred assets, the transferred assets are not derecognized.

Derecognition: Financial Liabilities

The Company derecognizes a financial liability when its contractual obligations are discharged or cancelled or expired.

The Company also derecognizes a financial liability when its terms are modified and the cash flows under the modified terms are substantially different. In this case, a new financial liability based on the modified terms is recognized at fair value. The difference between the carrying amount of the financial liability extinguished and the new financial liability with modified terms is recognized in profit or loss.

Offsetting

Financial assets and financial liabilities are offset and the net amount presented in the balance sheet when, and only when, the Company currently has a legally enforceable right to set off the amounts and it intends either to settle them on a net basis or to realize the asset and settle the liability simultaneously.

c. Current and Non-Current Classification

The Company presents assets and liabilities in the balance sheet based on current/non-current classification. An asset is treated as current when it is:

- (a) expected to be realised in, or is intended to be sold or consumed in Company's normal operating cycle;
- (b) held primarily for the purpose of being traded;
- (c) expected to be realised within 12 months after the reporting date; or
- (d) cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least 12 months after the reporting date.

All other assets are classified as non-current

A Liability is current when:

- (a) it is expected to be settled in Company's normal operating cycle;
- (b) it is held primarily for the purpose of being traded;
- (c) it is due to be settled within 12 months after the reporting date; or
- (d) The Company does not have an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting date.

All other liabilities are classified as non-current

Operating Cycle

Operating cycle is the time between the acquisition of assets for processing and their realisation in cash or cash equivalents. The Company has identified twelve months as its operating cycle.

d. Property, Plant and Equipment**Recognition and Measurement**

Items of property, plant and equipment are measured at cost, which includes capitalised borrowing costs, less accumulated depreciation, and accumulated impairment losses, if any.

Cost of an item of property, plant and equipment comprises its purchase price, including import duties and non-refundable purchase taxes, after deducting trade discounts and rebates, any directly attributable cost of bringing the item to its working condition for its intended use and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

The cost of a self-constructed item of property, plant and equipment comprises the cost of materials and direct labour, any other costs directly attributable to bringing the item to working condition for its intended use, and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

If significant parts of an item of property, plant and equipment have different useful lives, then they are accounted for as separate items (major components) of property, plant and equipment.

Any gain or loss on disposal of an item of property, plant and equipment is recognised in profit or loss.

Subsequent Expenditure

Subsequent expenditure is capitalized only if it is probable that the future economic benefits associated with the expenditure will flow to the Company.

Depreciation

Depreciation on property, plant and equipment is provided on straight line basis based on the rates as per useful life prescribed in Schedule II to the Companies Act, 2013. Assets costing less than INR 5,000 each are fully depreciated in the year of capitalisation.

Depreciation on additions / disposals is provided on a pro-rata basis i.e. from / up to the date on which asset is ready for use / disposed of.

Depreciation method, useful lives and residual values are reviewed at each financial year-end and adjusted if appropriate. In case of a revision, the unamortized depreciable amount is charged over the revised remaining useful life.

Losses arising from retirement or gains or losses arising from disposal of fixed assets which are carried at cost are recognized in the Statement of Profit and Loss.

Capital work in progress represents projects under which property, plant & equipment are not yet ready for their intended use and are carried at cost determined as aforesaid. Indirect expense related to Capital Work in Progress has been capitalised to respective Capital Work in Progress Account.

e. Intangible Assets Under DevelopmentFreight Sharing right Under Development :

Expenditure which can be directly identifiable related to the service concession arrangements are recognized as freight sharing right under development. Indirect expenditure has been charged to project to the extent they are related to project execution, Also Interest earned on the mobilization advances given in respect of the project execution are reduced from the intangible assets under development.

f. ImpairmentImpairment of Financial Instruments

The Company recognizes loss allowances for expected credit losses on financial assets measured at amortized cost.

At each reporting date, the Company assesses whether financial assets carried at amortized cost are credit impaired. A financial asset is 'credit impaired' when one or more events that have a detrimental impact on the estimated future cash flows of the financial asset have occurred.

The Company measures loss allowances at an amount equal to lifetime expected credit losses. Lifetime expected credit losses are the expected credit losses that result from all possible default events over the expected life of a financial instrument.

When determining whether the credit risk of a financial asset has increased significantly since initial recognition and when estimating expected credit losses, the Company considers reasonable and supportable information that is relevant and available without undue cost or effort. This includes both quantitative and qualitative information and analysis, based on the Company's historical experience and informed credit assessment and including forward looking information.

Measurement of Expected Credit Losses

Expected credit losses are a probability weighted estimate of credit losses. Credit losses are measured as the present value of all cash shortfalls (i.e. the difference between the cash flows due to the Company in accordance with the contract and the cash flows that the Company expects to receive).

Presentation of Allowance for Expected Credit Losses in the Balance Sheet

Loss allowances for financial assets measured at amortized cost are deducted from the gross carrying amount of the assets.

Write-off

The gross carrying amount of a financial asset is written off (either partially or in full) to the extent that there is no realistic prospect of recovery. This is generally the case when the Company determines that the debtor does not have assets or sources of income that could generate sufficient cash flows to repay the amounts subject to the write off. However, financial assets that are written off could still be subject to enforcement activities in order to comply with the Company's procedures for recovery of amounts due.

Impairment of Non-Financial Assets

The Company's non-financial assets, other than inventories and deferred tax assets are reviewed at each reporting date to determine whether there is any indication of impairment. If any such indication exists, then the asset's recoverable amount is estimated. The recoverable amount being higher of the net selling price or value in use. Value in use is determined from the present value of the estimated future cash flows from the continuing use of the assets.

If the recoverable amount of an asset (or cash-generating unit) is estimated to be less than its carrying amount, the carrying amount of the asset (or cash-generating unit) is reduced to its recoverable amount. An impairment loss is recognized immediately in the Statement of Profit and Loss. When an impairment loss subsequently reverses, the carrying amount of the asset (or a cash-generating unit) is increased to the revised estimate of its recoverable amount, but so that the increased carrying amount does not exceed the carrying amount that would have been determined had no impairment loss been recognized for the asset (or cash-generating unit) in prior years. A reversal of an impairment loss is recognized immediately in the Statement of Profit and Loss.

g. Borrowing Cost

Borrowing costs are interest and other costs (including exchange differences relating to foreign currency borrowings to the extent that they are regarded as an adjustment to interest costs) incurred in connection with the borrowing of funds. Borrowing costs directly attributable to acquisition or construction of an asset which necessarily

take a substantial period of time to get ready for their intended use are capitalized as part of the cost of that asset. Other borrowing costs are recognized as an expense in the period in which they are incurred.

h. Borrowing

Borrowings are classified as current liabilities unless the Company has an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting period. Where there is a breach of a material provision of a long-term loan arrangement on or before the end of reporting period with the effect that the liability becomes payable on demand on the reporting date, the Company does not classify the liability as current, if the lender agreed, after the reporting period and before the approval of the financial statement for issue, not to demand payment as a consequence of the breach.

i. Revenue Recognition

Revenue is recognized when there is reasonable certainty of its ultimate collection/realization.

Interest income is recognized using the effective interest method and are accounted on accrual basis.

All other item of income are accounted on accrual basis.

j. Provisions (other than Employee Benefits)

A provision is recognized if, as a result of a past event, the Company has a present obligation that can be estimated reliably, and it is probable that an outflow of economic benefits will be required to settle the legal or contractual obligation. Provisions are determined by discounting the expected future cash flows (representing the best estimate of the expenditure required to settle the present obligation at the balance sheet date) at a pre-tax rate that reflects current market assessments of the time value of money and the risks specific to the liability. The unwinding of the discount is recognized as finance cost. Expected future operating losses are not provided for.

Contingencies

Provision in respect of loss contingencies relating to claims, litigation, assessment, fines, penalties, etc. are recognized when it is probable that a liability has been incurred and the amount can be estimated reliably.

k. Contingent Liabilities

Contingent liabilities are disclosed when there is a possible obligation arising from past events, the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Company or a present obligation that arises from past events where it is either not probable that an outflow of resources will be required to settle, or a reliable estimate of the amount cannot be made.

l. Income Taxes

Income tax comprises current and deferred tax. It is recognized in profit or loss except to the extent that it relates to an item recognized directly in equity or in other comprehensive income.

Current Tax

Current tax comprises the expected tax payable or receivable on the taxable income or loss for the year and any adjustment to the tax payable or receivable in respect of previous years. The amount of current tax reflects the best estimate of the tax amount expected to be paid or received after considering the uncertainty, if any, related to income taxes. It is measured using tax rates (and tax laws) enacted or substantively enacted by the reporting date.

Current tax assets and current tax liabilities are offset only if there is a legally enforceable right to set off the recognized amounts, and it is intended to realize the asset and settle the liability on a net basis or simultaneously.

Tax benefits of deductions earned on exercise of employee stock options in excess of compensation charged to income are credited to other comprehensive income.

Deferred Tax

Deferred tax is recognized in respect of temporary differences between the carrying amounts of assets and liabilities for financial reporting purposes and the corresponding amounts used for taxation purposes. Deferred tax is also recognized in respect of carried forward tax losses and tax credits. Deferred tax is not recognized for:

- Temporary differences arising on the initial recognition of assets or liabilities in a transaction that affects neither accounting nor taxable profit/loss at the time of the transaction.

- Taxable temporary differences arising on the initial recognition of goodwill.

Deferred tax assets are recognized to the extent that it is probable that future taxable profits will be available against which they can be used. The existence of unused tax losses is strong evidence that future taxable profit may not be available. Therefore, in case of a history of recent losses, the Company recognizes a deferred tax asset only to the extent that it has sufficient taxable temporary differences or there is convincing other evidence that sufficient taxable profit will be available against which such deferred tax asset can be realized. Deferred tax assets – unrecognized or recognized, are reviewed at each reporting date and are recognized/ reduced to the extent that it is probable/ no longer probable respectively that the related tax benefit will be realized.

Deferred tax is measured at the tax rates that are expected to apply to the period when the asset is realized or the liability is settled, based on the laws that have been enacted or substantively enacted by the reporting date.

The measurement of deferred tax reflects the tax consequences that would follow from the manner in which the Company expects, at the reporting date, to recover or settle the carrying amount of its assets and liabilities.

Deferred tax assets and liabilities are offset if there is a legally enforceable right to offset current tax liabilities and assets, and they relate to income taxes levied by the same tax authority on the same taxable entity, or on different tax entities, but they intend to settle current tax liabilities and assets on a net basis or their tax assets and liabilities will be realized simultaneously.

Deferred tax in respect of timing differences which reverse after the tax holiday period is recognized in the year in which the timing differences originate.

m. Earnings per Share

Basic earnings/ (loss) per share are calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the year. The weighted average numbers of equity shares outstanding during the year are adjusted for events of bonus issue and share split. For the purpose of calculating diluted earnings/ (loss) per share, the net profit or loss for the year attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the year are adjusted for the effects of all dilutive potential equity shares.

n. Cash and Cash Equivalents

Cash and cash equivalents in the balance sheet comprise cash at banks and on hand and short-term deposits with an original maturity of three months or less, which are subject to an insignificant risk of changes in value.

For the purpose of the statement of cash flows, cash and cash equivalents consist of cash and short-term deposits, as defined above, net of outstanding bank overdrafts as they are considered an integral part of the Company's cash management.

o. Events after the Reporting Period

Adjusting events are events that provide further evidence of conditions that existed at the end of the reporting period. The financial statements are adjusted for such events before authorization for issue. Non-adjusting events are events that are indicative of conditions that arose after the end of the reporting period. Non-adjusting events after the reporting date are not accounted but disclosed.

p. Statement of cash flows

Cash flows are reported using the indirect method, whereby profit/ (loss) before tax is adjusted for the effects of transactions of non-cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments. Cash flow for the year are classified by operating, investing and financing activities.

q. General

Any other accounting policy not specifically referred to are in consistent with the generally accepted accounting principles.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED		
Notes to Financial Statements for the year ending on March 31, 2021		
(Amount in ₹)		
Particulars	As at March 31, 2021	As at March 31, 2020
4 Capital Work-in-Progress includes*		
Capital Work in Progress-Office	2,53,110	-
Capital Work in Progress-Land Acquisition	5,64,125	3,21,027
*Refer Note 35		
Total	8,17,235	3,21,027
5 Intangible Assets Under Development*		
Intangible Assets Under Development-Phase I	65,37,33,979	6,40,791
*Refer Note 35 & 38		
Total	65,37,33,979	6,40,791
6 Investment-Non Current	-	-
7 Deferred tax asset relating to		
Deferred Tax Assets (Net)	-	-
Deferred tax Asset	-	-
Deferred tax Liability relating to	-	-
Net deferred tax Asset	-	-
8 Other Non-Current Assets		
Advance Paid for Capital Asset Work in Progress*		
-Kalpataru Power Transmission Limited (KPTL)	26,35,19,998	13,05,83,569
-Interest Receivable on Mobilisation		
Advance to EPC Contractor**	1,93,96,516	-
Balance With Statutory/Government Authorities****		
TDS Receivable***	-	42,481
GST Receivable	1,53,76,565	35,32,550
Total	29,82,93,079	13,41,58,600
<p>*As on year ended on 31-03-2021 amount of Mobilization Advance and Interest Receivable thereon recoverable in next 12 months is not ascertainable. Hence Mobilization Advance and Interest Receivable thereon being in the nature of Long Term Asset presented under other Non-Current Assets.</p> <p>**Refer Note 3 (ii) e & 38</p> <p>***Refer Note 22</p> <p>****Refer Note 35</p>		

Particulars	As at March 31, 2021	As at March 31, 2020
9 Investment - Current		
Investment in GSFS	97,01,69,424	-
Total	97,01,69,424	-
(a) Aggregate amount of quoted investments & market value thereof;	Nil	Nil
(b) Aggregate amount of unquoted investments	97,01,69,424	Nil
(c) Aggregate amount of impairment in value of investments	Nil	Nil
10 Cash and Cash Equivalents		
Balances with banks		
Union Bank of India A/c 510101007124958	80,04,806	-
Yes Bank Current A/c 018685700000184	4,53,56,812	13,90,076
Total	5,33,61,618	13,90,076
11 Current Tax Assets (Net)	-	-
Total	-	-
12 TAXATION		
TAX EXPENSE RECOGNISED IN STATEMENT OF PROFIT & LOSS		
Current Tax	55,02,582	-
deferred Tax	-	-
Total Tax Expense Recognised in Current Year	55,02,582	-
The Tax Expense for the year can be reconciled to the accounting profit as follows:		
Profit/(Loss) Before Tax and Exceptional Item	70,01,374	(2,10,83,471)
Applicable Tax Rate	27.82	-
Computed Tax Expense	19,47,782	-
TAX EFFECT OF:		
Exempted income	-	-
Expense disallowed (1,27,77,858*27.82%)	35,54,800	-
Additional Allowance net if MAT Credit	-	-
Current Tax Provision	55,02,582	-
Incremental deferred Tax Liability on account of PPE & Intangible Asset	-	-
Incremental deferred Tax Liability /(Asset) on account of Financial Asset & other Item	-	-
deferred tax Provision	-	-
Tax Expense Recognised in statement of Profit & Loss Account	55,02,582	-
Effective Tax Rate	79%	-
Tax on Exceptional Item	-	-

Particulars	As at	
	March 31, 2021	March 31, 2020
13 Other Current Assets	-	-
Total	-	-
14 Equity Share Capital		
Authorised		
78,62,20,000 Equity Shares of ₹ 10 each, fully paid up	7,86,22,00,000	2,25,00,00,000
(22,50,00,000 Equity Shares of ₹ 10 each, fully paid up)*	7,86,22,00,000	2,25,00,00,000
Issued, subscribed		
19,23,75,000 Equity shares of ₹ 10 each, fully paid up	1,92,37,50,000	1,00,00,000
(10,00,000 Equity Shares of ₹ 10 each, fully paid up)*	1,92,37,50,000	1,00,00,000
Paid-up Capital:		
19,23,75,000 Equity shares of ₹ 10 each, fully paid up	1,92,37,50,000	1,00,00,000
(10,00,000 Equity Shares of ₹ 10 each, fully paid up)*	1,92,37,50,000	1,00,00,000

*Figures in bracket represents Previous year's figure

Notes:

(i) Reconciliation of the shares outstanding at the beginning and at the end of the period

Particulars	2020-21		2019-20	
	No of shares	Amount	No of shares	Amount
At the beginning of the year	10,00,000	1,00,00,000	-	-
Add: Issued during the year	19,13,75,000	1,91,37,50,000	10,00,000	1,00,00,000
Outstanding at the end of the year	19,23,75,000	1,92,37,50,000	10,00,000	1,00,00,000

(ii) Terms/rights attached to equity shares

- The Company has only one class of equity shares having a par value of Rs. 10 per share.
- Each holder of the equity shares is entitled to one vote per share.
- In the event of liquidation of the Company, the holders of the equity shares will be entitled to receive assets of the Company remaining after settlement of all liabilities. The distribution will be in proportion of the number of equity shares held by the shareholders.

(iii) Allotment of Shares Under Right Issue

During the year company has allotted 19,13,75,000 numbers of Right Equity Shares of Rs.10/- each to below promoters:

- Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) 10,08,40,000 Right Equity Shares of Rs.10/-each
- Maruti Suzuki India Limited (MSIL) 5,81,70,000 Right Equity Shares of Rs.10/-each
- Gujarat Industrial Development Corporation (GIDC) 3,23,65,000 Right Equity Shares of Rs.10/-each

Particulars	As at March 31, 2021		As at March 31, 2020	
	No of shares	% holding	No. of shares	% holding
(iv) The details of shareholders holding more than 5 % of issued share capital is set out below:				
Name of Shareholder	As at March 31, 2021		As at March 31, 2020	
	No of shares	% holding	No. of shares	% holding
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	10,12,50,000	52.63%	4,10,000	41.00%
Maruti Suzuki India Limited (MSIL)	5,85,00,000	30.41%	3,30,000	33.00%
Gujarat Industrial Development Corporation (GIDC)	3,26,25,000	16.96%	2,60,000	26.00%
As per records of the Company, including its register of shareholders / members, the above shareholding represents legal and beneficial ownership of shares.				
The Company has not issued any Bonus Shares during the year.				
15 Other Equity				
Retained Earnings				
Opening Balance of retained earnings		(3,71,97,406)		(1,61,13,935)
Add/ Less Adjustments during the year		-		-
Net (Loss) / profit for the current year		14,98,792		(2,10,83,471)
Closing Balance		(3,56,98,615)		(3,71,97,406)
Total reserves and surplus		(3,56,98,615)		(3,71,97,406)
16 Share Application Money Pending for Allotment				
Total				
17 Other financial liabilities-Non Current				
Retention Money		2,48,29,068		-
Total		2,48,29,068		-
The Company's exposure to currency and liquidity risks related to other financial liabilities covered in Note 32				
18 Borrowings-Non Current				
Short Term Borrowings*				
Loans and Advances From related parties-Unsecured				
-Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)		-		14,31,27,855
*Refer Note : 37				
Total		-		14,31,27,855
The Company's exposure to currency and liquidity risks related to Borrowing covered in Note 32				

Particulars	As at March 31, 2021	As at March 31, 2020
19 Trade Payable-Current		
Total outstanding dues of Micro and Small enterprises	2,30,926	-
Total outstanding dues of other than Micro and Small Enterprises	-	1,92,68,403
Total	2,30,926	1,92,68,403
The Company's exposure to currency and liquidity risks related to Trade Payables covered in Note 32		
20 Provisions-Current		
Accounting Fees Payable	-	2,77,875
Consultancy / Professional Charges Payable	78,625	27,000
Conveyance Expenses (Lum sum) Payable	-	5,400
Interest Payable	-	5,58,712
Internal Audit Fees Payable	47,033	40,500
Man Power Service Exp Payable	1,40,126	1,30,194
Statutory Audit Fees Payable	46,250	45,000
Vehicle Hire Charges Payable	2,09,418	1,40,580
Provision for Expenses Payable-EPC Contract	5,11,30,383	-
Provision for Expenses Payable-PMC Charges	15,12,158	-
Provision for Expenses Payable-Office	2,37,023	-
Total	5,34,01,016	12,25,261
21 Other current liabilities		
Bid Security/Ernest Money Deposit	1,07,250	-
Statutory Dues Payable		
TDS Payable	28,71,286	86,381
Labour Cess	15,93,482	-
TDS GST Payable	32,93,570	-
Total	78,65,588	86,381
22 Current tax liabilities (net)		
Income Tax Provision- F.Y. 2020-21	55,02,582	-
Less:		
Advance Tax Paid in FY 2020-21	20,00,000	-
Total TDS Receivable	<u>15,05,230</u>	-
Total	19,97,352	-

Particulars	As at March 31, 2021	As at March 31, 2020
23 Other income		
Tender Processing Fee	3,38,980	12,98,305
Miscellaneous Income	8,100	-
Interest Received		
i) Interest on ICDS in GSFS	1,09,93,972	-
ii) Interest on Liquid Deposit	84,35,631	4,24,813
iii) Interest on Income Tax refund	2,549	20
iv) Interest on Saving Bank	-	36,332
Total	1,97,79,232	17,59,470
24 Employee benefit expense, payment to contractors and consultants		
Man Power Services	8,29,336	6,35,003
Total	8,29,336	6,35,003
25 Finance Cost		
Finance Cost(P.Y. Rs. 6,20,791)	43,41,404	-
Less : Amount Transfer to Intangible Asset Under Development-Phase I (P.Y. Rs. 6,20,791)	- 43,41,404	-
*Refer Note No 37 & 38		
Total	-	-
26 Depreciation and amortisation expense		
Depreciation	-	-
Total	-	-
27 Other expenses		
Bank Charges	201	59
Board Meeting Exp	-	24,481
Consultancy / Professional Charges	2,71,847	13,54,597
Feasibility Study Expenses	-	26,85,718
Incorporation Exp	-	-
Interest on payment of TDS	470	1,727
Interest for Income tax	-	10
Office Exp	768	5,099
Office Exps(Preliminary Expenses)	-	-
Round Off	7	3
Stationery & Printing Exp	70,737	18,054
Statutory Audit Fees^	50,000	50,000
Traveling & Conveyance Exp-Others	18,000	85,765
Vehicle Hire Charges	15,18,178	7,14,625
Repairs & Maintenance	19,000	-
Advertisement Expenses*	2,90,038	-

Less: Amount Transfer to Capital Work in Progress	- 2,05,374	84,664	-
EPC Project Development Expenses**	51,46,68,126		-
Less: Amount Transfer to Intangible Asset Under			
Development-Phase I	- 51,46,68,126	-	-
PMC Contract Expense***	6,51,95,746	-	
Less: Amount Transfer to Intangible Asset Under			
Development-Phase I	- 6,51,95,746	-	-
ROC & legal charges****	99,88,650		
Less: Amount Transfer to Intangible Asset Under			
Development-Phase I	-74000	99,14,650	1,72,67,800
Total		1,19,48,522	2,22,07,938
*Refer Note 3(ii)(d) & 35			
** Refer Note 3(ii)(e) & 38			
***Refer Note 36 & 38			
****Refer Note 38			
Other Expenses includes:			
^Auditors Remuneration:			
Statutory Audit Fees		50,000	50,000
Total		50,000	50,000
Other Comprehensive Income (OCI)			
There are no component of other comprehensive income that are required or to be disclosed.			
28 Earnings per share ('EPS')			
Earnings per share is calculated by dividing the net profit/ (loss) attributable to the equity shareholders by the weighted average number of equity shares of Rs.10 each outstanding during the year which is as under:			
Particulars	2020-21	2019-2020	
The following reflects the profit / (Loss) and share data used in the basic and diluted EPS computations:			
Net Profit/(Loss) attributable to equity shareholders	14,98,792	(2,10,83,471)	
Weighted average number of equity shares in computing basic and diluted EPS	8,34,21,781	5,97,260	
Face value of each equity share (Rs. 10)	10	10	
Basic and diluted* Earning Per share	0.02	(35.30)	
* There is no potential equity Shares so Basic and Diluted EPS are Same			
29 Contingent liabilities and capital commitments			
Particulars	2020-21	2019-2020	
Capital Commitment*	2,23,85,85,864	2,50,46,16,431	
Total	2,23,85,85,864	2,50,46,16,431	
*Refer Note 39			

30 Segment Information

In accordance with Ind-As 108, the operating segments used to present segment information are identified on the basis of internal reports used by the Company's Management to allocate resources to the segments and assess their performance.

The Board of Directors is collectively the Company's 'Chief Operating Decision Maker' or 'CODM' within the meaning of Ind AS 108. The indicators used for internal reporting purposes may evolve in connection with performance assessment measures put in place.

Information about geographical areas

The Company do not have any operations in economic environments with different set of risks and returns. Hence, it is considered to be operating in a single geographical segment

31 Dues to Micro, Small and Medium Enterprises

There were no amounts payable to any Micro, Small & Medium Enterprises to whom the company over dues, which are outstanding for more than 45 days as at March 31, 2021.

32 Financial Risk Management Objectives and Policies

The Company is exposed to market risk, credit risk and liquidity risk. The Company's senior management oversees the management of these risks. The Company's senior management is supported by Finance Department that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The Finance department provides assurance to the Company's senior management that the Company's financial risk activities are appropriately governed.

(a) Market Risk

Market Risk is the risk that the fair value of future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market prices comprises interest rate risk. The sensitivity analyses in the following sections relate to the position as at March 31, 2021. The analyses exclude the impact of movements in market variables on; the carrying values of gratuity and other postretirement obligations: provisions; and the non-financial assets and liabilities.

(i) Interest Rate Risk

Interest Rate Risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The borrowings of the Company are interest free and therefore not subject to interest rate risk as defined in Ind AS 107. Borrowing from G-RIDE is bearing interest rate of 9.50%. However, said loan is short term in nature and hence it will not affect future cash flows of the company in long run.

(b) Liquidity Risk

Liquidity Risk is the risk that the Company may not be able to meet its present and future cash and collateral obligations without incurring unacceptable losses. The Company's objective is to, at all times maintain optimum levels of liquidity to meet its cash and collateral requirements. The Company closely monitors its liquidity position and deploys a robust cash management system. It maintains adequate sources of financing including loans from banks at an optimised cost.

(i) The table below summarises the maturity profile of the Company's financial liabilities based on contractual undiscounted payments.

As at March 31, 2021	On demand	Less than 3 months	3 to 12 months	1-5 years	More than 5 years	Total
Borrowings	-	-	-	-	-	-
Trade Payable	-	2,30,926	-	-	-	2,30,926
Other Financial Liabilities- Non Current	-	-	-	2,48,29,068	-	2,48,29,068
As at March 31, 2020						
Borrowings	-	-	14,31,27,855	-	-	14,31,27,855
Trade Payable	-	-	1,92,68,403	-	-	1,92,68,403
Other Financial Liabilities- Non Current	-	-	-	-	-	-

(c) Credit Risk

Credit risk is the risk that counterparty will not meet its obligations under a financial instrument or customer contract, leading to a financial loss. The Company is exposed to credit risk from its operating activities (primarily trade receivables) and from its financing activities, including deposits with banks and financial institutions and other financial instruments.

(i) Trade Receivables

All outstanding customer receivables of the company are regularly monitored. Company has not witnessed any bad debts or long outstanding during the year. Furthermore, all outstanding customers receivables as on reporting date are less than 6 months. Accordingly, trade receivables are subject to extremely low credit risk and management has assessed that no impairment of trade receivables is required.

(ii) Financial Instruments and Cash Deposit

Credit risk from balances with bank and financial institutions is managed by the Company's finance department under the supervision of company's senior management. All balances with banks and financial institutions is subject to low credit risk due to good credit ratings assigned to the Company. This being under the supervision of regulatory authority.

33 Related Party Disclosures

(i) Related Parties and the nature of relationship :

Particular	Current Year	Previous Year
Holding Entity	Gujarat Rail Infrastructure Development Corporation Limited(G-RIDE)	NA
Associate Entity	Maruti Suzuki India Limited(MSIL)	Gujarat Rail Infrastructure Development Corporation Limited(G-RIDE)
		Gujarat Industrial Development Corporation(GIDC)
		Maruti Suzuki India Limited(MSIL)

Entities over which key management personnel and their relatives are able to exercise significant influence

Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)

Key Management Personnel / Executive Director

Shri Santosh Kumar	CEO / Director	
Shri Ashwinikumar Yadav	Chairman	
Shri S N Joshi	CFO	(From 22/9/2020)

Director Non-Executive

Shri Bajrang Warli	Director
Smt. Kavita Shah	Director
Shri Batchu Venugopal	Director
Shri Raj Swarup Kapoor	Director

(ii) Transactions with Related Parties

Summary of transactions /Balances with Related Parties	Holding Entity		Associate Entity		Key management personnel and relatives	
	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020
Loan received	2,89,78,259	-	-	14,31,27,855	-	-
Loan Repaid	17 21 06 114	-	-	-	-	-
Reim. of exp. (Capitalised-CWIP)	-	-	-	20,000	-	-
Other Expenses Paid	-	-	-	26,85,718	-	-
Interest Paid (Capitalised-CWIP)	43,41,404	-	-	6,20,791	-	-
PMC Charges paid (Capitalised-CWIP)	6,51,95,746	-	-	-	-	-
Equity Share Contribution Received	1,00,84,00,000	-	58,17,00,000	-	-	-
Bid Processing Fees- Collected & Transfer	80,000	-	-	-	-	-
Total	1,27,91,01,523	-	58,17,00,000	14,64,54,364	-	-

* During the year Equity Share Contribution has been received of Rs 32,36,50,000 from GIDC on 24th July, 2020.

Balance as at year end	Holding Entity		Associate Entity		Key management personnel and relatives	
	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020	For the year ended March 31, 2021	For the year ended March 31, 2020
Amount Receivable	-	-	-	-	-	-
Amount Payable	-	-	-	16,30,04,889	-	-

34 Fair Value Measurements

Set out below, is a comparison by class of the carrying amounts and fair value of the Company's financial instruments:

Category	As at March 31, 2021		As at March 31, 2020	
	Carrying Value	Fair Value	Carrying Value	Fair Value
1) Financial assets at Amortized Cost				
Trade receivables (current / non current)	-	-	-	-
Cash and Cash equivalents	5,33,61,618	5,33,61,618	13,90,076	13,90,076
Other financial asset (current / non current)	-	-	-	-
Total	5,33,61,618	5,33,61,618	13,90,076	13,90,076
2) Financial Liabilities at Amortized Cost				
Borrowings	-	-	14,31,27,855	14,31,27,855
Trade payables	2,30,926	2,30,926	1,92,68,403	1,92,68,403
Other financial liabilities (current/non current)	2,48,29,068	2,48,29,068	-	-
Total	2,50,59,994	2,50,59,994	16,23,96,258	16,23,96,258

The fair value of the financial assets and liabilities is included at the amount at which the instrument could be exchanged in a current transaction between willing parties, other than in a forced or liquidation sale. Management has assessed that trade receivables, cash and cash equivalents, other bank balances, other financial assets, borrowings, trade payables and other financial liabilities approximate their carrying amounts largely due to the short-term maturities of these instruments.

Fair Value Hierarchy

All financial instruments for which fair value is recognised or disclosed are categorised within the fair value hierarchy, described as follows, based on the lowest level input that is significant to the fair value measurement as a whole.

Level 1: Quoted (unadjusted) prices in active markets for identical assets or liabilities.

Level 2: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement are observable, either directly or indirectly.

Level 3: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement is not based on observable market data.

The following table provides the fair value measurement hierarchy of the Company's assets and liabilities.

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2021:				
Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	-	-	-	-
Cash and Cash equivalents	5,33,61,618	-	-	-
Other financial asset (current/non current)	-	-	-	-
Total	5,33,61,618	-	-	-
Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2021:				
Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial liabilities measured at amortised cost				
Borrowings	-	-	-	-
Trade Payables	2,30,926	-	-	-
Other financial liabilities (current/non current)	2,48,29,068	-	-	-
Total	2,50,59,994	-	-	-
Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2020:				
Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	-	-	-	-
Cash and Cash equivalents	13,90,076	-	-	-
Other financial asset (current/non current)	-	-	-	-
Total	13,90,076	-	-	-

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2020:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial liabilities measured at amortised cost				
Borrowings	14,31,27,855	-	-	-
Trade Payables	1,92,68,403	-	-	-
Other financial liabilities (current/non current)	-	-	-	-
Total	16,23,96,258	-	-	-

35 Impact on previous year figures in Financial Statements due to Re-grouping:

Item Re-grouped	Amount	Grouped under the head in Previous year	Grouped under the head in Current year
Capital Work-in-Progress	3,21,027	Capital Work in Progress	Capital Work in Progress
Capital Work-in-Progress	6,40,791	Capital Work in Progress	Intangible Assets Under Development
Balance With Statutory/ Government Authorities****	35,75,031	Other Current Assets	Other Non-Current Assets

36 Note on Project Management Consultancy to G-RIDE

GRIDE is appointed by BRCL as Project Management Consultant for execution of project of Katosan Road – Becharaji –Chanasma – Ranuj including MSIL siding at the value of 10% of the project cost as approved in the 1st meeting of Board of Director of BRCL held on 09-01-2019. Contract agreement has been executed as on 28.08.2020 for the same.

The PMC charges shall be kept at Original Estimated Cost, which is Rs 452.60 Cr, in two phases for claiming total PMC charges Rs 45.26 cr. Phase-wise PMC charges are as under:

(i) Katosan Road to Becharaji incl MSIL Siding (Phase-I)	19.82 Cr
(ii) Becharaji to Ranuj (Phase-II)	25.44 Cr
Total Sanctioned PMC charge	45.26 Cr

Revised project cost (Phase wise) & PMC charges has been approved in 15th Board Meeting of GRIDE held on 20-08-2020.

As approved in 15th Board Meeting of GRIDE, the details of stage wise PMC charges payable to GRIDE for Phase I of Katosan Road – Becharaji –Chanasma – Ranuj including MSIL siding works out as under:

Sr. No	Stages of PMC	Sanctioned PMC Charges for Phase-I (In INR Cr)	Stage-wise PMC Charges for Phase-I (In Rs. Cr), excluding Taxes
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)	19.82 Crore	5.946 Cr
2	Project Management (45% of sanctioned charges for Phase-I)		8.919 Cr
3	Commissioning & Testing (25% of sanctioned charges for Phase-I)		4.955 Cr

Billing Status as on 31.03.2021

Sr. No	Stages of PMC	Amount certified including GST (INR)	Bill Raised (INR)
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)	-	5,94,60,000
2	Project Management (45% of sanctioned charges for Phase-I) (PMC Charges @ 8.919 Crs for Rs 263.52 Cr* (INR))		
A	IPC-01 at 31-07-2020	2,56,17,036	8,67,025
B	IPC-02 at 21-08-2020	2,30,71,519	7,80,870
C	IPC-03 at 22-09-2020	65,43,872	2,21,481
D	IPC-04 at 12-11-2020	73,92,290	2,50,197
E	IPC-05 at 01-12-2020	3,83,46,283	12,97,854
F	IPC-06 at 23-12-2020	6,45,88,903	21,86,052
G	IPC-07 at 28-01-2021	11,94,46,083	40,42,728
H	IPC-08 at 03-03-2021	8,94,66,617	30,28,054
I	IPC-09 at 19-03-2021	8,90,03,331	30,12,374
J	IPC-10 at 28-04-2021 Amount in Column Bill raised INR is Excluding GST as only provision for the same has been accounted for and not the total invoice (For the month of March 2021)	5,27,20,160	15,12,158
	Total Bill Raised till Now	51,61,96,094	7,66,58,793

37 Note on borrowing from G-RIDE and Interest paid to G-RIDE

Particular	Amount
Opening balance of loan as on 01-04-2020	14,31,27,855
Loan received during the year	2,89,78,259
Less: Loan repaid during the year	17,21,06,114
Closing balance of loan as on 31-03-2021	-

Total interest paid to G-RIDE @ 9.5% Per Annum*	43,41,404
---	-----------

* Interest Paid to G-RIDE has been transferred to Intangible Asset under Development

38 Intangible Assets Under Development
(Amount in ₹)

Sr. No.	Category of works / Item Description	IPC Bill	Price Variation Bill	2020-21	2019-20
i	Civil & Track Works				
	Project Facilities	1,34,53,782			
	Earthwork	8,82,07,843	22,20,513		
	Protection work	2,50,86,258	-		
	RUBs	1,84,62,778	1,81,974		
	Track Works	27,87,48,744	14,26,594		
	Other Civil Engineering works including				
	FOB & Subways	9,419,117	3,17,166	43,75,24,767	-
ii	Signalling Works	3,08,04,434	2,44,363	31,048,796	-
iii	Telecommunication works	1,05,08,356	(1,97,031)	1,03,11,325	-
iv	Electrification (OHE Works)				
	Overhead Equipment Work, Modification of OHE, TSS, SS	3,02,52,237	-	3,02,52,237	-
v	General Electrical Works (GEW)				
	Modification of HT power lines crossings up to 33 KV (replacement by UG cabling)	56,03,956	(72,955)	55,31,001	-
vi	Project management Consultancy Charges			6,51,95,746	-
vii	Payment to GETCO for electrical work			2,90,37,259	20,000
viii	Site cleaning work			1,21,125	-
ix	Interest on Loan from G-RIDE			43,41,404	6,20,791
x	Payment for Rails Purchased from Railway			2,82,53,106	-
xi	Payment for Additional Feeder Bay			3,09,20,949	-
	Sub Total			67,25,37,715	6,40,791
	Less : Interest on Mobilization Advance*			1,94,44,527	-
	Total Intangible Assets Under Development			65,30,93,188	6,40,791
	Total Intangible Assets Under Development year ended 31st March 2021 & 31st March 2020			65,37,33,979	6,40,791

* Interest on Mobilization Advance includes Rs 4,80,166 pertains to prior period

39 Capital Commitment			
For the year ended 31st March 2021			
Name of party with whom Contract Executed	Total value of contract	Contract value Executed till March 2021	Remaining Contract value
Kalptaru Power Transmission Limited-EPC Contract	2,63,52,00,000	77,40,67,505	1,86,11,32,495
Gujarat Rail Infrastructure Development Corporation Limited-PMC Contract	45,26,00,000	7,51,46,631	37,74,53,369
Total Capital Commitment	3,08,78,00,000	84,92,14,136	2,23,85,85,864
For the year ended 31st March 2020			
Name of party with whom Contract Executed	Total value of contract	Contract value Executed till March 2021	Remaining Contract value
Kalptaru Power Transmission Limited-EPC Contract	2,63,52,00,000	13,05,83,569	2,50,46,16,431
Total Capital Commitment			2,50,46,16,431
40 Figures of previous year have been re-grouped/ re-classified wherever necessary to make them comparable with current year.			
Signatories to Note 1 to 40			
<p>As per our report of even date</p> <p>For Shah & Dalal For and on behalf of the Board</p> <p>Chartered Accountants</p> <p>FRN. 109432W</p>			
sd/-	sd/-	sd/-	sd/-
Malay Dalal	S. N. Joshi	B. C. Warli	Santosh Kumar
Partner	CFO	Director	Director / CEO
Membership No. 036776		DIN: 07133942	DIN: 07854179
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: July 16, 2021	Date: July 16, 2021		